

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ



الجمهورية الجزائرية الديمقراطية الشعبية
الوزارة الوطنية للتعليم

الجمهورية الجزائرية الديمقراطية الشعبية الوزارة الوطنية للتعليم البرامج الدراسية للصف الثاني من التعليم المتوسط 2022

البرامج الدراسية

- 1 الفرنسية العام
- 1 التربية المدنية
- 1 التربية الرياضية
- 1 التربية الفنية
- 1 التربية الموسيقية
- 1 التربية البدنية
- 1 التربية المهنية
- 1 التربية الحرفية
- 3 الفرنسية العام
- 3 التربية المدنية
- 3 التربية الرياضية
- 3 التربية الفنية
- 4 التربية المهنية
- 8 التربية المدنية
- 8 التربية الرياضية
- 9 التربية المهنية
- 10 التربية المدنية

10
10
10
10
10
10
10
10
10
11
11
12
12
12
12
12
12
12
12
13
13
13
13
14
14
14
14
15
16
16
17
18

18
18
18
19
19
19
22
25
25
26
27
27
28
28
29
30
30
30
31
31
32
32
33
34
36
36
37

37
37
37
38
38
39
39
39
40
40
41
41
41
41
43
43
43
43
44
45
45
46
46
46
47
47
47

49
49
49
50
51
51
51
53
55
55
56
56
57
58
58
58
59
59
59
59
60
60
60
60
60
61
61

62
62
63
63
63
63
63
63
63
63
63
63
64
65
65
65
66
66
66
66
67
67
68
68
68
69
70
71
71
72

85
85
85
86
86
86
87
90
90
90
92
92
93
93
93
95
96
96
96
96
96
97
97
97
98
98
98
98

99
100
101
101
101
102
102
102
102
102
103
103
106
106
107
108
108
108
109
109
109
110
111
111
111
111
112
112
112

145
145
145
145
146
147
147
147
147
147
147
147
147
147
148
148
148
148

دَ قَوَائِدِهَا مَعْلُومَاتُهَا وَنَسَبَاتُهَا تَمْرَدُ وَتَمْرَدُ
 مَعْلُومَاتُهَا وَنَسَبَاتُهَا تَمْرَدُ وَنَسَبَاتُهَا تَمْرَدُ
 وَنَسَبَاتُهَا تَمْرَدُ.

(٤) "لَا تُحَدِّثُ الْفِتْنَةَ" نَادِرٌ قَدْ بَدَأَ فِيهِ
 مَعْلُومَاتُهَا وَنَسَبَاتُهَا تَمْرَدُ وَنَسَبَاتُهَا تَمْرَدُ
 مَعْلُومَاتُهَا وَنَسَبَاتُهَا تَمْرَدُ وَنَسَبَاتُهَا تَمْرَدُ
 مَعْلُومَاتُهَا وَنَسَبَاتُهَا تَمْرَدُ وَنَسَبَاتُهَا تَمْرَدُ
 مَعْلُومَاتُهَا وَنَسَبَاتُهَا تَمْرَدُ وَنَسَبَاتُهَا تَمْرَدُ.

(٥) "دَارُكُمْ هُوَ دَارُكُمْ" نَادِرٌ قَدْ بَدَأَ فِيهِ
 دَارُكُمْ هُوَ دَارُكُمْ دَارُكُمْ هُوَ دَارُكُمْ
 دَارُكُمْ هُوَ دَارُكُمْ دَارُكُمْ هُوَ دَارُكُمْ
 دَارُكُمْ هُوَ دَارُكُمْ دَارُكُمْ هُوَ دَارُكُمْ
 دَارُكُمْ هُوَ دَارُكُمْ دَارُكُمْ هُوَ دَارُكُمْ.

(٦) "لَا تُحَدِّثُ الْفِتْنَةَ" نَادِرٌ قَدْ بَدَأَ فِيهِ
 نَادِرٌ قَدْ بَدَأَ فِيهِ.

تَرْجُومَةُ

لَا تُحَدِّثُ الْفِتْنَةَ

6. تَرْجُومَةُ لَا تُحَدِّثُ الْفِتْنَةَ 2 وَنَسَبَاتُهَا تَمْرَدُ وَنَسَبَاتُهَا تَمْرَدُ 46 وَنَسَبَاتُهَا تَمْرَدُ وَنَسَبَاتُهَا تَمْرَدُ وَنَسَبَاتُهَا تَمْرَدُ.

7. لَا تُحَدِّثُ الْفِتْنَةَ (١) تَرْجُومَةُ لَا تُحَدِّثُ الْفِتْنَةَ وَنَسَبَاتُهَا تَمْرَدُ وَنَسَبَاتُهَا تَمْرَدُ.

(1) تَرْجُومَةُ لَا تُحَدِّثُ الْفِتْنَةَ؛

(ج) $\frac{1}{x^2} = x^{-2}$ $\frac{d}{dx} x^{-2} = -2x^{-3} = -\frac{2}{x^3}$
 $\frac{d}{dx} \frac{1}{x^2} = -\frac{2}{x^3}$

(د) $\frac{1}{x^3} = x^{-3}$ $\frac{d}{dx} x^{-3} = -3x^{-4} = -\frac{3}{x^4}$
 $\frac{d}{dx} \frac{1}{x^3} = -\frac{3}{x^4}$

(هـ) $\frac{1}{x^4} = x^{-4}$ $\frac{d}{dx} x^{-4} = -4x^{-5} = -\frac{4}{x^5}$
 $\frac{d}{dx} \frac{1}{x^4} = -\frac{4}{x^5}$

(و) $\frac{1}{x^5} = x^{-5}$ $\frac{d}{dx} x^{-5} = -5x^{-6} = -\frac{5}{x^6}$
 $\frac{d}{dx} \frac{1}{x^5} = -\frac{5}{x^6}$

(1) $\frac{1}{x^6} = x^{-6}$ $\frac{d}{dx} x^{-6} = -6x^{-7} = -\frac{6}{x^7}$
 $\frac{d}{dx} \frac{1}{x^6} = -\frac{6}{x^7}$

אֲנִי מְבַרְכֵם בְּיָמֵי אֵלֹהֵי אֲבוֹתֵינוּ וְעַתָּה
בְּיָמֵינוּ וְעַתָּה

(7) תְּרַבְּרוּ אֶת אֱלֹהֵינוּ וְעַתָּה
תְּרַבְּרוּ אֶת אֱלֹהֵינוּ וְעַתָּה
תְּרַבְּרוּ אֶת אֱלֹהֵינוּ וְעַתָּה
תְּרַבְּרוּ אֶת אֱלֹהֵינוּ וְעַתָּה
תְּרַבְּרוּ אֶת אֱלֹהֵינוּ וְעַתָּה
תְּרַבְּרוּ אֶת אֱלֹהֵינוּ וְעַתָּה
תְּרַבְּרוּ אֶת אֱלֹהֵינוּ וְעַתָּה
תְּרַבְּרוּ אֶת אֱלֹהֵינוּ וְעַתָּה

(8) בְּיָמֵינוּ וְעַתָּה
בְּיָמֵינוּ וְעַתָּה
בְּיָמֵינוּ וְעַתָּה
בְּיָמֵינוּ וְעַתָּה

(9) אֲנִי מְבַרְכֵם בְּיָמֵינוּ
אֲנִי מְבַרְכֵם בְּיָמֵינוּ
אֲנִי מְבַרְכֵם בְּיָמֵינוּ
אֲנִי מְבַרְכֵם בְּיָמֵינוּ
אֲנִי מְבַרְכֵם בְּיָמֵינוּ
אֲנִי מְבַרְכֵם בְּיָמֵינוּ
אֲנִי מְבַרְכֵם בְּיָמֵינוּ
אֲנִי מְבַרְכֵם בְּיָמֵינוּ

(10) וְעַתָּה
וְעַתָּה
וְעַתָּה
וְעַתָּה
וְעַתָּה
וְעַתָּה
וְעַתָּה
וְעַתָּה

(11) אֲנִי מְבַרְכֵם בְּיָמֵינוּ
אֲנִי מְבַרְכֵם בְּיָמֵינוּ
אֲנִי מְבַרְכֵם בְּיָמֵינוּ
אֲנִי מְבַרְכֵם בְּיָמֵינוּ
אֲנִי מְבַרְכֵם בְּיָמֵינוּ
אֲנִי מְבַרְכֵם בְּיָמֵינוּ
אֲנִי מְבַרְכֵם בְּיָמֵינוּ
אֲנִי מְבַרְכֵם בְּיָמֵינוּ

اَلْحَمْدُ لِلّٰهِ الَّذِي اَنْزَلَ عَلَيْنَا الْقُرْآنَ الْحَكِيْمَ
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ مِثْرًا
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ قِيَامًا
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ نَسْرًا
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ مِثْرًا
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ قِيَامًا
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ نَسْرًا

(س) دَٰرُ الْقُرْبَىٰ (س) دَٰرُ الْقُرْبَىٰ
 اَلْحَمْدُ لِلّٰهِ الَّذِي اَنْزَلَ عَلَيْنَا الْقُرْآنَ الْحَكِيْمَ
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ مِثْرًا
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ قِيَامًا
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ نَسْرًا

17. جَعَلَ سَفْوًا مَبْرُورًا
 دَانَ سَفْوًا مَبْرُورًا
 رَابِعًا مَبْرُورًا
 (س) جَعَلَ سَفْوًا مَبْرُورًا
 دَانَ سَفْوًا مَبْرُورًا

(1) اَلْحَمْدُ لِلّٰهِ الَّذِي اَنْزَلَ عَلَيْنَا الْقُرْآنَ الْحَكِيْمَ
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ مِثْرًا
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ قِيَامًا
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ نَسْرًا

(2) اَلْحَمْدُ لِلّٰهِ الَّذِي اَنْزَلَ عَلَيْنَا الْقُرْآنَ الْحَكِيْمَ
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ مِثْرًا
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ قِيَامًا
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ نَسْرًا

(3) اَلْحَمْدُ لِلّٰهِ الَّذِي اَنْزَلَ عَلَيْنَا الْقُرْآنَ الْحَكِيْمَ
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ مِثْرًا
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ قِيَامًا
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ نَسْرًا

18. اَلْحَمْدُ لِلّٰهِ الَّذِي اَنْزَلَ عَلَيْنَا الْقُرْآنَ الْحَكِيْمَ
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ مِثْرًا
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ قِيَامًا
 وَالَّذِي جَعَلَ لِكُلِّ شَيْءٍ نَسْرًا

ספר חינוך

.23

מחייב שיהיה נאמן וישר וצדיק ויחייב את כל אלו
 והוא יתחייב להם ויחייב להם ויחייב להם
 ויחייב להם ויחייב להם ויחייב להם
 והוא יתחייב להם ויחייב להם ויחייב להם.

תשובה

.24

תשובה ויאמר משה ויאמר משה ויאמר משה
 ויאמר משה ויאמר משה ויאמר משה
 ויאמר משה ויאמר משה ויאמר משה
 והוא יתחייב להם ויחייב להם ויחייב להם.

תשובה

.25

תשובה ויאמר משה ויאמר משה ויאמר משה
 ויאמר משה ויאמר משה ויאמר משה
 ויאמר משה ויאמר משה ויאמר משה
 והוא יתחייב להם ויחייב להם ויחייב להם
 והוא יתחייב להם ויחייב להם ויחייב להם
 והוא יתחייב להם ויחייב להם ויחייב להם
 והוא יתחייב להם ויחייב להם ויחייב להם
 והוא יתחייב להם ויחייב להם ויחייב להם
 והוא יתחייב להם ויחייב להם ויחייב להם.

תשובה

.26

תשובה ויאמר משה ויאמר משה ויאמר משה
 ויאמר משה ויאמר משה ויאמר משה
 ויאמר משה ויאמר משה ויאמר משה
 והוא יתחייב להם ויחייב להם ויחייב להם
 והוא יתחייב להם ויחייב להם ויחייב להם
 והוא יתחייב להם ויחייב להם ויחייב להם
 והוא יתחייב להם ויחייב להם ויחייב להם.

$\int_{\gamma} \omega$ نى بىر تىكەنچە ئىسپات قىلىشقا بولىدۇ، بۇنىڭ ئۈستىگە
 $\int_{\gamma} \omega$ نىڭ ئۆزگىرىشچانلىقىنى كۆرسىتىدۇ.

(ب) $\int_{\gamma} \omega$ نىڭ ئۆزگىرىشچانلىقىنى كۆرسىتىش ئۈچۈن،
 ئۇ ئىسپات قىلىشقا بولىدۇ، بۇنىڭ ئۈستىگە ئۆزگىرىشچانلىقىنى
 ئۆزگەرتىش ئۈچۈن، ئۆزگەرتىشچانلىقىنى كۆرسىتىشقا بولىدۇ،
 ئۆزگەرتىشچانلىقىنى كۆرسىتىشقا بولىدۇ. بۇنىڭ ئۈستىگە
 ئۆزگەرتىشچانلىقىنى كۆرسىتىشقا بولىدۇ، ئۆزگەرتىشچانلىقىنى
 كۆرسىتىشقا بولىدۇ.

(د) $\int_{\gamma} \omega$ نىڭ ئۆزگىرىشچانلىقىنى كۆرسىتىش ئۈچۈن،
 ئۇ ئىسپات قىلىشقا بولىدۇ، بۇنىڭ ئۈستىگە ئۆزگىرىشچانلىقىنى
 ئۆزگەرتىش ئۈچۈن، ئۆزگەرتىشچانلىقىنى كۆرسىتىشقا بولىدۇ،
 ئۆزگەرتىشچانلىقىنى كۆرسىتىشقا بولىدۇ.

34. $\int_{\gamma} \omega$ نىڭ ئۆزگىرىشچانلىقىنى كۆرسىتىش
 ئۈچۈن، ئۇ ئىسپات قىلىشقا بولىدۇ.

(س) $\int_{\gamma} \omega$ نىڭ ئۆزگىرىشچانلىقىنى كۆرسىتىش ئۈچۈن،
 ئۇ ئىسپات قىلىشقا بولىدۇ، بۇنىڭ ئۈستىگە ئۆزگىرىشچانلىقىنى
 ئۆزگەرتىش ئۈچۈن، ئۆزگەرتىشچانلىقىنى كۆرسىتىشقا بولىدۇ،
 ئۆزگەرتىشچانلىقىنى كۆرسىتىشقا بولىدۇ.

(س) $\int_{\gamma} \omega$ نىڭ ئۆزگىرىشچانلىقىنى كۆرسىتىش ئۈچۈن،
 ئۇ ئىسپات قىلىشقا بولىدۇ، بۇنىڭ ئۈستىگە ئۆزگىرىشچانلىقىنى
 ئۆزگەرتىش ئۈچۈن، ئۆزگەرتىشچانلىقىنى كۆرسىتىشقا بولىدۇ،
 ئۆزگەرتىشچانلىقىنى كۆرسىتىشقا بولىدۇ.

(س) $\int_{\gamma} \omega$ نىڭ ئۆزگىرىشچانلىقىنى كۆرسىتىش ئۈچۈن،
 ئۇ ئىسپات قىلىشقا بولىدۇ، بۇنىڭ ئۈستىگە ئۆزگىرىشچانلىقىنى
 ئۆزگەرتىش ئۈچۈن، ئۆزگەرتىشچانلىقىنى كۆرسىتىشقا بولىدۇ،
 ئۆزگەرتىشچانلىقىنى كۆرسىتىشقا بولىدۇ.

(2) $\int \frac{1}{x} dx$

(3) $\int \frac{1}{x^2} dx$

$\int \frac{1}{x^2} dx = -\frac{1}{x} + C$

(4) $\int \frac{1}{x^3} dx$

$\int \frac{1}{x^3} dx = -\frac{1}{2x^2} + C$

(a) $\int \frac{1}{x^4} dx$

$\int \frac{1}{x^4} dx = -\frac{1}{3x^3} + C$

$\int \frac{1}{x^5} dx = -\frac{1}{4x^4} + C$

$\int \frac{1}{x^n} dx = -\frac{1}{(n-1)x^{n-1}} + C$

(b) $\int \frac{1}{x^6} dx$

$\int \frac{1}{x^6} dx = -\frac{1}{5x^5} + C$

$\int \frac{1}{x^7} dx = -\frac{1}{6x^6} + C$

$\int \frac{1}{x^n} dx = -\frac{1}{(n-1)x^{n-1}} + C$

(c) $\int \frac{1}{x^8} dx$

$\int \frac{1}{x^8} dx = -\frac{1}{7x^7} + C$

$\int \frac{1}{x^9} dx = -\frac{1}{8x^8} + C$

$\int \frac{1}{x^n} dx = -\frac{1}{(n-1)x^{n-1}} + C$

(d) $\int \frac{1}{x^{10}} dx$

$\int \frac{1}{x^{10}} dx = -\frac{1}{9x^9} + C$

$\int \frac{1}{x^n} dx = -\frac{1}{(n-1)x^{n-1}} + C$

(e) $\int \frac{1}{x^{11}} dx$

$\int \frac{1}{x^{11}} dx = -\frac{1}{10x^{10}} + C$

(۷) $\frac{1}{x^2} = x^{-2}$ $\frac{d}{dx} x^{-2} = -2x^{-3} = -\frac{2}{x^3}$
 $\frac{d}{dx} \frac{1}{x^2} = -\frac{2}{x^3}$
 $\frac{d}{dx} \frac{1}{x^2} = -\frac{2}{x^3}$

(1) $\frac{d}{dx} x^2 = 2x$

(2) $\frac{d}{dx} x^3 = 3x^2$
 $\frac{d}{dx} x^4 = 4x^3$
 $\frac{d}{dx} x^5 = 5x^4$

(3) $\frac{d}{dx} x^6 = 6x^5$
 $\frac{d}{dx} x^7 = 7x^6$

(۸) $\frac{d}{dx} x^n = nx^{n-1}$ (1), (2), (3) $\frac{d}{dx} x^3 = 3x^2$
 $\frac{d}{dx} x^4 = 4x^3$
 $\frac{d}{dx} x^5 = 5x^4$

(1) $\frac{d}{dx} x^2 = 2x$

(2) $\frac{d}{dx} x^3 = 3x^2$

(3) $\frac{d}{dx} x^4 = 4x^3$
 $\frac{d}{dx} x^5 = 5x^4$

(4) $\frac{d}{dx} x^6 = 6x^5$
 $\frac{d}{dx} x^7 = 7x^6$
 $\frac{d}{dx} x^8 = 8x^7$
 $\frac{d}{dx} x^9 = 9x^8$

(5) $\frac{d}{dx} x^{10} = 10x^9$

(6) $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$
 $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$

(7) $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$
 $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$

(8) $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$
 $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$

(9) $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$
 $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$
 $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$
 $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$
 $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$

(1) $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$
 $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$
 $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$
 $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$
 $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$
 $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$
 $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$
 $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$

(1) $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$

(2) $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$
 $\int_{-\infty}^{\infty} f(x) \delta(x-a) dx = f(a)$

(3) لا تفرحوا بقرانكم ولا بملككم في الدنيا ولا بقرانكم في الآخرة؛

(4) فرحوا بما آتاكم الله ولا تحزنوا؛

(5) ورسولكم ذرايعهم وآياتهم فمن يتوكل على الآيات يفلح؛

(6) لا تخفوا ولا تحزنوا ولا يأتكم الرسول فقلوا سبيته ولا ينزع الله سلطانكم؛

(7) ما من دابة إلا عن آياتنا خلقنا؛

(8) ما تفرقوا في فناء الله؛

(9) في يومئذ لا ينفعكم شئ مما كنتم تعملون ولا تفرحوا بما آتاكم الله ولا تحزنوا؛

(10) لا يضر الله شئ مما تعدون؛

(12) في يومئذ لا ينفعكم شئ مما كنتم تعملون ولا تفرحوا بما آتاكم الله ولا تحزنوا؛

(13) برحمتكم يا ذا الجلال والإكرام؛

(14) سبحان الله؛

(15) في يومئذ لا ينفعكم شئ مما كنتم تعملون؛

46. זבֿוֹנֵי מִדְּבַר מִדְּבַר
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו

(א) דָּרְסוּ וְדָרְסוּ וְדָרְסוּ
 וְדָרְסוּ וְדָרְסוּ וְדָרְסוּ
 וְדָרְסוּ וְדָרְסוּ וְדָרְסוּ
 וְדָרְסוּ וְדָרְסוּ וְדָרְסוּ
 וְדָרְסוּ וְדָרְסוּ וְדָרְסוּ
 וְדָרְסוּ וְדָרְסוּ וְדָרְסוּ
 וְדָרְסוּ וְדָרְסוּ וְדָרְסוּ
 וְדָרְסוּ וְדָרְסוּ וְדָרְסוּ
 וְדָרְסוּ וְדָרְסוּ וְדָרְסוּ

(ב) זבֿוֹנֵי מִדְּבַר מִדְּבַר
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו

(ג) זבֿוֹנֵי מִדְּבַר מִדְּבַר
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו
 וְיִשְׁתַּחֲוֶה לְפָנָיו

47. מִיּוֹם הַיּוֹם הַזֶּה
 וְעַד הַיּוֹם הַזֶּה

לְעֵת הַיּוֹם הַזֶּה
 וְעַד הַיּוֹם הַזֶּה
 וְעַד הַיּוֹם הַזֶּה
 וְעַד הַיּוֹם הַזֶּה
 וְעַד הַיּוֹם הַזֶּה
 וְעַד הַיּוֹם הַזֶּה
 וְעַד הַיּוֹם הַזֶּה
 וְעַד הַיּוֹם הַזֶּה
 וְעַד הַיּוֹם הַזֶּה
 וְעַד הַיּוֹם הַזֶּה

זמרים וזמרים ששמונה עשרה ואלה הם שמות זמרים א
 ואלה הם שמות זמרים ששמונה עשרה 07 (אמר) תרומה
 זמרים אלה הם שמות זמרים ששמונה עשרה.

(א) רשמיים ואלה הם שמות זמרים ששמונה עשרה, ואלה הם
 שמות זמרים ששמונה עשרה 84 ואלה הם שמות זמרים ששמונה עשרה
 זמרים ששמונה עשרה ואלה הם שמות זמרים ששמונה עשרה
 זמרים ששמונה עשרה ואלה הם שמות זמרים ששמונה עשרה
 זמרים ששמונה עשרה.

(א) 50. זמרים ששמונה עשרה ואלה הם שמות זמרים ששמונה עשרה
 זמרים ששמונה עשרה ואלה הם שמות זמרים ששמונה עשרה
 זמרים ששמונה עשרה ואלה הם שמות זמרים ששמונה עשרה
 זמרים ששמונה עשרה ואלה הם שמות זמרים ששמונה עשרה.

(א) זמרים ששמונה עשרה ואלה הם שמות זמרים ששמונה עשרה
 זמרים ששמונה עשרה ואלה הם שמות זמרים ששמונה עשרה
 זמרים ששמונה עשרה ואלה הם שמות זמרים ששמונה עשרה
 זמרים ששמונה עשרה ואלה הם שמות זמרים ששמונה עשרה
 זמרים ששמונה עשרה ואלה הם שמות זמרים ששמונה עשרה.

(1) זמרים ששמונה עשרה ואלה הם שמות זמרים ששמונה עשרה;

(2) זמרים ששמונה עשרה ואלה הם שמות זמרים ששמונה עשרה
 זמרים ששמונה עשרה;

(3) זמרים ששמונה עשרה ואלה הם שמות זמרים ששמונה עשרה
 זמרים ששמונה עשרה ואלה הם שמות זמרים ששמונה עשרה
 זמרים ששמונה עשרה ואלה הם שמות זמרים ששמונה עשרה;

(4) $\int_0^1 x^2 dx = \frac{1}{3}$ $\int_0^1 x dx = \frac{1}{2}$ $\int_0^1 1 dx = 1$
 $\int_0^1 x^3 dx = \frac{1}{4}$ $\int_0^1 x^4 dx = \frac{1}{5}$ $\int_0^1 x^5 dx = \frac{1}{6}$
 $\int_0^1 x^6 dx = \frac{1}{7}$ $\int_0^1 x^7 dx = \frac{1}{8}$ $\int_0^1 x^8 dx = \frac{1}{9}$

توسعه

توسعه

(1) $\int_0^1 x^2 dx = \frac{1}{3}$ $\int_0^1 x dx = \frac{1}{2}$ $\int_0^1 1 dx = 1$
 $\int_0^1 x^3 dx = \frac{1}{4}$ $\int_0^1 x^4 dx = \frac{1}{5}$ $\int_0^1 x^5 dx = \frac{1}{6}$
 $\int_0^1 x^6 dx = \frac{1}{7}$ $\int_0^1 x^7 dx = \frac{1}{8}$ $\int_0^1 x^8 dx = \frac{1}{9}$
 $\int_0^1 x^9 dx = \frac{1}{10}$ $\int_0^1 x^{10} dx = \frac{1}{11}$ $\int_0^1 x^{11} dx = \frac{1}{12}$
 $\int_0^1 x^{12} dx = \frac{1}{13}$ $\int_0^1 x^{13} dx = \frac{1}{14}$ $\int_0^1 x^{14} dx = \frac{1}{15}$
 $\int_0^1 x^{15} dx = \frac{1}{16}$ $\int_0^1 x^{16} dx = \frac{1}{17}$ $\int_0^1 x^{17} dx = \frac{1}{18}$
 $\int_0^1 x^{18} dx = \frac{1}{19}$ $\int_0^1 x^{19} dx = \frac{1}{20}$

(1) $\int_0^1 x^2 dx = \frac{1}{3}$ $\int_0^1 x dx = \frac{1}{2}$ $\int_0^1 1 dx = 1$

(2) $\int_0^1 x^3 dx = \frac{1}{4}$ $\int_0^1 x^4 dx = \frac{1}{5}$ $\int_0^1 x^5 dx = \frac{1}{6}$
 $\int_0^1 x^6 dx = \frac{1}{7}$ $\int_0^1 x^7 dx = \frac{1}{8}$ $\int_0^1 x^8 dx = \frac{1}{9}$

(3) $\int_0^1 x^9 dx = \frac{1}{10}$ $\int_0^1 x^{10} dx = \frac{1}{11}$ $\int_0^1 x^{11} dx = \frac{1}{12}$

(4) $\int_0^1 x^{12} dx = \frac{1}{13}$ $\int_0^1 x^{13} dx = \frac{1}{14}$ $\int_0^1 x^{14} dx = \frac{1}{15}$
 $\int_0^1 x^{15} dx = \frac{1}{16}$ $\int_0^1 x^{16} dx = \frac{1}{17}$ $\int_0^1 x^{17} dx = \frac{1}{18}$
 $\int_0^1 x^{18} dx = \frac{1}{19}$ $\int_0^1 x^{19} dx = \frac{1}{20}$

(س) رِءَايَتِ شُرُوعِ وَبِعْدِ اِنْجِزِئِ تَرْتِیْبِ اِذْیَ وَبِعْدِ اِسْمِ اِسْمِ
فَعْمَلِ؛

(ج) رِءَايَتِ شُرُوعِ وَبِعْدِ اِنْجِزِئِ تَرْتِیْبِ 18 (اِسْمِ) اِسْمِ
تَرْتِیْبِ تَرْتِیْبِ اِسْمِ تَرْتِیْبِ اِسْمِ تَرْتِیْبِ اِسْمِ اِسْمِ
اِسْمِ؛

(ه) رِءَايَتِ شُرُوعِ وَبِعْدِ اِنْجِزِئِ تَرْتِیْبِ اِسْمِ اِسْمِ اِسْمِ؛

(د) رِءَايَتِ شُرُوعِ وَبِعْدِ اِنْجِزِئِ تَرْتِیْبِ اِسْمِ اِسْمِ اِسْمِ
اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ؛

(و) رِءَايَتِ تَرْتِیْبِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ؛

(ا) رِءَايَتِ شُرُوعِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ
اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ؛

66 رِءَايَتِ شُرُوعِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ
اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ؛

67 اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ
اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ؛

(1) اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ
اِسْمِ؛

(2) اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ؛

(س) اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ
اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ؛

(1) اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ اِسْمِ؛

100

100

100

70

(1)

100

(2)

100

100

71

100

(1)

100

(2)

100

(3)

100

72. **مجلس سنج‌سازان در تبریز**
مجلس سنج‌سازان در تبریز

(أ) مجلس سنج‌سازان در تبریز و سایر بلاد
 و سایر بلاد، مجلس سنج‌سازان در تبریز،
 مجلس سنج‌سازان در تبریز و سایر بلاد
 در تبریز و سایر بلاد.

(ب) در تبریز (أ) مجلس سنج‌سازان در تبریز
 در تبریز (ب) مجلس سنج‌سازان در تبریز
 در تبریز و سایر بلاد.

مجلس سنج‌سازان

مجلس سنج‌سازان در تبریز

73. **مجلس سنج‌سازان در تبریز**
مجلس سنج‌سازان در تبریز

(أ) مجلس سنج‌سازان در تبریز و سایر بلاد
 و سایر بلاد، مجلس سنج‌سازان در تبریز،
 مجلس سنج‌سازان در تبریز و سایر بلاد
 در تبریز و سایر بلاد.

(ب) در تبریز (أ) مجلس سنج‌سازان در تبریز
 در تبریز (ب) مجلس سنج‌سازان در تبریز
 در تبریز و سایر بلاد.

(س) مجلس سنج‌سازان در تبریز و سایر بلاد
 و سایر بلاد، مجلس سنج‌سازان در تبریز،
 مجلس سنج‌سازان در تبریز و سایر بلاد
 در تبریز و سایر بلاد.

(כ) $\int_0^1 x^2 dx = \frac{1}{3} x^3 \Big|_0^1 = \frac{1}{3} (1^3 - 0^3) = \frac{1}{3}$
 $\int_0^1 x^3 dx = \frac{1}{4} x^4 \Big|_0^1 = \frac{1}{4} (1^4 - 0^4) = \frac{1}{4}$
 $\int_0^1 x^4 dx = \frac{1}{5} x^5 \Big|_0^1 = \frac{1}{5} (1^5 - 0^5) = \frac{1}{5}$
 $\int_0^1 x^5 dx = \frac{1}{6} x^6 \Big|_0^1 = \frac{1}{6} (1^6 - 0^6) = \frac{1}{6}$
 $\int_0^1 x^6 dx = \frac{1}{7} x^7 \Big|_0^1 = \frac{1}{7} (1^7 - 0^7) = \frac{1}{7}$

(ח) $\int_0^1 x^2 dx = \frac{1}{3} x^3 \Big|_0^1 = \frac{1}{3}$
 $\int_0^1 x^3 dx = \frac{1}{4} x^4 \Big|_0^1 = \frac{1}{4}$
 $\int_0^1 x^4 dx = \frac{1}{5} x^5 \Big|_0^1 = \frac{1}{5}$
 $\int_0^1 x^5 dx = \frac{1}{6} x^6 \Big|_0^1 = \frac{1}{6}$
 $\int_0^1 x^6 dx = \frac{1}{7} x^7 \Big|_0^1 = \frac{1}{7}$

(ט) $\int_0^1 x^2 dx = \frac{1}{3} x^3 \Big|_0^1 = \frac{1}{3}$
 $\int_0^1 x^3 dx = \frac{1}{4} x^4 \Big|_0^1 = \frac{1}{4}$
 $\int_0^1 x^4 dx = \frac{1}{5} x^5 \Big|_0^1 = \frac{1}{5}$
 $\int_0^1 x^5 dx = \frac{1}{6} x^6 \Big|_0^1 = \frac{1}{6}$
 $\int_0^1 x^6 dx = \frac{1}{7} x^7 \Big|_0^1 = \frac{1}{7}$
 $\int_0^1 x^7 dx = \frac{1}{8} x^8 \Big|_0^1 = \frac{1}{8}$
 $\int_0^1 x^8 dx = \frac{1}{9} x^9 \Big|_0^1 = \frac{1}{9}$
 $\int_0^1 x^9 dx = \frac{1}{10} x^{10} \Big|_0^1 = \frac{1}{10}$

$\int_0^1 x^2 dx = \frac{1}{3} x^3 \Big|_0^1 = \frac{1}{3}$
 $\int_0^1 x^3 dx = \frac{1}{4} x^4 \Big|_0^1 = \frac{1}{4}$
 $\int_0^1 x^4 dx = \frac{1}{5} x^5 \Big|_0^1 = \frac{1}{5}$
 $\int_0^1 x^5 dx = \frac{1}{6} x^6 \Big|_0^1 = \frac{1}{6}$
 $\int_0^1 x^6 dx = \frac{1}{7} x^7 \Big|_0^1 = \frac{1}{7}$
 $\int_0^1 x^7 dx = \frac{1}{8} x^8 \Big|_0^1 = \frac{1}{8}$
 $\int_0^1 x^8 dx = \frac{1}{9} x^9 \Big|_0^1 = \frac{1}{9}$
 $\int_0^1 x^9 dx = \frac{1}{10} x^{10} \Big|_0^1 = \frac{1}{10}$

74 $\int_0^1 x^2 dx = \frac{1}{3} x^3 \Big|_0^1 = \frac{1}{3}$

(۱)

تجدید نظر و تجدید لایحه‌ی درخواست تجدید نظر
از نظر است، در صورتی که تجدید نظر 101 و در صورتی که
تجدید نظر و تجدید لایحه‌ی درخواست تجدید نظر
تجدید نظر 14 (سقوط) تجدید نظر است. تجدید نظر
تجدید نظر است.

(1) تجدید نظر و تجدید لایحه‌ی درخواست تجدید نظر
(۲) تجدید نظر و تجدید لایحه‌ی درخواست تجدید نظر (2) تجدید نظر و تجدید لایحه‌ی درخواست تجدید نظر
تجدید نظر؛

(2) لایحه‌ی درخواست تجدید نظر است. لایحه‌ی درخواست تجدید نظر
تجدید نظر (۲) تجدید نظر و تجدید لایحه‌ی درخواست تجدید نظر (3)
تجدید نظر و تجدید لایحه‌ی درخواست تجدید نظر.

(۲)

تجدید نظر و تجدید لایحه‌ی درخواست تجدید نظر
از نظر است، در صورتی که تجدید نظر 101 و در صورتی که
تجدید نظر و تجدید لایحه‌ی درخواست تجدید نظر
تجدید نظر 14 (سقوط) تجدید نظر است. تجدید نظر
تجدید نظر است.

تجدید نظر و تجدید لایحه‌ی درخواست تجدید نظر
تجدید نظر و تجدید لایحه‌ی درخواست تجدید نظر
تجدید نظر و تجدید لایحه‌ی درخواست تجدید نظر.

(1) تجدید نظر و تجدید لایحه‌ی درخواست تجدید نظر
تجدید نظر و تجدید لایحه‌ی درخواست تجدید نظر؛

(2) تجدید نظر و تجدید لایحه‌ی درخواست تجدید نظر
تجدید نظر و تجدید لایحه‌ی درخواست تجدید نظر؛

(3) تجدید نظر و تجدید لایحه‌ی درخواست تجدید نظر
تجدید نظر و تجدید لایحه‌ی درخواست تجدید نظر.

٢٦
 ٢٦
 ٢٦
 ٢٦
 ٢٦

102. (ا) ١٤ (س) ١٠٥
 ١٤ (س) ١٠٥
 ١٤ (س) ١٠٥
 ١٤ (س) ١٠٥
 ١٤ (س) ١٠٥

(ب) ١٠٥
 ١٠٥
 ١٠٥
 ١٠٥
 ١٠٥
 ١٠٥
 ١٠٥
 ١٠٥

(س) ١٠٥
 ١٠٥
 ١٠٥
 ١٠٥
 ١٠٥

103. (ا) ١١٧
 ١١٧
 ١١٧
 ١١٧
 ١١٧

١١٣

(1) 185

(2)

(3)

(س) (3)

١١٤

(س) 186

1. $\int_0^1 x^2 dx = \frac{1}{3}$

(س) $\int_0^1 x^2 dx = \frac{1}{3}$

(س) $\int_0^1 x^2 dx = \frac{1}{3}$

122. (س) $\int_0^1 x^2 dx = \frac{1}{3}$

(س) $\int_0^1 x^2 dx = \frac{1}{3}$

(س) $\int_0^1 x^2 dx = \frac{1}{3}$

לענין פשוטות. אן פון ארבעה צדדים
על פניו און פון 30 ימים נמשך ארבעה ימים.

123. (א) ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים

(ב) ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים

תוספת

אין פנים ארבעה ימים ארבעה ימים

124. (א) ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים

(ב) ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים
ארבעה ימים ארבעה ימים

שְׂרָפָה וְיִצְחָק וְיַעֲקֹב וְרָחֵל וְלֵוִי וְשֵׁשׁ
 אֲנָשִׁים וְשֵׁשׁ עָשָׂר בָּנִים וְשֵׁשׁ עָשָׂר בָּנוֹת
 בְּיָמֵי מֶלֶךְ מִצְרַיִם

(2) בְּיָמֵי מֶלֶךְ מִצְרַיִם (1) וְשֵׁשׁ עָשָׂר בָּנִים וְשֵׁשׁ עָשָׂר בָּנוֹת
 בְּיָמֵי מֶלֶךְ מִצְרַיִם וְשֵׁשׁ עָשָׂר בָּנִים וְשֵׁשׁ עָשָׂר בָּנוֹת
 בְּיָמֵי מֶלֶךְ מִצְרַיִם

(3) מִצְרַיִם וְשֵׁשׁ עָשָׂר בָּנִים וְשֵׁשׁ עָשָׂר בָּנוֹת
 מִצְרַיִם וְשֵׁשׁ עָשָׂר בָּנִים וְשֵׁשׁ עָשָׂר בָּנוֹת
 מִצְרַיִם

(4) מִצְרַיִם וְשֵׁשׁ עָשָׂר בָּנִים וְשֵׁשׁ עָשָׂר בָּנוֹת
 מִצְרַיִם וְשֵׁשׁ עָשָׂר בָּנִים וְשֵׁשׁ עָשָׂר בָּנוֹת
 מִצְרַיִם וְשֵׁשׁ עָשָׂר בָּנִים וְשֵׁשׁ עָשָׂר בָּנוֹת
 מִצְרַיִם

(5) מִצְרַיִם וְשֵׁשׁ עָשָׂר בָּנִים וְשֵׁשׁ עָשָׂר בָּנוֹת
 מִצְרַיִם

(6) מִצְרַיִם וְשֵׁשׁ עָשָׂר בָּנִים וְשֵׁשׁ עָשָׂר בָּנוֹת
 מִצְרַיִם וְשֵׁשׁ עָשָׂר בָּנִים וְשֵׁשׁ עָשָׂר בָּנוֹת
 מִצְרַיִם

(7) בְּיָמֵי מֶלֶךְ מִצְרַיִם (1) וְשֵׁשׁ עָשָׂר בָּנִים וְשֵׁשׁ עָשָׂר בָּנוֹת
 בְּיָמֵי מֶלֶךְ מִצְרַיִם וְשֵׁשׁ עָשָׂר בָּנִים וְשֵׁשׁ עָשָׂר בָּנוֹת
 בְּיָמֵי מֶלֶךְ מִצְרַיִם

(8) בְּיָמֵי מֶלֶךְ מִצְרַיִם (1) וְשֵׁשׁ עָשָׂר בָּנִים וְשֵׁשׁ עָשָׂר בָּנוֹת
 בְּיָמֵי מֶלֶךְ מִצְרַיִם וְשֵׁשׁ עָשָׂר בָּנִים וְשֵׁשׁ עָשָׂר בָּנוֹת
 בְּיָמֵי מֶלֶךְ מִצְרַיִם

(ס) זכרונותיו של הרב אברהם אבינו זצ"ל על שנת ה'תקנ"ח
 אברהם אבינו זצ"ל על שנת ה'תקנ"ח.

133. זכרונותיו של הרב אברהם אבינו זצ"ל על שנת ה'תקנ"ח
 זכרונותיו של הרב אברהם אבינו זצ"ל על שנת ה'תקנ"ח.

134. זכרונותיו של הרב אברהם אבינו זצ"ל על שנת ה'תקנ"ח
 זכרונותיו של הרב אברהם אבינו זצ"ל על שנת ה'תקנ"ח.

135. זכרונותיו של הרב אברהם אבינו זצ"ל על שנת ה'תקנ"ח
 זכרונותיו של הרב אברהם אבינו זצ"ל על שנת ה'תקנ"ח.

(א) זכרונותיו של הרב אברהם אבינו זצ"ל על שנת ה'תקנ"ח
 זכרונותיו של הרב אברהם אבינו זצ"ל על שנת ה'תקנ"ח.

(ב) זכרונותיו של הרב אברהם אבינו זצ"ל על שנת ה'תקנ"ח
 זכרונותיו של הרב אברהם אבינו זצ"ל על שנת ה'תקנ"ח.

(أ)

وَاِنْ اَنزَلْنَا مِنْ اَسْفَلَ مَاءً فَاَسْفَلَ مِنْهُ لَدَعَوْا قَوْمًا
 لِيَمْسِكُوهُ فَسَخَّرْنَا هَوَاهُوَهُمْ لِيَمْسِكُوهُ فَجَاءَهُمْ
 الْمَاءُ مِنْ اَسْفَلَ مِنْهُمْ حَتَّى لَبِئْتَ اَصْحَابَهُمْ
 لِيَمْسِكُوهُ فَجَاءَهُمْ الْمَاءُ مِنْ اَسْفَلَ مِنْهُمْ
 حَتَّى لَبِئْتَ اَصْحَابَهُمْ لِيَمْسِكُوهُ فَجَاءَهُمُ
 الْمَاءُ مِنْ اَسْفَلَ مِنْهُمْ حَتَّى لَبِئْتَ اَصْحَابَهُمْ

(ب)

حَتَّى لَبِئْتَ اَصْحَابَهُمْ لِيَمْسِكُوهُ فَجَاءَهُمُ
 الْمَاءُ مِنْ اَسْفَلَ مِنْهُمْ حَتَّى لَبِئْتَ اَصْحَابَهُمْ
 لِيَمْسِكُوهُ فَجَاءَهُمُ الْمَاءُ مِنْ اَسْفَلَ مِنْهُمْ
 حَتَّى لَبِئْتَ اَصْحَابَهُمْ لِيَمْسِكُوهُ فَجَاءَهُمُ
 الْمَاءُ مِنْ اَسْفَلَ مِنْهُمْ حَتَّى لَبِئْتَ اَصْحَابَهُمْ

وَمَا جَاءَهُمْ مِنْ مَاءٍ فَاَنزَلْنَاهُ مِنْ فَوْقِ السَّمَاءِ
 حَتَّى لَبِئْتَ اَصْحَابَهُمْ لِيَمْسِكُوهُ فَجَاءَهُمُ
 الْمَاءُ مِنْ اَسْفَلَ مِنْهُمْ حَتَّى لَبِئْتَ اَصْحَابَهُمْ

سُورَةُ طه

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

(أ)

نَسْفَتْنَا لَهُمُ الْجَهَنَّمَ فَاِذَا اَنْزَلْنَاهَا
 نَسْفَتْنَا لَهُمُ الْجَهَنَّمَ فَاِذَا اَنْزَلْنَاهَا
 نَسْفَتْنَا لَهُمُ الْجَهَنَّمَ فَاِذَا اَنْزَلْنَاهَا

(ب)

نَسْفَتْنَا لَهُمُ الْجَهَنَّمَ فَاِذَا اَنْزَلْنَاهَا
 نَسْفَتْنَا لَهُمُ الْجَهَنَّمَ فَاِذَا اَنْزَلْنَاهَا

(١)

١٤٨
 ١٤٨
 ١٤٨

(٢)

١٤٨
 ١٤٨
 ١٤٨

(٣)

١٤٨
 ١٤٨
 ١٤٨

(1) ١٤٨
 ١٤٨

(2) ١٤٨
 ١٤٨

(3) ١٤٨
 ١٤٨

(4) ١٤٨
 ١٤٨

(5) ١٤٨
 ١٤٨

(٤)

١٤٨
 ١٤٨
 ١٤٨

33 אָסערן. דאָס אַרבעטן דאַרפֿן אַנטוויקלען
 אַזוי זיך אַנטוויקלען דאַרפֿן אַנטוויקלען אַזוי זיך אַנטוויקלען
 דאַרפֿן אַנטוויקלען אַזוי זיך אַנטוויקלען.

זיבן זאָלן אַזוי אַנטוויקלען אַזוי זיך אַנטוויקלען
 אַזוי זיך אַנטוויקלען דאָס אַרבעטן אַזוי זיך אַנטוויקלען.

(1) אַזוי אַנטוויקלען אַזוי זיך אַנטוויקלען
 אַזוי זיך אַנטוויקלען אַזוי זיך אַנטוויקלען
 אַזוי זיך אַנטוויקלען

(2) אַזוי אַנטוויקלען אַזוי זיך אַנטוויקלען
 אַזוי זיך אַנטוויקלען

(3) אַזוי אַנטוויקלען אַזוי זיך אַנטוויקלען

(4) אַזוי אַנטוויקלען אַזוי זיך אַנטוויקלען
 אַזוי זיך אַנטוויקלען

(5) אַזוי אַנטוויקלען אַזוי זיך אַנטוויקלען
 אַזוי זיך אַנטוויקלען

(6) אַזוי אַנטוויקלען אַזוי זיך אַנטוויקלען
 אַזוי זיך אַנטוויקלען

(א) אַזוי אַנטוויקלען אַזוי זיך אַנטוויקלען
 אַזוי זיך אַנטוויקלען אַזוי זיך אַנטוויקלען
 אַזוי זיך אַנטוויקלען

(۷) $\frac{1}{x^2} = x^{-2}$ $\frac{d}{dx} x^{-2} = -2x^{-3} = -\frac{2}{x^3}$
 $\frac{1}{x^3} = x^{-3}$ $\frac{d}{dx} x^{-3} = -3x^{-4} = -\frac{3}{x^4}$
 $\frac{1}{x^4} = x^{-4}$ $\frac{d}{dx} x^{-4} = -4x^{-5} = -\frac{4}{x^5}$

סדר הכרזות

הכרזות המיושמות

149. (א) הכרזות המיושמות הן הכרזות המיושמות על ידי הרשות, או הכרזות המיושמות על ידי הרשות, או הכרזות המיושמות על ידי הרשות.

(ב) הכרזות המיושמות הן הכרזות המיושמות על ידי הרשות, או הכרזות המיושמות על ידי הרשות, או הכרזות המיושמות על ידי הרשות.

(ג) הכרזות המיושמות הן הכרזות המיושמות על ידי הרשות, או הכרזות המיושמות על ידי הרשות, או הכרזות המיושמות על ידי הרשות.

(ד) הכרזות המיושמות הן הכרזות המיושמות על ידי הרשות, או הכרזות המיושמות על ידי הרשות, או הכרזות המיושמות על ידי הרשות.

(1) הכרזות המיושמות הן הכרזות המיושמות על ידי הרשות, או הכרזות המיושמות על ידי הרשות, או הכרזות המיושמות על ידי הרשות.

فَأَقْرِبُوا إِلَهُكُمْ أَنْتُمْ كَمَا كُنْتُمْ تُقْرَبُونَ
 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تَقْوَاهُ
 وَأَطِيعُوا أَمْرًا مَعْرُوفًا مَعْرُوفًا

(٢٧) وَكَذَلِكَ نَقُصُّ عَلَيْكَ مَا مَنَّ اللَّهُ عَلَى الْمُؤْمِنِينَ إِذْ هَبَّ شَرْكَهُمْ وَأَثَابَهُمْ فَتْحًا وَغُنَّةً يَوْمَ الَّذِينَ آمَنُوا بِهِمْ يُفَوِّتُ وَهُمْ يُنِيبُونَ
 فَأَقْرِبُوا إِلَهُكُمْ أَنْتُمْ كَمَا كُنْتُمْ تُقْرَبُونَ

(٢٨) وَكَذَلِكَ نَقُصُّ عَلَيْكَ مَا مَنَّ اللَّهُ عَلَى الْمُؤْمِنِينَ إِذْ هَبَّ شَرْكَهُمْ وَأَثَابَهُمْ فَتْحًا وَغُنَّةً يَوْمَ الَّذِينَ آمَنُوا بِهِمْ يُفَوِّتُ وَهُمْ يُنِيبُونَ
 فَأَقْرِبُوا إِلَهُكُمْ أَنْتُمْ كَمَا كُنْتُمْ تُقْرَبُونَ

فَأَقْرِبُوا إِلَهُكُمْ أَنْتُمْ كَمَا كُنْتُمْ تُقْرَبُونَ
 وَأَطِيعُوا أَمْرًا مَعْرُوفًا مَعْرُوفًا

150. تَقْرِبُوا إِلَهُكُمْ كَمَا كُنْتُمْ تُقْرَبُونَ
 وَأَطِيعُوا أَمْرًا مَعْرُوفًا مَعْرُوفًا

(٢٩) وَأَقْرِبُوا إِلَهُكُمْ كَمَا كُنْتُمْ تُقْرَبُونَ
 وَأَطِيعُوا أَمْرًا مَعْرُوفًا مَعْرُوفًا

(٣٠) وَأَقْرِبُوا إِلَهُكُمْ كَمَا كُنْتُمْ تُقْرَبُونَ
 وَأَطِيعُوا أَمْرًا مَعْرُوفًا مَعْرُوفًا

(٣١) وَأَقْرِبُوا إِلَهُكُمْ كَمَا كُنْتُمْ تُقْرَبُونَ
 وَأَطِيعُوا أَمْرًا مَعْرُوفًا مَعْرُوفًا

151. تَقْرِبُوا إِلَهُكُمْ كَمَا كُنْتُمْ تُقْرَبُونَ
 وَأَطِيعُوا أَمْرًا مَعْرُوفًا مَعْرُوفًا

(٣٢) وَأَقْرِبُوا إِلَهُكُمْ كَمَا كُنْتُمْ تُقْرَبُونَ
 وَأَطِيعُوا أَمْرًا مَعْرُوفًا مَعْرُوفًا

أَنْ دَرَسُوا فِي بَيْتِهِمْ لِيُحَدِّثُواكَ بِتَأْوِيلِنَا، وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ.
أَلَمْ نَجْعَلِ لَكَ نُجُودًا مِمَّنْ دُونِكَ لِتَكُونَ تَارِكًا لِمَا حَرَّمَ اللَّهُ مِنْ ذُنُوبِكُمْ وَرَدَّدًا وَاوَدًا، أَلَمْ نَجْعَلِ
عَيْنَكَ وَمَحْفُوظًا لَكَ وَمَنْ دُونَهُ لِيَنْقَلَ عَلَيْكَ لَوْلَا إِذْ يَتَّبِعُونَ آيَاتِنَا لَقَدْ كُنَّا أَهْلًا بِمَنْعِ الْفِتَنِ أَذْهَبْنَا آلَ فِرْعَوْنَ مِنْ قَبْلِكَ لِيُذَكَّرَ أَفْئِدَتَكَ وَمَنْ دُونَهُ لِيُذَكَّرَ أَفْئِدَتَكَ، أَلَمْ نَجْعَلِ لَكَ نُجُودًا مِمَّنْ دُونِكَ لِتَكُونَ تَارِكًا لِمَا حَرَّمَ اللَّهُ مِنْ ذُنُوبِكُمْ وَرَدَّدًا وَاوَدًا، أَلَمْ نَجْعَلِ عَيْنَكَ وَمَحْفُوظًا لَكَ وَمَنْ دُونَهُ لِيَنْقَلَ عَلَيْكَ لَوْلَا إِذْ يَتَّبِعُونَ آيَاتِنَا لَقَدْ كُنَّا أَهْلًا بِمَنْعِ الْفِتَنِ أَذْهَبْنَا آلَ فِرْعَوْنَ مِنْ قَبْلِكَ لِيُذَكَّرَ أَفْئِدَتَكَ وَمَنْ دُونَهُ لِيُذَكَّرَ أَفْئِدَتَكَ.

(1) بَرَاءٌ نَجَّيْنَاهُ مِنَ الْغَمِّ، وَأَوَدَّ إِلَى اللَّهِ يَتَّقِي الْوَعْدَ الَّذِي لَعَنَ الْكَاذِبِينَ.
أَلَمْ نَجْعَلِ لَكَ نُجُودًا مِمَّنْ دُونِكَ لِتَكُونَ تَارِكًا لِمَا حَرَّمَ اللَّهُ مِنْ ذُنُوبِكُمْ وَرَدَّدًا وَاوَدًا، أَلَمْ نَجْعَلِ عَيْنَكَ وَمَحْفُوظًا لَكَ وَمَنْ دُونَهُ لِيَنْقَلَ عَلَيْكَ لَوْلَا إِذْ يَتَّبِعُونَ آيَاتِنَا لَقَدْ كُنَّا أَهْلًا بِمَنْعِ الْفِتَنِ أَذْهَبْنَا آلَ فِرْعَوْنَ مِنْ قَبْلِكَ لِيُذَكَّرَ أَفْئِدَتَكَ وَمَنْ دُونَهُ لِيُذَكَّرَ أَفْئِدَتَكَ.

(2) سَخَّرْنَا لَكَ آيَاتِنَا لِيُبَيِّنَ لَكَ آيَاتِنَا وَلِيُنذِرَ لِقَوْمٍ يُظَلَمُونَ.
لَا سَخَّرْنَا لَكَ آيَاتِنَا إِلَّا لِقَوْمٍ يُظَلَمُونَ، أَلَمْ نَجْعَلِ لَكَ نُجُودًا مِمَّنْ دُونِكَ لِتَكُونَ تَارِكًا لِمَا حَرَّمَ اللَّهُ مِنْ ذُنُوبِكُمْ وَرَدَّدًا وَاوَدًا، أَلَمْ نَجْعَلِ عَيْنَكَ وَمَحْفُوظًا لَكَ وَمَنْ دُونَهُ لِيَنْقَلَ عَلَيْكَ لَوْلَا إِذْ يَتَّبِعُونَ آيَاتِنَا لَقَدْ كُنَّا أَهْلًا بِمَنْعِ الْفِتَنِ أَذْهَبْنَا آلَ فِرْعَوْنَ مِنْ قَبْلِكَ لِيُذَكَّرَ أَفْئِدَتَكَ وَمَنْ دُونَهُ لِيُذَكَّرَ أَفْئِدَتَكَ.

وَالَّذِينَ كَفَرُوا هُمُ الْمَكِيدُونَ (س) وَالَّذِينَ كَفَرُوا هُمُ الْمَكِيدُونَ، أَلَمْ نَجْعَلِ لَكَ نُجُودًا مِمَّنْ دُونِكَ لِتَكُونَ تَارِكًا لِمَا حَرَّمَ اللَّهُ مِنْ ذُنُوبِكُمْ وَرَدَّدًا وَاوَدًا، أَلَمْ نَجْعَلِ عَيْنَكَ وَمَحْفُوظًا لَكَ وَمَنْ دُونَهُ لِيَنْقَلَ عَلَيْكَ لَوْلَا إِذْ يَتَّبِعُونَ آيَاتِنَا لَقَدْ كُنَّا أَهْلًا بِمَنْعِ الْفِتَنِ أَذْهَبْنَا آلَ فِرْعَوْنَ مِنْ قَبْلِكَ لِيُذَكَّرَ أَفْئِدَتَكَ وَمَنْ دُونَهُ لِيُذَكَّرَ أَفْئِدَتَكَ.

(س) وَالَّذِينَ كَفَرُوا هُمُ الْمَكِيدُونَ، أَلَمْ نَجْعَلِ لَكَ نُجُودًا مِمَّنْ دُونِكَ لِتَكُونَ تَارِكًا لِمَا حَرَّمَ اللَّهُ مِنْ ذُنُوبِكُمْ وَرَدَّدًا وَاوَدًا، أَلَمْ نَجْعَلِ عَيْنَكَ وَمَحْفُوظًا لَكَ وَمَنْ دُونَهُ لِيَنْقَلَ عَلَيْكَ لَوْلَا إِذْ يَتَّبِعُونَ آيَاتِنَا لَقَدْ كُنَّا أَهْلًا بِمَنْعِ الْفِتَنِ أَذْهَبْنَا آلَ فِرْعَوْنَ مِنْ قَبْلِكَ لِيُذَكَّرَ أَفْئِدَتَكَ وَمَنْ دُونَهُ لِيُذَكَّرَ أَفْئِدَتَكَ.

(س) وَالَّذِينَ كَفَرُوا هُمُ الْمَكِيدُونَ، أَلَمْ نَجْعَلِ لَكَ نُجُودًا مِمَّنْ دُونِكَ لِتَكُونَ تَارِكًا لِمَا حَرَّمَ اللَّهُ مِنْ ذُنُوبِكُمْ وَرَدَّدًا وَاوَدًا، أَلَمْ نَجْعَلِ عَيْنَكَ وَمَحْفُوظًا لَكَ وَمَنْ دُونَهُ لِيَنْقَلَ عَلَيْكَ لَوْلَا إِذْ يَتَّبِعُونَ آيَاتِنَا لَقَدْ كُنَّا أَهْلًا بِمَنْعِ الْفِتَنِ أَذْهَبْنَا آلَ فِرْعَوْنَ مِنْ قَبْلِكَ لِيُذَكَّرَ أَفْئِدَتَكَ وَمَنْ دُونَهُ لِيُذَكَّرَ أَفْئِدَتَكَ.

«...» ۱۳۳۳... ۲۶۲...
... ۲۶۲...
... ۲۶۲...
... ۲۶۲...

(۵) ...
...
...

۱۳۳۳... ۱۵۳... (۱) ...
...

(1) ...
...
...

(2) ...
...
...

(3) ...

(4) ...
...
...
...
...
...

(5) אֲדַמְּךָ אֶת־מִצְרַיִם שְׂוֵה־מִצְרַיִם אֶת־כָּל־מִצְרַיִם
 בְּרִשְׁתָּהּ, אֲדַמְּךָ מִצְרַיִם מִצְרַיִם אֶת־מִצְרַיִם
 שְׂוֵה־מִצְרַיִם אֶת־כָּל־מִצְרַיִם שְׂוֵה־מִצְרַיִם אֶת־כָּל־מִצְרַיִם
 עַם־יִשְׂרָאֵל וְעַם־יִשְׂרָאֵל.

(ס) וְדִמְתָּ (ס) זֶה הַשְׂוֵה־מִצְרַיִם בְּרִשְׁתָּהּ זֶה
 מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם
 אֲדַמְּךָ אֶת־מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם
 14 (ס) מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם.

154. אֲדַמְּךָ זֶה הַשְׂוֵה־מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם
 אֲדַמְּךָ מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם
 מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם
 מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם
 מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם.

155. זֶה הַשְׂוֵה־מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם
 זֶה הַשְׂוֵה־מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם
 14 (ס) מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם
 מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם.

אֲדַמְּךָ מִצְרַיִם

מִצְרַיִם מִצְרַיִם

156. זֶה הַשְׂוֵה־מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם
 זֶה הַשְׂוֵה־מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם
 מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם מִצְרַיִם

سرسرهٔ خمری، هائیسر لاسر خمری برنوو مویسر خمری برنوو
 سرسرهٔ خمری سرسرهٔ خمری، ا سرسرهٔ خمری سرسرهٔ
 م 7 (سره) خمری خمری خمری خمری خمری خمری خمری خمری
 ا سرسرهٔ خمری خمری خمری خمری خمری خمری خمری خمری.

159. ا سرسرهٔ خمری خمری خمری خمری خمری خمری خمری خمری
 مویسر خمری خمری خمری خمری خمری خمری خمری خمری

نایع سرسرهٔ خمری ا سرسرهٔ خمری خمری خمری خمری خمری خمری خمری خمری
 ا سرسرهٔ خمری خمری خمری خمری خمری خمری خمری خمری خمری
 سرسرهٔ خمری. نایع برنوو مویسر خمری خمری خمری خمری خمری خمری خمری خمری
 مویسر خمری خمری خمری خمری خمری خمری خمری خمری خمری
 نایع سرسرهٔ خمری خمری خمری خمری خمری خمری خمری خمری خمری

سرسرهٔ خمری

سرسرهٔ خمری برنوو خمری خمری خمری خمری خمری

160. سرسرهٔ خمری خمری خمری خمری خمری خمری خمری خمری
 خمری خمری خمری خمری خمری خمری خمری خمری

(ا) برنوو ا سرسرهٔ خمری خمری خمری خمری خمری خمری خمری خمری
 سرسرهٔ خمری خمری خمری خمری خمری خمری خمری خمری خمری
 لاسر خمری برنوو ا سرسرهٔ خمری خمری خمری خمری خمری خمری خمری خمری

(ب) د خمری خمری (ا) خمری خمری خمری خمری خمری خمری خمری خمری
 خمری خمری 27 سرسرهٔ خمری خمری خمری خمری خمری خمری خمری خمری
 برنوو خمری خمری برنوو ا سرسرهٔ خمری خمری خمری خمری خمری خمری خمری خمری
 ا برنوو سرسرهٔ خمری خمری خمری خمری خمری خمری خمری خمری خمری
 ا سرسرهٔ خمری برنوو خمری خمری خمری خمری خمری خمری خمری خمری
 سرسرهٔ خمری د خمری خمری خمری خمری خمری خمری خمری خمری 36 ا سرسرهٔ خمری
 برنوو خمری خمری خمری خمری خمری خمری خمری خمری خمری خمری
 خمری خمری 292 سرسرهٔ خمری خمری خمری خمری خمری خمری خمری خمری خمری
 برنوو خمری خمری خمری خمری خمری خمری خمری خمری خمری

سۆيۈنۈش ۋە تەبىئىيەت

سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش

سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش 163. (ا)

تەبىئىيەت سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش
 سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش
 تەبىئىيەت سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش
 سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش
 تەبىئىيەت سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش
 سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش
 تەبىئىيەت سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش

(1) سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش

سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش

(2) سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش

(3) سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش

سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش

(ب) سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش

سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش
 سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش
 سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش
 سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش
 سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش

(ب) سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش

سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش
 سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش
 سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش
 سۆيۈنۈش ۋە تەبىئىيەت سۆيۈنۈش

سَعَى بِرَجُلٍ زَمَكْرَتُكَ لِحَجِّكَ بِرَدِّكَ إِذْ أَرَادَ أَنْ يَنْتَهِيَ عَنْكَ
 وَأَنْ يَنْتَهِيَ عَنْكَ بِرَدِّكَ، وَأَنْ يَنْتَهِيَ عَنْكَ بِرَدِّكَ
 وَأَنْ يَنْتَهِيَ عَنْكَ بِرَدِّكَ. سَعَى بِرَجُلٍ سِرِّكَ وَتَعَبِكَ (حَجِّكَ وَتَعَبِكَ)
 لَمَّا رَدَّ رَدِّكَ لِحَجِّكَ بِرَدِّكَ لِحَجِّكَ لَمَّا رَدَّ رَدِّكَ لِحَجِّكَ
 وَأَنْ يَنْتَهِيَ عَنْكَ بِرَدِّكَ.

(أ) سَعَى بِرَجُلٍ زَمَكْرَتُكَ سِرِّكَ وَتَعَبِكَ بِرَدِّكَ لِحَجِّكَ
 لَمَّا رَدَّ رَدِّكَ لِحَجِّكَ سَعَى بِرَجُلٍ لَمَّا رَدَّ رَدِّكَ لِحَجِّكَ
 زَمَكْرَتُكَ، وَأَنْ يَنْتَهِيَ عَنْكَ بِرَدِّكَ لِحَجِّكَ سِرِّكَ وَتَعَبِكَ
 لَمَّا رَدَّ رَدِّكَ لِحَجِّكَ، سَعَى بِرَجُلٍ زَمَكْرَتُكَ سِرِّكَ وَتَعَبِكَ
 سِرِّكَ وَتَعَبِكَ بِرَدِّكَ لِحَجِّكَ لَمَّا رَدَّ رَدِّكَ لِحَجِّكَ
 وَأَنْ يَنْتَهِيَ عَنْكَ بِرَدِّكَ لِحَجِّكَ لَمَّا رَدَّ رَدِّكَ لِحَجِّكَ.

(1) أَرَادَ أَنْ يَنْتَهِيَ عَنْكَ بِرَدِّكَ سَعَى بِرَجُلٍ لَمَّا رَدَّ رَدِّكَ لِحَجِّكَ

(2) أَرَادَ أَنْ يَنْتَهِيَ عَنْكَ بِرَدِّكَ سَعَى بِرَجُلٍ لَمَّا رَدَّ رَدِّكَ لِحَجِّكَ
 لَمَّا رَدَّ رَدِّكَ لِحَجِّكَ

(3) وَأَنْ يَنْتَهِيَ عَنْكَ بِرَدِّكَ سَعَى بِرَجُلٍ لَمَّا رَدَّ رَدِّكَ لِحَجِّكَ
 سِرِّكَ وَتَعَبِكَ لَمَّا رَدَّ رَدِّكَ لِحَجِّكَ

(4) سَعَى بِرَجُلٍ زَمَكْرَتُكَ لِحَجِّكَ لَمَّا رَدَّ رَدِّكَ لِحَجِّكَ

(5) سَعَى بِرَجُلٍ زَمَكْرَتُكَ لِحَجِّكَ لَمَّا رَدَّ رَدِّكَ لِحَجِّكَ
 لَمَّا رَدَّ رَدِّكَ لِحَجِّكَ

(6) سَعَى بِرَجُلٍ زَمَكْرَتُكَ لِحَجِّكَ لَمَّا رَدَّ رَدِّكَ لِحَجِّكَ
 لَمَّا رَدَّ رَدِّكَ لِحَجِّكَ

(7) $\int \frac{1}{x^2} dx = -\frac{1}{x} + C$, $\int \frac{1}{x^3} dx = -\frac{1}{2x^2} + C$, $\int \frac{1}{x^4} dx = -\frac{1}{3x^3} + C$,
 $\int \frac{1}{x^5} dx = -\frac{1}{4x^4} + C$, $\int \frac{1}{x^6} dx = -\frac{1}{5x^5} + C$,
 $\int \frac{1}{x^7} dx = -\frac{1}{6x^6} + C$;

(8) $\int \frac{1}{x^2} dx = -\frac{1}{x} + C$, $\int \frac{1}{x^3} dx = -\frac{1}{2x^2} + C$,
 $\int \frac{1}{x^4} dx = -\frac{1}{3x^3} + C$;

(9) $\int \frac{1}{x^2} dx = -\frac{1}{x} + C$, $\int \frac{1}{x^3} dx = -\frac{1}{2x^2} + C$,
 $\int \frac{1}{x^4} dx = -\frac{1}{3x^3} + C$, $\int \frac{1}{x^5} dx = -\frac{1}{4x^4} + C$,
 $\int \frac{1}{x^6} dx = -\frac{1}{5x^5} + C$, $\int \frac{1}{x^7} dx = -\frac{1}{6x^6} + C$.

(س) $\int \frac{1}{x^2} dx = -\frac{1}{x} + C$, $\int \frac{1}{x^3} dx = -\frac{1}{2x^2} + C$,
 $\int \frac{1}{x^4} dx = -\frac{1}{3x^3} + C$.

(1) $\int \frac{1}{x^2} dx = -\frac{1}{x} + C$, $\int \frac{1}{x^3} dx = -\frac{1}{2x^2} + C$,
 $\int \frac{1}{x^4} dx = -\frac{1}{3x^3} + C$;

(2) $\int \frac{1}{x^2} dx = -\frac{1}{x} + C$, $\int \frac{1}{x^3} dx = -\frac{1}{2x^2} + C$,
 $\int \frac{1}{x^4} dx = -\frac{1}{3x^3} + C$.

(س) $\int \frac{1}{x^2} dx = -\frac{1}{x} + C$, $\int \frac{1}{x^3} dx = -\frac{1}{2x^2} + C$,
 $\int \frac{1}{x^4} dx = -\frac{1}{3x^3} + C$.

(1) $\int \frac{1}{x^2} dx = -\frac{1}{x} + C$, $\int \frac{1}{x^3} dx = -\frac{1}{2x^2} + C$,
 $\int \frac{1}{x^4} dx = -\frac{1}{3x^3} + C$, $\int \frac{1}{x^5} dx = -\frac{1}{4x^4} + C$,
 $\int \frac{1}{x^6} dx = -\frac{1}{5x^5} + C$.

(א)

שפּאַרן זיך זענען פארהייראטע זענען נאך אונטערן
 זענען זיך און פראנצויזישע זענען פארהייראטע זענען
 און זיך זענען פארהייראטע זענען פארהייראטע זענען
 און זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען

(ב)

זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען

זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען

זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען
 זענען פארהייראטע זענען פארהייראטע זענען

(س) $\frac{1}{x^2} = x^{-2}$ $\frac{d}{dx} x^{-2} = -2x^{-3} = -\frac{2}{x^3}$
 $\frac{d}{dx} \frac{1}{x^2} = -\frac{2}{x^3}$
 $\frac{d}{dx} \frac{1}{x^2} = -\frac{2}{x^3}$ (ر) $\frac{d}{dx} \frac{1}{x^2} = -\frac{2}{x^3}$
 $\frac{d}{dx} \frac{1}{x^2} = -\frac{2}{x^3}$

(س) $\frac{d}{dx} x^2 = 2x$ (ر) $\frac{d}{dx} x^2 = 2x$
 $\frac{d}{dx} x^2 = 2x$

(1) $\frac{d}{dx} x^2 = 2x$
 $\frac{d}{dx} x^2 = 2x$ A
 $\frac{d}{dx} x^2 = 2x$

(2) $\frac{d}{dx} x^2 = 2x$
 $\frac{d}{dx} x^2 = 2x$ B
 $\frac{d}{dx} x^2 = 2x$

(3) $\frac{d}{dx} x^2 = 2x$
 $\frac{d}{dx} x^2 = 2x$ C
 $\frac{d}{dx} x^2 = 2x$

(س) 179. $\frac{d}{dx} x^2 = 2x$
 $\frac{d}{dx} x^2 = 2x$
 $\frac{d}{dx} x^2 = 2x$
 $\frac{d}{dx} x^2 = 2x$
 $\frac{d}{dx} x^2 = 2x$
 $\frac{d}{dx} x^2 = 2x$
 $\frac{d}{dx} x^2 = 2x$
 $\frac{d}{dx} x^2 = 2x$

(س) مَجْرَعُ سَمْعِكُمْ شَرْوَعُ مَجْرَعِ سَمْعِكُمْ وَتَسْمَعُونَ مِنْهُ لَأَجْلِ
أَقْرَبِكُمْ ذَوَاتِ رُجُلٍ، نَبِيذِي فَكَمْ يَسْتَسْمَعُونَ مِنْهُ لَأَجْلِ
ذِي رَأْسٍ قَرِيبٍ لَسَمْعِي أَتَقْرَبُ لَأَسْمَعُ مِنْكُمْ، مَسْمَعُونَ مِنْكُمْ
لَأَجْلِ أَدْعِيكُمْ فَرَقَمْتُمْ قَرَابَتِي وَسَمِعْتُمْ. أَلَمْ تَدْعُوا
لَأَجْلِ مَجْرَعِ سَمْعِكُمْ تَسْمَعُونَ لَأَجْلِ كَلِمَاتِي سَمِعْتُمْ
وَأَنْتُمْ تَسْمَعُونَ لَأَجْلِ أَدْعِيكُمْ لَأَجْلِ قَرَابَتِي فَكَمْ يَسْمَعُونَ
مِنْكُمْ، أَلَمْ تَدْعُوا بَرَاءً كَمَا تَدْعُوا لَأَجْلِ كَلِمَاتِي
كَمَا تَدْعُونَ كَمَا تَدْعُونَ قَرَابَتِي.

180 (ر) لَأَجْلِ نَكْرَتِ هَوَايَ وَجِ مَسْمَعُونَ لَأَجْلِ نَسْمَعُ مِنْكُمْ
مَسْمَعُونَ لَأَجْلِ نَكْرَتِ رِسْمِ لَأَجْلِ مَسْمَعُونَ نَبِيذِي
بَرَسْمِ مَسْمَعُونَ أَلَمْ يَسْمَعُوا وَهِيَ ذِي كَلِمَاتِي وَتَدْعُوا
مَجْرَعُ سَمْعِكُمْ شَرْوَعُ مَجْرَعِ سَمْعِكُمْ وَتَسْمَعُونَ مِنْهُ لَأَجْلِ
ذَوَاتِ رُجُلٍ فَكَمْ يَسْمَعُونَ.

(س) نَكْرَتِي أَلَمْ تَدْعُوا لَأَجْلِ نَكْرَتِي فَكَمْ يَسْمَعُونَ مِنْكُمْ
كَلِمَاتِي 60 (مَسْمَعُونَ) قَرَابَتِي كَلِمَاتِي لَأَجْلِ هَوَايَ
وَجِ مَسْمَعُونَ لَأَجْلِ نَكْرَتِي أَتَقْرَبُ مَجْرَعُ سَمْعِكُمْ شَرْوَعُ
مَجْرَعِ سَمْعِكُمْ وَتَسْمَعُونَ مِنْهُ لَأَجْلِ ذَوَاتِ رُجُلٍ لَأَسْمَعُ مِنْكُمْ
سَمِعْتُمْ وَسَمِعْتُمْ.

181 نَكْرَتِي أَدْعِيكُمْ أَتَقْرَبُ رِسْمِي سَمِعْتُمْ لَأَجْلِ
رِسْمِ سَمْعِكُمْ أَلَمْ تَدْعُوا لَأَجْلِ نَكْرَتِي فَكَمْ يَسْمَعُونَ مِنْكُمْ
ذِي كَلِمَاتِي لَأَجْلِ مَسْمَعُونَ سَمِعْتُمْ لَأَجْلِ نَكْرَتِي فَكَمْ يَسْمَعُونَ
أَلَمْ تَدْعُوا لَأَجْلِ سَمِعْتُمْ.

182 بَرَاءً كَمَا تَدْعُوا لَأَجْلِ نَكْرَتِي رِسْمِي مَسْمَعُونَ لَأَجْلِ نَكْرَتِي بَرَاءً
أَلَمْ يَسْمَعُوا لَأَجْلِ نَكْرَتِي فَكَمْ يَسْمَعُونَ لَأَجْلِ نَكْرَتِي نَبِيذِي
نَكْرَتِي

קְרִיבָה לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ
 וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ.

183. הַיְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ
 וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ.

184. שְׂמַע יְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ
 וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ.

שְׂמַע יְיָ אֱלֹהֵינוּ

וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ

185. הַיְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ
 וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ.

(1) קְרִיבָה לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ

(2) הַיְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ
 וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ.

186. הַיְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ
 וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ וְנִשְׁמָע מִלְּפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ.

«...»
...

222. ()

...

(1) ...

(2) ...

(3) ...

(4) ...

(5) ...

מוֹסְרֵיךְ לַמִּצְוֹת יִשְׁמְרוּךָ רַחֲמֵי אֱלֹהֵינוּ מִכָּל חַטָּאת
 אֲשֶׁר יִשְׁנֶה יָדְךָ אֶת חַטֹּאתֵינוּ וְאֵת חַטֹּאתֵינוּ אֲשֶׁר יִשְׁנֶה
 מוֹסְרֵיךְ לַמִּצְוֹת אֱלֹהֵינוּ.

224. קְרִיאתוֹת בְּיָמֵינוּ

מִצְוֹת עֲלֵינוּ וְעַל כָּל אֶתְרֵינוּ וְעַל כָּל אֶתְרֵינוּ וְעַל כָּל אֶתְרֵינוּ
 אֲשֶׁר יִשְׁנֶה יָדְךָ אֶת חַטֹּאתֵינוּ וְאֵת חַטֹּאתֵינוּ אֲשֶׁר יִשְׁנֶה
 מוֹסְרֵיךְ לַמִּצְוֹת אֱלֹהֵינוּ וְעַל כָּל אֶתְרֵינוּ וְעַל כָּל אֶתְרֵינוּ
 וְעַל כָּל אֶתְרֵינוּ וְעַל כָּל אֶתְרֵינוּ וְעַל כָּל אֶתְרֵינוּ
 וְעַל כָּל אֶתְרֵינוּ וְעַל כָּל אֶתְרֵינוּ וְעַל כָּל אֶתְרֵינוּ
 וְעַל כָּל אֶתְרֵינוּ וְעַל כָּל אֶתְרֵינוּ וְעַל כָּל אֶתְרֵינוּ
 וְעַל כָּל אֶתְרֵינוּ וְעַל כָּל אֶתְרֵינוּ וְעַל כָּל אֶתְרֵינוּ.

225. מִצְוֹת וְהַלְלוּתָם

(א) מִצְוֹת וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם
 וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם
 וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם
 וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם.

(ב) וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם
 וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם
 וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם
 וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם
 וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם.

(ג) מִצְוֹת וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם
 וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם.

(ד) מִצְוֹת וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם
 וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם.

(1) וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם וְהַלְלוּתָם.

(3) ከ ገንዘብ ስራ (1) እና (2) አኳኑ አካል ይሆናል።
 ገንዘብ ስራውን በገንዘብ ስራ ስራው አኳኑ አካል ይሆናል።

ገንዘብ ስራ

(1) 241.

ገንዘብ ስራውን በገንዘብ ስራው አኳኑ አካል ይሆናል።
 ገንዘብ ስራውን በገንዘብ ስራው አኳኑ አካል ይሆናል።

(1) ገንዘብ ስራውን በገንዘብ ስራው አኳኑ አካል ይሆናል።
 ገንዘብ ስራውን በገንዘብ ስራው አኳኑ አካል ይሆናል።

(2) ገንዘብ ስራውን በገንዘብ ስራው አኳኑ አካል ይሆናል።
 ገንዘብ ስራውን በገንዘብ ስራው አኳኑ አካል ይሆናል።

(3) ገንዘብ ስራውን በገንዘብ ስራው አኳኑ አካል ይሆናል።
 ገንዘብ ስራውን በገንዘብ ስራው አኳኑ አካል ይሆናል።

(4) ገንዘብ ስራውን በገንዘብ ስራው አኳኑ አካል ይሆናል።
 ገንዘብ ስራውን በገንዘብ ስራው አኳኑ አካል ይሆናል።

(1) ገንዘብ ስራውን በገንዘብ ስራው አኳኑ አካል ይሆናል።
 ገንዘብ ስራውን በገንዘብ ስራው አኳኑ አካል ይሆናል።

(1) ገንዘብ ስራውን በገንዘብ ስራው አኳኑ አካል ይሆናል።

(2) مَخْرَجُ سِجِّينَ لَا يَخْرُجُ فِيهَا كَلِمَةٌ إِلَّا كَانَ لَهَا حِسَابٌ وَأُولَئِكَ فِيهَا مُنْقَلَبُونَ

(3) كَذَّبُوا بِآيَاتِنَا كَذَّبَتْ بُرُودٌ لَمَّا جَاءَتْ أُولَئِكَ فِيهَا مُنْقَلَبُونَ

(4) هَذَانِ سِتْرُ مَعْبُودٍ مَلَكُوتِي لَا يَخْفَى مِنِّي سِرُّهُمْ وَلَا جَهْدُهُمْ وَلَا يَدُّهُمْ وَلَا مَنَاقِبُهُمْ وَلَا عَمَلُهُمْ وَلَا خَيْرٌ لَّهُمْ وَلَا يَسْتَفِيدُونَ

(5) هَذَانِ سِتْرُ مَعْبُودٍ مَلَكُوتِي لَا يَخْفَى مِنِّي سِرُّهُمْ وَلَا جَهْدُهُمْ وَلَا يَدُّهُمْ وَلَا مَنَاقِبُهُمْ وَلَا عَمَلُهُمْ وَلَا خَيْرٌ لَّهُمْ وَلَا يَسْتَفِيدُونَ

(6) سَتَرْنَا عَنْ رُسُلِنَا حُجُوبًا سَتَرْنَا عَنْ رُسُلِنَا حُجُوبًا سَتَرْنَا عَنْ رُسُلِنَا حُجُوبًا

242 كَرِيمٌ فَاعْبُدْهُ وَرَبِّكَ لَا تَدْعُوا لَدُنْهِ دُعَاءً وَلَا تَحْسَبُوهُ حَشْرًا

كَرِيمٌ فَاعْبُدْهُ وَرَبِّكَ لَا تَدْعُوا لَدُنْهِ دُعَاءً وَلَا تَحْسَبُوهُ حَشْرًا

(أ) فَاعْبُدْهُ وَرَبِّكَ لَا تَدْعُوا لَدُنْهِ دُعَاءً وَلَا تَحْسَبُوهُ حَشْرًا

(ب) فَاعْبُدْهُ وَرَبِّكَ لَا تَدْعُوا لَدُنْهِ دُعَاءً وَلَا تَحْسَبُوهُ حَشْرًا

(ج) فَاعْبُدْهُ وَرَبِّكَ لَا تَدْعُوا لَدُنْهِ دُعَاءً وَلَا تَحْسَبُوهُ حَشْرًا

243 نَبِيًّا وَمِنْهُ قَوْمٌ لَمَّا جَاءَتْ أُولَئِكَ فِيهَا مُنْقَلَبُونَ

نَبِيًّا وَمِنْهُ قَوْمٌ لَمَّا جَاءَتْ أُولَئِكَ فِيهَا مُنْقَلَبُونَ

7000 000 10000 000 20000 000 30000 000

248. 7000 000 10000 000 20000 000 30000 000 (a) 7000 000 10000 000 20000 000 30000 000 7000 000 10000 000 20000 000 30000 000

(b) 7000 000 10000 000 20000 000 30000 000 7000 000 10000 000 20000 000 30000 000 7000 000 10000 000 20000 000 30000 000

7000 000 10000 000 20000 000 30000 000

7000 000 10000 000 20000 000 30000 000

249. 7000 000 10000 000 20000 000 30000 000 7000 000 10000 000 20000 000 30000 000 7000 000 10000 000 20000 000 30000 000

7000 000 10000 000 20000 000 30000 000

7000 000 10000 000 20000 000 30000 000

250. 7000 000 10000 000 20000 000 30000 000 7000 000 10000 000 20000 000 30000 000 7000 000 10000 000 20000 000 30000 000

מדיניות מסווגת

דרישות מידע, דרישות זכויות, דרישות אחרות

251. (א) דרישות מידע, דרישות זכויות, דרישות אחרות, כפי שנקבעו, כפי שנקבעו, כפי שנקבעו.

(ב) דרישות מידע, דרישות זכויות, דרישות אחרות, כפי שנקבעו, כפי שנקבעו, כפי שנקבעו.

(ג) דרישות מידע, דרישות זכויות, דרישות אחרות, כפי שנקבעו, כפי שנקבעו, כפי שנקבעו.

(ד) דרישות מידע, דרישות זכויות, דרישות אחרות, כפי שנקבעו, כפי שנקבעו, כפי שנקבעו.

(ה) דרישות מידע, דרישות זכויות, דרישות אחרות, כפי שנקבעו, כפי שנקבעו, כפי שנקבעו.

252. (א) דרישות מידע, דרישות זכויות, דרישות אחרות, כפי שנקבעו, כפי שנקבעו, כפי שנקבעו.

סִימָנוֹתֵינוּ אֵינָם מְבִינִים אֶת הַמִּשְׁמָרִים הַלְלוּ אֱלֹהֵינוּ
וְהַמִּשְׁמָרִים הַלְלוּ אֱלֹהֵינוּ.

254. דְּרֹשׁוּ אֶת הַמִּשְׁמָרִים אֵיךְ הֵיוּ מְבִינִים אֶת הַמִּשְׁמָרִים הַלְלוּ אֱלֹהֵינוּ
וְהַמִּשְׁמָרִים הַלְלוּ אֱלֹהֵינוּ.

255. מִי־יִשְׁמַר אֶת הַמִּשְׁמָרִים אֵיךְ הֵיוּ מְבִינִים אֶת הַמִּשְׁמָרִים הַלְלוּ אֱלֹהֵינוּ
וְהַמִּשְׁמָרִים הַלְלוּ אֱלֹהֵינוּ.

256. אֵיךְ הֵיוּ מְבִינִים אֶת הַמִּשְׁמָרִים הַלְלוּ אֱלֹהֵינוּ
וְהַמִּשְׁמָרִים הַלְלוּ אֱלֹהֵינוּ.

הַמִּשְׁמָרִים הַלְלוּ אֱלֹהֵינוּ

וְהַמִּשְׁמָרִים הַלְלוּ אֱלֹהֵינוּ

257. אֵיךְ הֵיוּ מְבִינִים אֶת הַמִּשְׁמָרִים הַלְלוּ אֱלֹהֵינוּ
וְהַמִּשְׁמָרִים הַלְלוּ אֱלֹהֵינוּ.

הַמִּשְׁמָרִים הַלְלוּ אֱלֹהֵינוּ

וְהַמִּשְׁמָרִים הַלְלוּ אֱלֹהֵינוּ

258. (א) דְּרֹשׁוּ אֶת הַמִּשְׁמָרִים אֵיךְ הֵיוּ מְבִינִים אֶת הַמִּשְׁמָרִים הַלְלוּ אֱלֹהֵינוּ
וְהַמִּשְׁמָרִים הַלְלוּ אֱלֹהֵינוּ.

A

ນັກ ດຳນັດທຳນຽມ ຈັດສັນ ຫຼື ດຳນັດທຳນຽມ ສົ່ງເສີມ ຊີວິດ

ຊື່ນັກ ຈັດສັນ	ຊື່ນັກ ສົ່ງເສີມ ຊີວິດ
<p style="text-align: center;">ຊື່ນັກ ຈັດສັນ ທີ່ມີລາຍຮັບ ມາດຕະຖານ</p>	<p style="text-align: center;">ຊື່ນັກ ຈັດສັນ ທີ່ມີລາຍຮັບ ມາດຕະຖານ</p>
<p style="text-align: center;">ຊື່ນັກ ຈັດສັນ ທີ່ມີລາຍຮັບ ມາດຕະຖານ</p>	<p style="text-align: center;">ຊື່ນັກ ຈັດສັນ ທີ່ມີລາຍຮັບ ມາດຕະຖານ</p>
<p style="text-align: center;">ຊື່ນັກ ຈັດສັນ ທີ່ມີລາຍຮັບ ມາດຕະຖານ</p>	<p style="text-align: center;">ຊື່ນັກ ຈັດສັນ ທີ່ມີລາຍຮັບ ມາດຕະຖານ</p>
<p style="text-align: center;">1000/- ມື້</p>	<p style="text-align: center;">ຊື່ນັກ ຈັດສັນ ທີ່ມີລາຍຮັບ ມາດຕະຖານ</p>
<ul style="list-style-type: none"> • ຊື່ນັກ ຈັດສັນ ທີ່ມີລາຍຮັບ ມາດຕະຖານ • ຊື່ນັກ ຈັດສັນ ທີ່ມີລາຍຮັບ ມາດຕະຖານ • ຊື່ນັກ ຈັດສັນ ທີ່ມີລາຍຮັບ ມາດຕະຖານ • ຊື່ນັກ ຈັດສັນ ທີ່ມີລາຍຮັບ ມາດຕະຖານ • ຊື່ນັກ ຈັດສັນ ທີ່ມີລາຍຮັບ ມາດຕະຖານ • ຊື່ນັກ ຈັດສັນ ທີ່ມີລາຍຮັບ ມາດຕະຖານ • ຊື່ນັກ ຈັດສັນ ທີ່ມີລາຍຮັບ ມາດຕະຖານ • ຊື່ນັກ ຈັດສັນ ທີ່ມີລາຍຮັບ ມາດຕະຖານ 	<p style="text-align: center;">ຊື່ນັກ ຈັດສັນ ທີ່ມີລາຍຮັບ ມາດຕະຖານ</p>
<ul style="list-style-type: none"> • ຊື່ນັກ ຈັດສັນ ທີ່ມີລາຍຮັບ ມາດຕະຖານ 	<p style="text-align: center;">ຊື່ນັກ ຈັດສັນ ທີ່ມີລາຍຮັບ ມາດຕະຖານ</p>

ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ

ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ

- (1) 25/- ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ
- (2) 30/- ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ
- (3) 35/- ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ
- (4) 40/- ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ
- (6) 1000/- ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ
- (7) 500/- ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ
- (8) 50/- ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ

ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ

- (1) 1/- ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ
- (2) 100/- ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ

ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ

- (1) 1/- ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ
- (2) 15/- ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ ᠳᠠᠨᠤᠨᠢᠨᠠᠨᠢ ᠰᠤᠮᠤᠨᠠᠨᠢ

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

دَیْوَانِی سِیاسِی، دَیْوَانِی دَیْنِ، دَیْوَانِی جِناحِ

تاریخ: ۰۰/۰۰/۰۰

نِسْبَتِ اَسْمَاءِ، مَسْئَلَتِ رَجْعَتِ اَسْمَاءِ

E اَسْمَاءُ

تاریخ: ۰۰/۰۰/۰۰

مَسْئَلَتِ رَجْعَتِ اَسْمَاءِ

تاریخ: ۰۰/۰۰/۰۰

دَیْوَانِی

تاریخ: ۰۰/۰۰/۰۰

دَیْوَانِی سِیاسِی دَیْوَانِی دَیْنِ دَیْوَانِی جِناحِ

1.

2.

دَیْوَانِی سِیاسِی دَیْوَانِی دَیْنِ دَیْوَانِی جِناحِ

مَسْئَلَتِ رَجْعَتِ اَسْمَاءِ

دائره سوري قوسه

دائره سوري زوزو نامير قوسه زوزو نامير

دائره سوري زوزو نامير قوسه زوزو نامير

دائره سوري زوزو نامير قوسه زوزو نامير

قوسه زوزو نامير قوسه

سوري:

سوري:

سوري:

قوسه زوزو نامير قوسه

سوري:

سوري:

سوري:

دھیمیہ ڈیٹا سٹریٹجی کے لیے ڈیٹا سٹریٹجی رپورٹ کی تیاری

تاریخ: _____

صفحہ: _____

(تاریخ: _____)

F Արձանագրություն

Տվյալ արձանագրությունը:

հաստատված է:

հարգանքով:

Հարգանքով և արժեքավորությամբ ընդունված է արձանագրությունը, որով հաստատվում է արձանագրության մեջ նշված կետերը, որոնք համապատասխանում են ՀՀ Կոնստիտուցիայի 111-րդ հոդվածի 1-րդ կետին, որով հաստատվում է արձանագրության մեջ նշված կետերը, որոնք համապատասխանում են ՀՀ Կոնստիտուցիայի 111-րդ հոդվածի 1-րդ կետին:

Արձանագրությունը հաստատված է:

Հարգանքով և արժեքավորությամբ ընդունված է արձանագրությունը, որով հաստատվում է արձանագրության մեջ նշված կետերը, որոնք համապատասխանում են ՀՀ Կոնստիտուցիայի 111-րդ հոդվածի 1-րդ կետին:

1. Հարգանքով և արժեքավորությամբ ընդունված է արձանագրությունը, որով հաստատվում է արձանագրության մեջ նշված կետերը, որոնք համապատասխանում են ՀՀ Կոնստիտուցիայի 111-րդ հոդվածի 1-րդ կետին:
2. Հարգանքով և արժեքավորությամբ ընդունված է արձանագրությունը, որով հաստատվում է արձանագրության մեջ նշված կետերը, որոնք համապատասխանում են ՀՀ Կոնստիտուցիայի 111-րդ հոդվածի 1-րդ կետին:
3. Հարգանքով և արժեքավորությամբ ընդունված է արձանագրությունը, որով հաստատվում է արձանագրության մեջ նշված կետերը, որոնք համապատասխանում են ՀՀ Կոնստիտուցիայի 111-րդ հոդվածի 1-րդ կետին:
4. Հարգանքով և արժեքավորությամբ ընդունված է արձանագրությունը, որով հաստատվում է արձանագրության մեջ նշված կետերը, որոնք համապատասխանում են ՀՀ Կոնստիտուցիայի 111-րդ հոդվածի 1-րդ կետին:
5. Հարգանքով և արժեքավորությամբ ընդունված է արձանագրությունը, որով հաստատվում է արձանագրության մեջ նշված կետերը, որոնք համապատասխանում են ՀՀ Կոնստիտուցիայի 111-րդ հոդվածի 1-րդ կետին:
6. Հարգանքով և արժեքավորությամբ ընդունված է արձանագրությունը, որով հաստատվում է արձանագրության մեջ նշված կետերը, որոնք համապատասխանում են ՀՀ Կոնստիտուցիայի 111-րդ հոդվածի 1-րդ կետին:
7. Հարգանքով և արժեքավորությամբ ընդունված է արձանագրությունը, որով հաստատվում է արձանագրության մեջ նշված կետերը, որոնք համապատասխանում են ՀՀ Կոնստիտուցիայի 111-րդ հոդվածի 1-րդ կետին:

Հարգանքով:

Ստորագրող

ՀՀ Կոնստիտուցիոնալ դատարանի նախագահ

ދަރުކަވާލުކަން ދަނީ ދަނީ (ނަންބަރު 160)

ނަންބަރު 160 ގެ ދަށުން -

ދަރުކަވާލުކަން ދަނީ -

ދަރުކަވާލުކަން ދަނީ -

G

G
 161

.....
 161

161

.....
 161

161

1. 161

2. 161

3. 161

4. 161

5. 161

6. 161

7. 161

8. 28 208 (a) 208
9. (b)
10. 351
11. 352
12. 325
13. 02 07 361

361

361

361

361

1.

2.

މިއަހަރުގެ ފަންޓްޝަން ޖުޖުއިންޑް:

ސަރުކާރުގެ ސަރުކާރުގެ ޖުޖުއިންޑް:

މިއަހަރުގެ ފަންޓްޝަން ޖުޖުއިންޑް:

ފަންޓްޝަން ޖުޖުއިންޑްގެ ފަންޓްޝަން ޖުޖުއިންޑް:

ފަންޓްޝަން ޖުޖުއިންޑްގެ ފަންޓްޝަން ޖުޖުއިންޑް:

ފަންޓްޝަން ޖުޖުއިންޑްގެ ފަންޓްޝަން ޖުޖުއިންޑް:

ފަންޓްޝަން ޖުޖުއިންޑްގެ ފަންޓްޝަން ޖުޖުއިންޑް:

ފަންޓްޝަން ޖުޖުއިންޑްގެ ފަންޓްޝަން ޖުޖުއިންޑް:

ސަރުކާރު:

ފަންޓްޝަން ޖުޖުއިންޑްގެ ފަންޓްޝަން ޖުޖުއިންޑް:

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ



ދިވެހިރާއްޖޭގެ ޖުޖުދީޔު ދާއިރާގެ ޖުޖުދީޔު ޖަލްޞަދާ

ގަވާއިދު 11

ޖުޖުދީޔު ޖަލްޞަދާ.

..... ޖުޖުދީޔު ޖަލްޞަދާ :

ދިވެހިރާއްޖޭގެ ޖުޖުދީޔު ދާއިރާގެ ޖުޖުދީޔު ޖަލްޞަދާ ޖުޖުދީޔު ޖަލްޞަދާ

01 ޖުޖުދީޔު (ޖުޖުދީޔު ޖަލްޞަދާގެ ޖުޖުދީޔު ޖަލްޞަދާ 65.0 (ނ)، 65.0 (ސ))

ޖުޖުދީޔު ޖަލްޞަދާ :

..... ޖުޖުދީޔު ޖަލްޞަދާ :

ދިވެހިރާއްޖެ

..... ޖުޖުދީޔު ޖަލްޞަދާ :

ދިވެހިރާއްޖެ :

				تصريح سرسره (براد سرسره)
	براد سرسره :		براد سرسره :	براد سرسره / براد سرسره
			براد سرسره / براد سرسره :	تصريح براد سرسره :
			براد سرسره :	
			تصريح براد سرسره :	
			براد سرسره / براد سرسره :	تصريح براد سرسره :
			براد سرسره :	
			تصريح براد سرسره :	
		براد سرسره :		تصريح براد سرسره :
تصريح براد سرسره، تصريح براد سرسره، تصريح براد سرسره، تصريح براد سرسره، تصريح براد سرسره.				

04 تصريح براد سرسره :

.....

.....

.....

.....

.....

05 تصريح براد سرسره بر سرسره تصريح براد سرسره :

..... 1

.....

.....

.....

..... 2

.....

.....

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ



ՀԻՄԱՆԴՈՒ ԱԶԳԱՅԻՆ ԴՆԵՐՈՒԹՅԱՆ ԿՐԹԱԿԱՆ ԿՈՒՐՏԵՐ

Դ.Մ. ԲԵՐԿՈՒՆԻ

ԳՐԱԳՐԱՐԵՒՄ

ԳՐԱԳՐԱՐԵՒՄ ԿՐԹԱԿԱՆ ԿՈՒՐՏԵՐ

ԳՐԱԳՐԱՐԵՒՄ 02 (ԿՐԹԱԿԱՆ ԴՆԵՐՈՒԹՅԱՆ ԿՐԹԱԿԱՆ ԿՈՒՐՏԵՐ 101-Ն)

[Empty rectangular box]

ԿՐԹԱԿԱՆ ԿՈՒՐՏԵՐ :

ԿՐԹԱԿԱՆ ԿՈՒՐՏԵՐ :

ԿՐԹԱԿԱՆ

ԿՐԹԱԿԱՆ ԿՈՒՐՏԵՐ :

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ



ሰነድ ለግዴታ ለመገኘት ይገባል

ደንበኞች

የሰነድ ሰነድ

..... : የሰነድ ሰነድ

ሰነድ ለግዴታ ለመገኘት ይገባል

የሰነድ ሰነድ (ደንበኞች ለመገኘት ይገባል) 03

[Empty rectangular box for stamp or signature]

የሰነድ ሰነድ

የሰነድ ሰነድ

የሰነድ ሰነድ

የሰነድ ሰነድ

.....
.....
.....

هتي ڪم ٿيڻ

ڊوڪيومينٽ ۾ ڏنل سڀئي ڳالهه ڏانهن ڌيان ڏيو وڃي ٿو.

پتو:

پتو:

ڊوڪيومينٽ ۾ ڏنل سڀئي ڳالهه ڏانهن ڌيان ڏيو وڃي ٿو.

پتو:



අධිකරණ උද්ධමන පාලන බැංකු සභාව

හ. ර. රාජකාරි,

නුරුල්ල පාර.

නුරුල්ල පාර 04

නුරුල්ල පාර 04 (ත්‍රිකෝණාකාර ආකාරයෙන් කැප කිරීම) 106 (අ)

නුරුල්ල පාර :

නුරුල්ල පාර :

නුරුල්ල පාර :

නුරුල්ල පාර :

නුරුල්ල පාර :

6. නුරුල්ල පාර 04 හි පිහිටි ආකාරයේ කැප කිරීමක් නොකිරීම සඳහා පාර 11 හි නිවැරදි ලෙස කැප කිරීමක් සිදු කිරීමට අවශ්‍යය.

7. නුරුල්ල පාර 04 හි පිහිටි ආකාරයේ කැප කිරීමක් නොකිරීම සඳහා පාර 11 හි නිවැරදි ලෙස කැප කිරීමක් සිදු කිරීමට අවශ්‍යය.

8. නුරුල්ල පාර 04 හි පිහිටි ආකාරයේ කැප කිරීමක් නොකිරීම සඳහා පාර 12 හි නිවැරදි ලෙස කැප කිරීමක් සිදු කිරීමට අවශ්‍යය.

(قۇدى تۈسۈش ھەم)

بۇ تۈردىكى قۇدى تۈسۈش ھەم قۇدى تۈسۈش ھەم قۇدى تۈسۈش ھەم.

03 قۇدى تۈسۈش ھەم :

.....
.....
.....
.....

04 قۇدى تۈسۈش ھەم بۇ تۈردىكى قۇدى تۈسۈش ھەم :

.....
.....
.....
.....

05 قۇدى تۈسۈش ھەم بۇ تۈردىكى قۇدى تۈسۈش ھەم :

- ھەم.
- ھەم.

06 قۇدى تۈسۈش ھەم بۇ تۈردىكى قۇدى تۈسۈش ھەم بۇ تۈردىكى قۇدى تۈسۈش ھەم : / / /

07 قۇدى تۈسۈش ھەم بۇ تۈردىكى قۇدى تۈسۈش ھەم بۇ تۈردىكى قۇدى تۈسۈش ھەم :

- ھەم بۇ تۈردىكى قۇدى تۈسۈش ھەم.
- قۇدى تۈسۈش ھەم بۇ تۈردىكى قۇدى تۈسۈش ھەم 3 ھەم بۇ تۈردىكى قۇدى تۈسۈش ھەم.
- قۇدى تۈسۈش ھەم بۇ تۈردىكى قۇدى تۈسۈش ھەم 6 ھەم بۇ تۈردىكى قۇدى تۈسۈش ھەم.

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ



ދިވެހިރާއްޖޭގެ ޖުޖުމްހޫރިއްޔާ ގުޅިގެން ސަރުކާރުގެ ޖުޖުމްހޫރިއްޔާ

ގ.ގ. ރިޖިސްޓްރީ

ޖުޖުމްހޫރިއްޔާ

..... ފަންނަނުވާ : ފަންނަނުވާ

ސަރުކާރުގެ ޖުޖުމްހޫރިއްޔާ ގުޅިގެން ސަރުކާރުގެ ޖުޖުމްހޫރިއްޔާ ގުޅިގެން ސަރުކާރުގެ ޖުޖުމްހޫރިއްޔާ

ފަންނަނުވާ 05 (މަޢުލޫމާތު ދިނުމުގެ ޖުޖުމްހޫރިއްޔާ ގ.ގ. 107، ގ.ގ. 112، ގ.ގ. 131)

[Empty rectangular box for signature or stamp]

މަޢުލޫމާތު

ސަރުކާރު

މަޢުލޫމާތު ދިނުމުގެ ޖުޖުމްހޫރިއްޔާ

ހަދަ

މަޢުލޫމާތު ދިނުމުގެ ޖުޖުމްހޫރިއްޔާ

1.

...
...
...
2.

...
...
...

01 ...
...
...

- ...
- ...
- ...
- ...

02 ...
...
...

...

...

ފަންނަ ދަރިވަރުންނަށް ލިޔެދޭ ފޮތް:

1. ޖަވާބު ދަރިވަރުންނަށް ލިޔެދޭ ފޮތް. ޖަވާބު (ޖަވާބު ލިޔެދޭ ފޮތް) ، ލިޔެދޭ ފޮތް
ސަފުހާ ލިޔެދޭ، ލިޔެދޭ ފޮތް ލިޔެދޭ ފޮތް ލިޔެދޭ ފޮތް ލިޔެދޭ ފޮތް ލިޔެދޭ ފޮތް ލިޔެދޭ ފޮތް ލިޔެދޭ ފޮތް
ލިޔެދޭ ފޮތް ލިޔެދޭ ފޮތް.

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ



ދިވެހިރާއްޖޭގެ ޖުޖީޝިއުލް ޖިއުޑިޝިއަލް ސަރުކާރުގެ ގެޒެޓް

ގަވާއިދު،

ކަނޑުވަނަ ބައި.

ޖުޖީޝިއުލް ސަރުކާރުގެ ގެޒެޓް

ލިޔުން 06 (ޖުޖީޝިއުލް ސަރުކާރުގެ ގެޒެޓް 1110)

[Empty box for stamp or signature]

އިތުރު މަޢުލޫމާތު ހޯއްދެވުމަށް:

..... ޖުޖީޝިއުލް ސަރުކާރުގެ ގެޒެޓް:

ހަމަޚިދު

..... ޖުޖީޝިއުލް ސަރުކާރުގެ ގެޒެޓް:

ޖުޖީޝިއުލް ސަރުކާރުގެ ގެޒެޓް

1. ޖުޖީޝިއުލް ސަރުކާރުގެ ގެޒެޓް 14 ވަނަ ބައިގައި ޖުޖީޝިއުލް ސަރުކާރުގެ ގެޒެޓް.
2. ޖުޖީޝިއުލް ސަރުކާރުގެ ގެޒެޓް 14 ވަނަ ބައިގައި ޖުޖީޝިއުލް ސަރުކާރުގެ ގެޒެޓް 12 ވަނަ ބައިގައި ޖުޖީޝިއުލް ސަރުކާރުގެ ގެޒެޓް.
3. ޖުޖީޝިއުލް ސަރުކާރުގެ ގެޒެޓް 14 ވަނަ ބައިގައި ޖުޖީޝިއުލް ސަރުކާރުގެ ގެޒެޓް.
4. ޖުޖީޝިއުލް ސަރުކާރުގެ ގެޒެޓް 12 ވަނަ ބައިގައި ޖުޖީޝިއުލް ސަރުކާރުގެ ގެޒެޓް.
5. ޖުޖީޝިއުލް ސަރުކާރުގެ ގެޒެޓް 12 ވަނަ ބައިގައި ޖުޖީޝިއުލް ސަރުކާރުގެ ގެޒެޓް.
6. ޖުޖީޝިއުލް ސަރުކާރުގެ ގެޒެޓް 12 ވަނަ ބައިގައި ޖުޖީޝިއުލް ސަރުކާރުގެ ގެޒެޓް.

01 01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100

.....
.....
.....
.....

02 01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100

.....
.....
.....
.....

03 01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100

.....
.....
.....
.....

04 01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100

- 1.
- 2.

05 01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100

.....

.....

06 01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100

07 01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100

(ክርክር ዳይሬክቶሬት)

ገጽ 193

ክርክር ዳይሬክቶሬት ለግዴታ ለማሟላት የሚያስፈልገውን ሰነድ ይጻፉ።

ስም:

ስም:

ድንበይ ስም ለማሳደግ:

ጽሑፍ:

የግዴታ ሰነድ

7. ክርክር ዳይሬክቶሬት ለግዴታ ለማሟላት የሚያስፈልገውን ሰነድ ይጻፉ።



ދިވެހިރާއްޖޭގެ ޖުޖުކަން ދާއިރާގެ ޖަލީފުގެ އޮފީސް

މާލެ، ދިވެހިރާއްޖެ

ދިވެހިރާއްޖޭގެ ޖުޖުކަން ދާއިރާގެ ޖަލީފުގެ އޮފީސް

..... ފޮޓޯ ކޮޕީ ލިބިދެއްވާށެވެ :

ކަނޑުކޮށް ދެނެގަތުމަށް ފޮޓޯ ކޮޕީ

ފޮޓޯ ކޮޕީ (ދަފްތަރުގެ ތެރޭގައި ހިފެހޮއްވާފައިވާ 114)



ފޮޓޯ ކޮޕީ ލިބިދެއްވާށެވެ

ކަނޑުކޮށް ދެނެގަތުމަށް ފޮޓޯ ކޮޕީ

މަނިކު

ކަނޑުކޮށް ދެނެގަތުމަށް ފޮޓޯ ކޮޕީ

ދަފްތަރުގެ ތެރޭގައި ހިފެހޮއްވާފައިވާ

1. ފޮޓޯ ކޮޕީ ލިބިދެއްވާށެވެ
2. ފޮޓޯ ކޮޕީ ލިބިދެއްވާށެވެ ނުވަތަ ފޮޓޯ ކޮޕީ ލިބިދެއްވާށެވެ 14 ދުވަހުގެ ތެރޭގައި ފޮޓޯ ކޮޕީ ލިބިދެއްވާށެވެ

3. Լիցի առօրյա օրվա ընթացքում կատարվող փոփոխությունները կատարվում են միայն իրենց հարմարությամբ:
4. Դրոշմի կատարման օրվա ընթացքում կատարվում է:
 - (ա) Դրոշմի կատարման օրվա ընթացքում կատարվող փոփոխությունները կատարվում են միայն իրենց հարմարությամբ:
 - (բ) Դրոշմի կատարման օրվա ընթացքում կատարվող փոփոխությունները կատարվում են միայն իրենց հարմարությամբ:
 - (գ) Դրոշմի կատարման օրվա ընթացքում կատարվող փոփոխությունները կատարվում են միայն իրենց հարմարությամբ:
 - (դ) Դրոշմի կատարման օրվա ընթացքում կատարվող փոփոխությունները կատարվում են միայն իրենց հարմարությամբ:
 - (ե) Դրոշմի կատարման օրվա ընթացքում կատարվող փոփոխությունները կատարվում են միայն իրենց հարմարությամբ:
5. Դրոշմի կատարման օրվա ընթացքում կատարվող փոփոխությունները կատարվում են միայն իրենց հարմարությամբ:
6. Դրոշմի կատարման օրվա ընթացքում կատարվող փոփոխությունները կատարվում են միայն իրենց հարմարությամբ:
7. Դրոշմի կատարման օրվա ընթացքում կատարվող փոփոխությունները կատարվում են միայն իրենց հարմարությամբ:
8. Դրոշմի կատարման օրվա ընթացքում կատարվող փոփոխությունները կատարվում են միայն իրենց հարմարությամբ:
9. Դրոշմի կատարման օրվա ընթացքում կատարվող փոփոխությունները կատարվում են միայն իրենց հարմարությամբ:
10. Դրոշմի կատարման օրվա ընթացքում կատարվող փոփոխությունները կատարվում են միայն իրենց հարմարությամբ:
11. Դրոշմի կատարման օրվա ընթացքում կատարվող փոփոխությունները կատարվում են միայն իրենց հարմարությամբ:
12. Դրոշմի կատարման օրվա ընթացքում կատարվող փոփոխությունները կատարվում են միայն իրենց հարմարությամբ:

01 جے کرپوریشن آرڈیننس ایسٹیبلیشمنٹ ایکٹ

کرپوریشن ایسٹیبلیشمنٹ ایکٹ:

.....
.....
.....

02 ڈائریکٹوریٹ آف سٹیٹس ریگولیشن ایکٹ (جے کرپوریشن ایکٹ کے تحت) ایسٹیبلیشمنٹ ایکٹ
ایسٹیبلیشمنٹ ایکٹ (جے کرپوریشن ایکٹ کے تحت)

.....
.....
.....

03 کرپوریشن ایکٹ

.....
.....
.....

(فوقی کورٹ کے لیے)

ذیل کے ناموں کے ساتھ ساتھ

04 ذیل کے برقیوں کے ساتھ ساتھ برقیوں کے ساتھ ساتھ:

برقیوں کے ساتھ ساتھ

برقیوں کے ساتھ ساتھ

05 ذیل کے ناموں کے ساتھ ساتھ:

برقیوں کے ساتھ ساتھ

برقیوں کے ساتھ ساتھ

برقیوں کے ساتھ ساتھ

07 ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា : ក្រសួងយុត្តិធម៌

		ឃ្លា ស្រួល / ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា :	ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា :
		រដ្ឋបាល កម្ពុជា :	
		ក្រសួង :	
		ឃ្លា ស្រួល / ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា :	ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា :
		រដ្ឋបាល កម្ពុជា :	
		ក្រសួង :	
	ឃ្លា ស្រួល កម្ពុជា :		ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា :
			ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា :

(ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា)

ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា

08 ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា : ក្រសួងយុត្តិធម៌

		ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា (ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា) :	
	ក្រសួង :	ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា :	ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា / ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា :
		ឃ្លា ស្រួល / ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា :	ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា :
		រដ្ឋបាល កម្ពុជា :	
		ក្រសួង :	
		ឃ្លា ស្រួល / ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា :	ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា :
		រដ្ឋបាល កម្ពុជា :	
		ក្រសួង :	
	ឃ្លា ស្រួល កម្ពុជា :		ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា :
			ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា :

09 ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា : ក្រសួងយុត្តិធម៌

		ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា (ក្រសួងយុត្តិធម៌ កម្ពុជា) :
--	--	---

			ក្រសួងយុត្តិធម៌ អគ្គនាយកដ្ឋានសវនកម្ម ភ្នំពេញ
	លេខ: ១២៣		

(ក្រសួងយុត្តិធម៌)

អគ្គនាយក

ខ្ញុំ ក្រសួងយុត្តិធម៌ មានបញ្ជូនឯកសារដូចខាងក្រោម ជូនលោកស្រី វណ្ណឌី ធីតា ភ្នំពេញ

ស្រី:

ស្រី:

ក្រសួងយុត្តិធម៌

អគ្គនាយក

1 ވަނަ ބައި ގައި ބަޔާންކޮށްފައިވާ ގޮތަށް ދިވެހިރާއްޖޭގެ ޖުޖުކާނާގެ ޖުޖުކާނާ.

			ຈຳນວນ ສິນ (ຈຳນວນ ສິນ) :
ຈຳນວນ :	ຈຳນວນ ສິນ :		ຈຳນວນ ສິນ / ຈຳນວນ ສິນ :
		ຈຳນວນ ສິນ / ຈຳນວນ ສິນ :	ຈຳນວນ ສິນ :
		ຈຳນວນ ສິນ :	
		ຈຳນວນ ສິນ :	
		ຈຳນວນ ສິນ / ຈຳນວນ ສິນ :	ຈຳນວນ ສິນ ຈຳນວນ ສິນ :
		ຈຳນວນ ສິນ :	
		ຈຳນວນ ສິນ :	
	ຈຳນວນ ສິນ :		ຈຳນວນ ສິນ :
			ຈຳນວນ ສິນ ຈຳນວນ ສິນ ຈຳນວນ ສິນ ຈຳນວນ ສິນ

			ຈຳນວນ ສິນ (ຈຳນວນ ສິນ) :
ຈຳນວນ :	ຈຳນວນ ສິນ :		ຈຳນວນ ສິນ / ຈຳນວນ ສິນ :
		ຈຳນວນ ສິນ / ຈຳນວນ ສິນ :	ຈຳນວນ ສິນ :
		ຈຳນວນ ສິນ :	
		ຈຳນວນ ສິນ :	
		ຈຳນວນ ສິນ / ຈຳນວນ ສິນ :	ຈຳນວນ ສິນ ຈຳນວນ ສິນ :
		ຈຳນວນ ສິນ :	
		ຈຳນວນ ສິນ :	
	ຈຳນວນ ສິນ :		ຈຳນວນ ສິນ :
			ຈຳນວນ ສິນ ຈຳນວນ ສິນ ຈຳນວນ ສິນ ຈຳນວນ ສິນ

03- Գործընթացի և արդյունքի մասին տեղեկություններ (ընդհանուր և մասնավոր) և արդյունքի մասին տեղեկություններ

Ներկայացնում են հետևյալ տվյալները (ընդհանուր)

.....
.....
.....
.....

04- Գործընթացի և արդյունքի մասին տեղեկություններ (ընդհանուր և մասնավոր)

- 1.
- 2.

Գործընթաց

Գործընթացի մասին տեղեկություններ (ընդհանուր և մասնավոր)

Գործընթաց:

.....

Գործընթաց:

.....

Գործընթացի մասին տեղեկություններ (ընդհանուր և մասնավոր)

.....

Գործընթաց:

.....

Գործընթացի և արդյունքի մասին տեղեկություններ

- 1. Գործընթացի մասին տեղեկություններ (ընդհանուր և մասնավոր) և արդյունքի մասին տեղեկություններ
- 2. Գործընթացի մասին տեղեկություններ (ընդհանուր և մասնավոր) և արդյունքի մասին տեղեկություններ
- 3. Գործընթացի մասին տեղեկություններ (ընդհանուր և մասնավոր) և արդյունքի մասին տեղեկություններ



அமைச்சு அமைச்சர் அலுவலகம்

மாநகர், மலேசியா

செப்டம்பர் 2023

..... : சமர்ப்பிக்கப்பட்டது

சமர்ப்பிக்கப்பட்டது

சமர்ப்பிக்கப்பட்டது 09 (சமர்ப்பிக்கப்பட்டது 117.0)

[Empty rectangular box for stamp or signature]

சமர்ப்பிக்கப்பட்டது

சமர்ப்பிக்கப்பட்டது

சமர்ப்பிக்கப்பட்டது

சமர்ப்பிக்கப்பட்டது

சமர்ப்பிக்கப்பட்டது

1. சமர்ப்பிக்கப்பட்டது 14 சமர்ப்பிக்கப்பட்டது
2. சமர்ப்பிக்கப்பட்டது
3. சமர்ப்பிக்கப்பட்டது 12 சமர்ப்பிக்கப்பட்டது
4. சமர்ப்பிக்கப்பட்டது
5. சமர்ப்பிக்கப்பட்டது

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

مۆھرىم

بۇ مۆھرىم تىرىش ۋەزىپىسىنى ئادا قىلىش ئۈچۈن تۆۋەندىكى ئىشلارنى قىلىشى كېرەك:

سېلىق:

مەبلەغ:

بۇ مۆھرىم تىرىش ۋەزىپىسىنى ئادا قىلىش ئۈچۈن:

مۆھرىم

مۆھرىم تىرىش ۋەزىپىسىنى ئادا قىلىش ئۈچۈن:

1. بۇ مۆھرىم تىرىش ۋەزىپىسىنى ئادا قىلىش ئۈچۈن تۆۋەندىكى ئىشلارنى قىلىشى كېرەك:

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ



TRIBUNAL DE JUSTIÇA


澳門司法

法院

.....: 2020

第 10 條

第 10 條 (2020年11月10日)



日期

簽署

.....: 2020

第 10 條

.....: 2020

第 10 條

1. 凡在澳門司法法院內擔任法官職務者，均須遵守本條所訂之規定。

2. 凡在澳門司法法院內擔任法官職務者，均須遵守本條所訂之規定。

3. 凡在澳門司法法院內擔任法官職務者，均須遵守本條所訂之規定。

4. 凡在澳門司法法院內擔任法官職務者，均須遵守本條所訂之規定。

5. 凡在澳門司法法院內擔任法官職務者，均須遵守本條所訂之規定。

6. 凡在澳門司法法院內擔任法官職務者，均須遵守本條所訂之規定。

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

(ښوونکی)

په دې توګه د ښوونکي د ښوونځي د نوم او د ښوونځي د نوم لیکل شوي دي

04. ښوونکي د ښوونځي د نوم لیکل شوي دي

				ښوونکي د نوم (ښوونځي نوم) :
	ښوونځي نوم :		ښوونکي نوم :	ښوونکي د نوم لیکل شوي دي / ښوونځي نوم : ښوونکي نوم :
				ښوونکي د نوم لیکل شوي دي :
ښوونکي نوم / ښوونځي نوم :				
ښوونکي نوم :				
ښوونځي نوم :				
				ښوونکي د نوم لیکل شوي دي :
ښوونکي نوم / ښوونځي نوم :				
ښوونکي نوم :				
ښوونځي نوم :				
			ښوونکي د نوم لیکل شوي دي :	ښوونکي د نوم لیکل شوي دي :

1



REPUBLIC OF TIMOR-LESTE
MINISTRY OF JUSTICE

Dili, Timor-Leste

2024

Case No:

IN THE COURT OF APPEALS

Case No. 11 (Appellate Review of Judgment No. 119/2024)

[Empty box for case details]

Case No.

Appellant

vs

Respondent

MEMORANDUM

1. The appellant seeks to set aside the judgment of the Court of First Instance dated 15/11/2024, which found in favor of the respondent. The appellant argues that the court erred in its application of the law and in its assessment of the evidence.
2. The respondent seeks to confirm the judgment of the Court of First Instance. The respondent argues that the court correctly applied the law and that the evidence supports its finding.
3. The appellant seeks an order for costs. The appellant argues that it has been unjustly enriched by the respondent's successful defense.
4. The respondent seeks an order for costs. The respondent argues that it has been unjustly enriched by the appellant's successful appeal.
5. The appellant seeks an order for costs. The appellant argues that it has been unjustly enriched by the respondent's successful defense.

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

.....

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

بِسْمِ اللَّهِ

بِسْمِ اللَّهِ

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

بِسْمِ اللَّهِ

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ



අධිකරණ අධිකරණ පදනමේ පිළිගැනීමේ ලේඛන

අංක. 1/2009

දිනය: 2009

.....: පිටපත් කිරීමේදී

නිවැරදිව පැහැදිලි කර ඇති පිටපත් කිරීමේදී

12 (අධිකරණ පදනමේ පිළිගැනීමේ ලේඛන 120)

[Empty rectangular box]

පිටපත් කිරීමේදී:

අධිකරණ පදනමේ පිළිගැනීමේදී:

.....

අනෙක්

අධිකරණ පදනමේ පිළිගැනීමේදී:

.....

අධිකරණ පදනමේ පිළිගැනීමේදී

- 17. පිටපත් කිරීමේදී පිළිගැනීමේදී පිළිගැනීමේදී.
- 18. පිටපත් කිරීමේදී පිළිගැනීමේදී පිළිගැනීමේදී, පිටපත් කිරීමේදී 12 යනු. පිළිගැනීමේදී පිළිගැනීමේදී.
- 19. පිටපත් කිරීමේදී පිළිගැනීමේදී පිළිගැනීමේදී පිළිගැනීමේදී පිළිගැනීමේදී.
- 20. පිටපත් කිරීමේදී පිළිගැනීමේදී පිළිගැනීමේදී පිළිගැනීමේදී පිළිගැනීමේදී.

				ਤੁਕੋ ਸੇਵਾ ਸੇਵਾ (ਸੇਵਾ ਸੇਵਾ) :
ਤੁਕੋ :	ਤੁਕੋ :			ਸੇਵਾ ਸੇਵਾ / ਸੇਵਾ ਸੇਵਾ :
			ਤੁਕੋ / ਸੇਵਾ ਸੇਵਾ :	ਤੁਕੋ ਸੇਵਾ :
			ਤੁਕੋ :	
			ਤੁਕੋ / ਸੇਵਾ ਸੇਵਾ :	
			ਤੁਕੋ :	ਤੁਕੋ ਸੇਵਾ :
			ਤੁਕੋ :	
			ਤੁਕੋ / ਸੇਵਾ ਸੇਵਾ :	
		ਤੁਕੋ ਸੇਵਾ :		ਤੁਕੋ ਸੇਵਾ :
				ਤੁਕੋ ਸੇਵਾ ਸੇਵਾ ਸੇਵਾ ਸੇਵਾ ਸੇਵਾ

04- ਤੁਕੋ ਸੇਵਾ ਸੇਵਾ ਸੇਵਾ ਸੇਵਾ ਸੇਵਾ

.....

.....

.....

05- ਤੁਕੋ ਸੇਵਾ ਸੇਵਾ ਸੇਵਾ ਸੇਵਾ ਸੇਵਾ

.....

.....

.....

06- ਤੁਕੋ ਸੇਵਾ ਸੇਵਾ ਸੇਵਾ ਸੇਵਾ ਸੇਵਾ

.....

.....

.....

07- ਤੁਕੋ ਸੇਵਾ ਸੇਵਾ ਸੇਵਾ ਸੇਵਾ ਸੇਵਾ

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ



අභ්‍යන්තර අධිකරණ පදනමේ සේවා කොටස

අංක. 12/2020

ප්‍රකාශනය.

.....: මුද්‍රණය

නිවැරදි අභ්‍යන්තර අධිකරණ පදනමේ සේවා කොටස

මුද්‍රණය 12 (විකුණු කළ ප්‍රකාශනයේ කොටස 120)

විකුණු කළ ප්‍රකාශනය:

විකුණු කළ ප්‍රකාශනය:

.....

අනෙකුත්

විකුණු කළ ප්‍රකාශනය:

.....

අභ්‍යන්තර අධිකරණ

21. මුද්‍රණය කළ ප්‍රකාශනයේ කොටස 120.
22. මුද්‍රණය කළ ප්‍රකාශනයේ කොටස 120, මුද්‍රණය කළ ප්‍රකාශනයේ කොටස 120.
23. මුද්‍රණය කළ ප්‍රකාශනයේ කොටස 120, මුද්‍රණය කළ ප්‍රකාශනයේ කොටස 120.
24. මුද්‍රණය කළ ප්‍රකාශනයේ කොටස 120, මුද්‍රණය කළ ප්‍රකාශනයේ කොටස 120.

03- අයිතියක් සහිතව පවතින ආදායම් පත්‍රයක් සම්බන්ධයෙන්

			දිනපතා (අවුරුදු) :
දිනපතා :	අයිතියක් සහිතව :	අයිතියක් සහිතව / අයිතියක් සහිතව :	
		දිනපතා :	අයිතියක් සහිතව :
		අයිතියක් සහිතව :	
		දිනපතා :	
		දිනපතා / අයිතියක් සහිතව :	අයිතියක් සහිතව :
		අයිතියක් සහිතව :	
		දිනපතා :	
	අයිතියක් සහිතව :	අයිතියක් සහිතව :	
දිනපතා / අයිතියක් සහිතව			

04- අයිතියක් සහිතව පවතින ආදායම් පත්‍රයක් සම්බන්ධයෙන්

.....

05- අයිතියක් සහිතව පවතින ආදායම් පත්‍රයක් සම්බන්ධයෙන්

.....

06- අයිතියක් සහිතව පවතින ආදායම් පත්‍රයක් සම්බන්ධයෙන්

.....

07- Իրազեացման և դատական կարգի սահմանափակումը:

Գործարկի համար (Հարկի արժեք):		
Հարկի տեսակ:	Հարկի արժեք:	Տեսական / Կատարյալ հարկ: Կապիտալ:
Գործարկի միջնորդ:		
Կապիտալ: Կապիտալ:		
Կապիտալի արժեք: Կապիտալի արժեք: Կապիտալի արժեք:		
Կապիտալի արժեք: Կապիտալի արժեք: Կապիտալի արժեք:		
Կապիտալի արժեք: Կապիտալի արժեք: Կապիտալի արժեք:		
Կապիտալի արժեք: Կապիտալի արժեք: Կապիտալի արժեք:		
Կապիտալի արժեք: Կապիտալի արժեք: Կապիտալի արժեք:		
Կապիտալի արժեք: Կապիտալի արժեք: Կապիտալի արժեք:		

Իրազեացման

Գործարկի կատարման և իրազեացման համար պահանջարկները:

Տեսք:

Տեսք:

Կապիտալի արժեք: Կապիտալի արժեք:

Կապիտալ:

Գործարկի ներդրումները:

- Կապիտալի արժեք: Կապիտալի արժեք: Կապիտալի արժեք:
- Կապիտալի արժեք: Կապիտալի արժեք: Կապիտալի արժեք:
- Կապիտալի արժեք: Կապիտալի արժեք: Կապիտալի արժեք:



අභ්‍යන්තර අදිකාරිකම රාජකාරි කුලසභාවේ විභාග


නම :

ලිපිනය :

දින :

අදිකාරිකම රාජකාරි කුලසභාවේ

දින 13 (අදිකාරිකම රාජකාරි කුලසභාවේ කාර්යාලයේ)



නම ඇතුළත් කරන්න

නම :

අත්සන

නම :

අදිකාරිකම

25. අදිකාරිකම රාජකාරි කුලසභාවේ විභාගයේ සඳහා සහභාගීත්වය ලබාදීමට සූදානම්ව සිටින සුදුසුකම් සහ අවශ්‍යතා පිළිබඳව විකල්ප ලිඛිත පරීක්ෂණයක් පවැත්වෙනු ඇත.

විකල්ප ලිඛිත පරීක්ෂණයේ සහභාගීත්වය ලබාදීමට සූදානම්ව සිටින සුදුසුකම් සහ අවශ්‍යතා පිළිබඳව විකල්ප ලිඛිත පරීක්ෂණයක් පවැත්වෙනු ඇත.

26. දින 12 තුළ විකල්ප ලිඛිත පරීක්ෂණයක් පවැත්වෙනු ඇත.

27. දින 12 තුළ විකල්ප ලිඛිත පරීක්ෂණයක් පවැත්වෙනු ඇත. විකල්ප ලිඛිත පරීක්ෂණයේ සහභාගීත්වය ලබාදීමට සූදානම්ව සිටින සුදුසුකම් සහ අවශ්‍යතා පිළිබඳව විකල්ප ලිඛිත පරීක්ෂණයක් පවැත්වෙනු ඇත.

28. දින 12 තුළ විකල්ප ලිඛිත පරීක්ෂණයක් පවැත්වෙනු ඇත.

29. දින 12 තුළ විකල්ප ලිඛිත පරීක්ෂණයක් පවැත්වෙනු ඇත.

30. අදිකාරිකම රාජකාරි කුලසභාවේ විභාගයේ සඳහා සහභාගීත්වය ලබාදීමට සූදානම්ව සිටින සුදුසුකම් සහ අවශ්‍යතා පිළිබඳව විකල්ප ලිඛිත පරීක්ෂණයක් පවැත්වෙනු ඇත.

විකල්ප ලිඛිත පරීක්ෂණයේ සහභාගීත්වය ලබාදීමට සූදානම්ව සිටින සුදුසුකම් සහ අවශ්‍යතා පිළිබඳව විකල්ප ලිඛිත පරීක්ෂණයක් පවැත්වෙනු ඇත.

31. දින 12 තුළ විකල්ප ලිඛිත පරීක්ෂණයක් පවැත්වෙනු ඇත.

32. දින 12 තුළ විකල්ප ලිඛිත පරීක්ෂණයක් පවැත්වෙනු ඇත. විකල්ප ලිඛිත පරීක්ෂණයේ සහභාගීත්වය ලබාදීමට සූදානම්ව සිටින සුදුසුකම් සහ අවශ්‍යතා පිළිබඳව විකල්ප ලිඛිත පරීක්ෂණයක් පවැත්වෙනු ඇත.

අභ්‍යන්තර අදිකාරිකම රාජකාරි කුලසභාවේ

දුරකථන : aa-himandhoo@judiciary.gov.mv | ෆැක්ස් : aa-himandhoo-courts.gov.mv

01

.....

02

- 1.
- 2.
- 3.

03

()

04

.....

05 قانونی ۵۵ ۲۰۲۰

۱. قانونی ۵۵ ۲۰۲۰

س. ۵

س. ۵

قانونی ۵۵ ۲۰۲۰

س. ۵

قانونی ۵۵ ۲۰۲۰

۲. قانونی ۵۵ ۲۰۲۰

(٢٠٢٢)

١٠٠٠ : ٢٠٢٢

٥. ٢٠٢٢ : ٢٠٢٢

٢٠٢٢

٢٠٢٢

٦. ٢٠٢٢ : ٢٠٢٢

٢٠٢٢

٢٠٢٢

٧. ٢٠٢٢ : ٢٠٢٢

٢٠٢٢

٢٠٢٢

٢٠٢٢

٨. ٢٠٢٢ : ٢٠٢٢

٢٠٢٢

٢٠٢٢

9. **ក្រសួងសេដ្ឋកិច្ច និងហិរញ្ញវត្ថុ មានតួនាទីសំខាន់ណាមួយក្នុងការទប់ទល់នឹងការប្រែប្រួលអាក្រក់នៃលទ្ធផលស្រាវជ្រាវសេដ្ឋកិច្ច និងហិរញ្ញវត្ថុ**

ស្របច្បាប់ ៖

ទាប

ខ្ពស់

(ចុះឈ្មោះ)

ចំណុចសំខាន់ៗ :

គ្រឹះស្ថានហិរញ្ញវត្ថុ

អាជីវកម្ម

10. **គ្រឹះស្ថានហិរញ្ញវត្ថុ និងអាជីវកម្ម មានតួនាទីសំខាន់ណាមួយក្នុងការទប់ទល់នឹងការប្រែប្រួលអាក្រក់នៃលទ្ធផលស្រាវជ្រាវសេដ្ឋកិច្ច និងហិរញ្ញវត្ថុ**

		ចំណុចសំខាន់ៗ (ចុះឈ្មោះ) :	
	ចំណុចសំខាន់ៗ :	ចំណុចសំខាន់ៗ :	ចំណុចសំខាន់ៗ :
		ស្ថានភាពសេដ្ឋកិច្ច និងហិរញ្ញវត្ថុ :	គំរិតសេដ្ឋកិច្ច និងហិរញ្ញវត្ថុ :
		ស្ថានភាពអាជីវកម្ម :	
		តម្លៃស្រាវជ្រាវសេដ្ឋកិច្ច និងហិរញ្ញវត្ថុ :	
		ស្ថានភាពសេដ្ឋកិច្ច និងហិរញ្ញវត្ថុ :	កម្រិត និងលទ្ធផលស្រាវជ្រាវសេដ្ឋកិច្ច និងហិរញ្ញវត្ថុ :
		ស្ថានភាពអាជីវកម្ម :	
		តម្លៃស្រាវជ្រាវសេដ្ឋកិច្ច និងហិរញ្ញវត្ថុ :	
		លទ្ធផលស្រាវជ្រាវសេដ្ឋកិច្ច និងហិរញ្ញវត្ថុ :	ចំណុចសំខាន់ៗ :
		លទ្ធផលស្រាវជ្រាវសេដ្ឋកិច្ច និងហិរញ្ញវត្ថុ និងការប្រែប្រួលអាក្រក់នៃលទ្ធផលស្រាវជ្រាវសេដ្ឋកិច្ច និងហិរញ្ញវត្ថុ :	

គ្រឹះស្ថានហិរញ្ញវត្ថុ :

លទ្ធផលស្រាវជ្រាវសេដ្ឋកិច្ច និងហិរញ្ញវត្ថុ : _____ លទ្ធផលស្រាវជ្រាវសេដ្ឋកិច្ច និងហិរញ្ញវត្ថុ :

ក្រសួងសេដ្ឋកិច្ច និងហិរញ្ញវត្ថុ, គ្រឹះស្ថានហិរញ្ញវត្ថុ និងអាជីវកម្ម ស្រាវជ្រាវសេដ្ឋកិច្ច និងហិរញ្ញវត្ថុ និងការប្រែប្រួលអាក្រក់នៃលទ្ធផលស្រាវជ្រាវសេដ្ឋកិច្ច និងហិរញ្ញវត្ថុ : _____

គ្រឹះស្ថានហិរញ្ញវត្ថុ និងអាជីវកម្ម : _____

11. ڪوٽيشن نامو ۽ ڪوٽيشن آفيس : _____

		ڪي ڪيس / ٻيڙي ڪوٽيشن آفيس : _____	ڪوٽيشن آفيس : _____
		ڪوٽيشن آفيس : _____	
		ڪوٽيشن : _____	
		ڪي ڪيس / ٻيڙي ڪوٽيشن آفيس : _____	ڪوٽيشن آفيس : _____
		ڪوٽيشن آفيس : _____	
		ڪوٽيشن : _____	
	ڪوٽيشن آفيس : _____		ڪوٽيشن آفيس : _____
		ڪوٽيشن آفيس ۽ ڪوٽيشن آفيس : _____	

(ڪوٽيشن ڪوٽيشن آفيس)

ڪوٽيشن ۽ ڪوٽيشن آفيس ڪوٽيشن آفيس : _____

12. ڪوٽيشن نامو ۽ ڪوٽيشن آفيس : _____

		ڪوٽيشن آفيس (ٻيڙي ڪوٽيشن) : _____	
	ڪوٽيشن : _____	ڪوٽيشن آفيس : _____	ڪوٽيشن آفيس / ڪوٽيشن آفيس : _____
		ڪي ڪيس / ٻيڙي ڪوٽيشن آفيس : _____	ڪوٽيشن آفيس : _____
		ڪوٽيشن آفيس : _____	
		ڪوٽيشن : _____	
		ڪي ڪيس / ٻيڙي ڪوٽيشن آفيس : _____	ڪوٽيشن آفيس : _____
		ڪوٽيشن آفيس : _____	
		ڪوٽيشن : _____	

ڌڻي سڃاڻڻ :		ڊاڪٽر آءِ ايم ڪوٽو :
ڌڻي سڃاڻڻ ۽ وڌيڪ معلومات ڏانهن ڏيکاريو آيو آهي :		

13. ڌڻي سڃاڻڻ :		
ڌڻي سڃاڻڻ :		ڌڻي سڃاڻڻ (ڊاڪٽر سڃاڻڻ) :
ڌڻي سڃاڻڻ :	ڌڻي سڃاڻڻ :	ڌڻي سڃاڻڻ / ڌڻي سڃاڻڻ :
ڌڻي سڃاڻڻ / ڌڻي سڃاڻڻ :		ڌڻي سڃاڻڻ :
ڌڻي سڃاڻڻ :		
ڌڻي سڃاڻڻ :		
ڌڻي سڃاڻڻ / ڌڻي سڃاڻڻ :		ڌڻي سڃاڻڻ :
ڌڻي سڃاڻڻ :		
ڌڻي سڃاڻڻ :		
ڌڻي سڃاڻڻ :	ڌڻي سڃاڻڻ :	
ڌڻي سڃاڻڻ ۽ وڌيڪ معلومات ڏانهن ڏيکاريو آيو آهي :		

(ڌڻي سڃاڻڻ ۽ وڌيڪ معلومات)

ڌڻي سڃاڻڻ :

ڌڻي سڃاڻڻ ۽ وڌيڪ معلومات ڏانهن ڏيکاريو آيو آهي :

ڌڻي سڃاڻڻ :

ڌڻي سڃاڻڻ :

ڌڻي سڃاڻڻ ۽ وڌيڪ معلومات ڏانهن ڏيکاريو آيو آهي :

ਫੌਜ਼ਲਾਨਾ ਸਰਕਾਰੀ ਕੋਰਟ

1. ਫੌਜ਼ਲਾਨਾ ਸਰਕਾਰੀ ਕੋਰਟ ਵਿਖੇ ਆਈ. ਐੱਸ. ਐੱਸ. ਦੀ ਸੇਵਾ ਵਿੱਚ ਸ਼ਾਮਲ ਕਰਨ ਦੀ ਅਰਜ਼ੀ.

6. ជំនួយការសវនាការត្រូវតែមានចំណេះដឹងយ៉ាងតិច 12 ខែ។ ក្រុមការងារសវនាការត្រូវតែមានសមត្ថកិច្ចប្រចាំឆ្នាំ / ឆ្នាំ រដ្ឋបាល។
7. ជំនួយការសវនាការត្រូវតែមានចំណេះដឹងយ៉ាងតិច 25 ខែ រឬច្រើនជាងនេះបើសិនជាមានបទពិសោធន៍ស្រដៀងគ្នា។
8. ត្រូវមានបទពិសោធន៍យ៉ាងតិច 25 ខែ (ឬច្រើនជាង) ក្នុងតំណែងជំនួយការសវនាការ។
9. ជំនួយការសវនាការត្រូវតែមានចំណេះដឹងយ៉ាងតិច 25 ខែ រឬច្រើនជាងនេះបើសិនជាមានបទពិសោធន៍ស្រដៀងគ្នា។

01 តារាងលិខិតស្នើសុំ :

			ជំនួយការសវនាការ (រូបិយប័ណ្ណ) :
	: ឈ្មោះ :	: តំណែង :	: អាសយដ្ឋាន / ទីស្នាក់នៅ :
			ត្រូវបានចែកចាយ :
			: ឈ្មោះ :
			: តំណែង :
			: អាសយដ្ឋាន / ទីស្នាក់នៅ :
			: ឈ្មោះ :
			: តំណែង :
			: អាសយដ្ឋាន :
			: ទីស្នាក់នៅ / ទីស្នាក់ការ :
: ឈ្មោះ និងអាសយដ្ឋាន :			

02 តារាងលិខិតស្នើសុំ :

			ជំនួយការសវនាការ (រូបិយប័ណ្ណ) :
	: ឈ្មោះ :	: តំណែង :	: អាសយដ្ឋាន / ទីស្នាក់នៅ :
			ត្រូវបានចែកចាយ :
			: ឈ្មោះ :
			: តំណែង :
			: អាសយដ្ឋាន / ទីស្នាក់នៅ :

	<p>.....</p> <p>.....</p>	<p>.....</p>
	<p>.....</p>	<p>.....</p>
	<p>.....</p>	<p>.....</p>
	<p>.....</p>	
<p>.....</p>		

03

- 6.
- 7.
- 8.

04

.....

.....

.....

.....

05

- 1.
- 2.

06

.....

.....

.....

.....

07

- 1.
- 2.

08 دەپتەری ئاممەت ئۆزگەرتىش ۋە تەشەببۇس ئۆزگەرتىش:

- 1.
- 2.

(ئۆزگەرتىش ئۆزگەرتىش)

دەپتەرى ئاممەت ئۆزگەرتىش ۋە تەشەببۇس ئۆزگەرتىش:

09. قەرزى ئۆزگەرتىش ئاممەت ئۆزگەرتىش ۋە تەشەببۇس ئۆزگەرتىش سەپى

قەرزى ئۆزگەرتىش

قەرزى ئۆزگەرتىش

10. دەپتەرى ئاممەت ئۆزگەرتىش ۋە تەشەببۇس ئۆزگەرتىش

دەپتەرى ئۆزگەرتىش

تەشەببۇس ئۆزگەرتىش

11. دەپتەرى ئاممەت ئۆزگەرتىش ۋە تەشەببۇس ئۆزگەرتىش

دەپتەرى ئۆزگەرتىش

تەشەببۇس ئۆزگەرتىش

تەشەببۇس ئۆزگەرتىش

(مۆستوفى تەرىپى)

مۆستوفى تەرىپى:

ئىككىنچى قېتىملىق تەكشۈرۈش

تەكشۈرۈش

12. ئىككىنچى قېتىملىق تەكشۈرۈش ۋە تەكشۈرۈش مەھكىمىسىنىڭ مەسئۇلىنىڭ قارىشى ۋە مەسئۇلىنىڭ قارىشى:

			مۆستوفى تەرىپى (قارار مەھكىمىسى):
	قارار مەھكىمىسى:	مۆستوفى تەرىپى:	قارار مەھكىمىسى / قارار مەھكىمىسى:
		قارار مەھكىمىسى / قارار مەھكىمىسى:	قارار مەھكىمىسى:
		قارار مەھكىمىسى:	
		قارار مەھكىمىسى:	
		قارار مەھكىمىسى / قارار مەھكىمىسى:	قارار مەھكىمىسى:
		قارار مەھكىمىسى:	
		قارار مەھكىمىسى:	
		قارار مەھكىمىسى:	قارار مەھكىمىسى:
			قارار مەھكىمىسى / قارار مەھكىمىسى:
			قارار مەھكىمىسى:
			قارار مەھكىمىسى:
			قارار مەھكىمىسى:



අභ්‍යන්තර අධිකරණ පදනමේ නියෝග පිළිබඳව

1. රාජ්‍යයේ,

ප්‍රකාශනය.

නියෝග පදනම :

නියෝග 16 (දැනට අදාළ නොවන නියෝග 66-ට)



දැනට අදාළ නොවන

නියෝග පදනම :

නියෝග

නියෝග පදනම :

අභ්‍යන්තර

1. ජනපතිතුමාගේ නියෝග පදනම, දැනට අදාළ නොවන නියෝග පදනම 180 ට අදාළ නොවන නියෝග පදනමක් ලෙසින් නිර්දේශ කර ඇත.
2. අභ්‍යන්තර අධිකරණ පදනමේ නියෝග පදනම සඳහා සම්බන්ධ කර ඇත.
3. අභ්‍යන්තර අධිකරණ පදනමේ නියෝග පදනම සඳහා සම්බන්ධ කර ඇත.
4. ජනපතිතුමාගේ නියෝග පදනම සඳහා සම්බන්ධ කර ඇත.
5. ජනපතිතුමාගේ නියෝග පදනම සඳහා සම්බන්ධ කර ඇත.
6. ජනපතිතුමාගේ නියෝග පදනම සඳහා සම්බන්ධ කර ඇත.
7. ජනපතිතුමාගේ නියෝග පදනම සඳහා සම්බන්ධ කර ඇත.
8. ජනපතිතුමාගේ නියෝග පදනම සඳහා සම්බන්ධ කර ඇත.

- 9. סוגיות דריש המדיניות וריב דבריה ורישוי מוסים לרישוי סוגיות.
- 10. דרישו לרישוי מוסים ברישוי סוגיות אחר מוסים מוסים לרישוי סוגיות.
- 11. מדיניות מוסים מוסים מוסים מוסים מוסים לרישוי סוגיות.
- 12. דרישו מוסים מוסים מוסים לרישוי סוגיות.
- 13. מוסים מוסים מוסים מוסים מוסים לרישוי סוגיות.
- 14. מוסים מוסים מוסים מוסים מוסים לרישוי סוגיות.

01. דרישו לרישוי מוסים ורישוי סוגיות:

		רישוי מוסים: (רישוי מוסים):	
רישוי מוסים:		רישוי מוסים:	רישוי מוסים / רישוי מוסים:
רישוי מוסים: (רישוי מוסים)			
רישוי מוסים: (רישוי מוסים)			
		רישוי מוסים:	רישוי מוסים:
רישוי מוסים ורישוי מוסים ורישוי מוסים ורישוי מוסים			
רישוי מוסים ורישוי מוסים ורישוי מוסים ורישוי מוסים			

02. סוגיות דריש ורישוי סוגיות:

		רישוי מוסים: (רישוי מוסים):	
רישוי מוסים:		רישוי מוסים:	רישוי מוסים / רישוי מוסים:
רישוי מוסים: (רישוי מוסים)			
רישוי מוסים:		רישוי מוסים:	רישוי מוסים:

03. סוגיות דריש מדיניות ורישוי מוסים ורישוי סוגיות:

		רישוי מוסים:	
רישוי מוסים:		רישוי מוסים:	רישוי מוסים:
רישוי מוסים:		רישוי מוסים:	רישוי מוסים:
רישוי מוסים:		רישוי מוסים:	רישוי מוסים:

				2. ḡimrāḡ sarnō: (āḡāḡ sarnāḡ):
ḡāḡāḡ:	ḡāḡāḡ:	ḡāḡāḡ:	ḡāḡāḡ:	āḡāḡāḡ ḡāḡāḡ ḡāḡāḡ sarnōḡ:
				ḡāḡāḡ āḡāḡ: (āḡāḡāḡ sarnāḡ)
				ḡāḡāḡāḡ āḡāḡ: (āḡāḡāḡ sarnāḡ)
				ḡāḡāḡ sarnōḡ:
				ḡāḡāḡāḡ āḡāḡ ḡāḡāḡ:
				ḡāḡāḡāḡāḡ ḡāḡāḡāḡ ḡāḡāḡāḡ ḡāḡāḡāḡ:
				āḡāḡ:

05. ḡāḡāḡāḡāḡ ḡāḡāḡ: (ḡāḡāḡāḡāḡ ḡāḡāḡāḡāḡ, ḡāḡāḡāḡāḡ ḡāḡāḡāḡāḡ, ḡāḡāḡāḡāḡ ḡāḡāḡāḡāḡ ḡāḡāḡāḡāḡ ḡāḡāḡāḡāḡ ḡāḡāḡāḡāḡ ḡāḡāḡāḡāḡ)

				3. ḡimrāḡ sarnō: (āḡāḡ sarnāḡ):
ḡāḡāḡ:	ḡāḡāḡ:	ḡāḡāḡ:	ḡāḡāḡ:	āḡāḡāḡ ḡāḡāḡ ḡāḡāḡ sarnōḡ:
				ḡāḡāḡ āḡāḡ: (āḡāḡāḡ sarnāḡ)
				ḡāḡāḡāḡ āḡāḡ: (āḡāḡāḡ sarnāḡ)
				ḡāḡāḡ sarnōḡ:
				ḡāḡāḡāḡ āḡāḡ ḡāḡāḡ:
				ḡāḡāḡāḡāḡ ḡāḡāḡāḡ ḡāḡāḡāḡ ḡāḡāḡāḡ:
				āḡāḡ:

06. ḡāḡāḡāḡāḡ ḡāḡāḡ: (ḡāḡāḡāḡāḡ ḡāḡāḡāḡāḡ, ḡāḡāḡāḡāḡ ḡāḡāḡāḡāḡ, ḡāḡāḡāḡāḡ ḡāḡāḡāḡāḡ ḡāḡāḡāḡāḡ ḡāḡāḡāḡāḡ ḡāḡāḡāḡāḡ ḡāḡāḡāḡāḡ)

				1. ḡimrāḡ sarnō: (āḡāḡ sarnāḡ):
ḡāḡāḡ:	ḡāḡāḡ:	ḡāḡāḡ:	ḡāḡāḡ:	āḡāḡāḡ ḡāḡāḡ ḡāḡāḡ sarnōḡ:
				ḡāḡāḡ āḡāḡ: (āḡāḡāḡ sarnāḡ)
				ḡāḡāḡāḡ āḡāḡ: (āḡāḡāḡ sarnāḡ)
				ḡāḡāḡ sarnōḡ:
				ḡāḡāḡāḡ ḡāḡāḡ:
				ḡāḡāḡāḡāḡ ḡāḡāḡ:

07. ḡāḡāḡāḡāḡ ḡāḡāḡ: (ḡāḡāḡāḡāḡ ḡāḡāḡāḡ)	
1	
2	
3	

08. ڪوٺي ٺاهڻ لاءِ رٿائت ڏنل ٿيڻ تي ڪوٺي ٺاهڻ جي ڳالهه ڏانهن (اڻسڻي ٿيڻ جي ڳالهه ڏانهن)

1	
2	
3	

09. ڪوٺي ٺاهڻ لاءِ رٿائت ڏنل ٿيڻ تي ڪوٺي ٺاهڻ جي ڳالهه ڏانهن (اڻسڻي ٿيڻ جي ڳالهه ڏانهن)

1	
2	
3	

10. ڪوٺي ٺاهڻ لاءِ رٿائت ڏنل ٿيڻ تي ڪوٺي ٺاهڻ جي ڳالهه ڏانهن (اڻسڻي ٿيڻ جي ڳالهه ڏانهن)

1	ڪوٺي / ڪوٺي:	نالي:	
	ٺاهڻ لاءِ رٿائت ڏنل ٿيڻ تي ڪوٺي ٺاهڻ جي ڳالهه ڏانهن:	ڪوٺي:	اڻسڻي ٿيڻ جي ڳالهه ڏانهن ڪوٺي ٺاهڻ جي ڳالهه ڏانهن:
	ڪوٺي ٺاهڻ جي ڳالهه ڏانهن:	ڪوٺي:	اڻسڻي ٿيڻ جي ڳالهه ڏانهن ڪوٺي ٺاهڻ جي ڳالهه ڏانهن:
	ڪوٺي ٺاهڻ جي ڳالهه ڏانهن:	ڪوٺي:	اڻسڻي ٿيڻ جي ڳالهه ڏانهن ڪوٺي ٺاهڻ جي ڳالهه ڏانهن:
	ڪوٺي ٺاهڻ جي ڳالهه ڏانهن:	ڪوٺي:	اڻسڻي ٿيڻ جي ڳالهه ڏانهن ڪوٺي ٺاهڻ جي ڳالهه ڏانهن:
	ڪوٺي ٺاهڻ جي ڳالهه ڏانهن:	ڪوٺي:	اڻسڻي ٿيڻ جي ڳالهه ڏانهن ڪوٺي ٺاهڻ جي ڳالهه ڏانهن:
(ڏانهن ڏنل ٿيڻ تي ڪوٺي ٺاهڻ جي ڳالهه ڏانهن (اڻسڻي ٿيڻ جي ڳالهه ڏانهن))			

11. ڪوٺي ٺاهڻ لاءِ رٿائت ڏنل ٿيڻ تي ڪوٺي ٺاهڻ جي ڳالهه ڏانهن (اڻسڻي ٿيڻ جي ڳالهه ڏانهن)

ڪوٺي ٺاهڻ:	
1
2
3
4
5

16. ສາຍຊີວິດ ຫຼື ສາຍສິດທິ ທີ່ຖືກຮັບເອົາ ຈາກ ທີ່ຮັບການປ້ອງກັນ ທີ່ບໍ່ຖືກຕ້ອງ ແລະ ການຕໍ່ສູ້ ທີ່ບໍ່ຖືກຕ້ອງ ທີ່ບໍ່ຖືກຕ້ອງ:

17. ສາຍຊີວິດ ຫຼື ສາຍສິດທິ ທີ່ຖືກຮັບເອົາ ຈາກ ທີ່ຮັບການປ້ອງກັນ ທີ່ບໍ່ຖືກຕ້ອງ ແລະ ການຕໍ່ສູ້ ທີ່ບໍ່ຖືກຕ້ອງ ທີ່ບໍ່ຖືກຕ້ອງ ທີ່ບໍ່ຖືກຕ້ອງ:

18. ການປ້ອງກັນ ທີ່ບໍ່ຖືກຕ້ອງ ທີ່ບໍ່ຖືກຕ້ອງ ທີ່ບໍ່ຖືກຕ້ອງ ທີ່ບໍ່ຖືກຕ້ອງ:

☐ ການປ້ອງກັນ ທີ່ບໍ່ຖືກຕ້ອງ ທີ່ບໍ່ຖືກຕ້ອງ ທີ່ບໍ່ຖືກຕ້ອງ ທີ່ບໍ່ຖືກຕ້ອງ

☐ ການປ້ອງກັນ ທີ່ບໍ່ຖືກຕ້ອງ ທີ່ບໍ່ຖືກຕ້ອງ ທີ່ບໍ່ຖືກຕ້ອງ ທີ່ບໍ່ຖືກຕ້ອງ

19. ການປ້ອງກັນ ທີ່ບໍ່ຖືກຕ້ອງ ທີ່ບໍ່ຖືກຕ້ອງ ທີ່ບໍ່ຖືກຕ້ອງ ທີ່ບໍ່ຖືກຕ້ອງ:

20. ಸರಿಯಾದ ಉತ್ತರವನ್ನು ಆರಿಸಿ. (ಸರಿಯಾದ ಉತ್ತರವನ್ನು ಆರಿಸಿ):

.....

.....

.....

.....

(ಸರಿಯಾದ ಉತ್ತರವನ್ನು ಆರಿಸಿ)

ಉತ್ತರಿಸಿ

ಸರಿಯಾದ ಉತ್ತರವನ್ನು ಆರಿಸಿ

ಸರಿಯಾದ ಉತ್ತರವನ್ನು ಆರಿಸಿ

21. ಸರಿಯಾದ ಉತ್ತರವನ್ನು ಆರಿಸಿ. (ಸರಿಯಾದ ಉತ್ತರವನ್ನು ಆರಿಸಿ):

				ಉತ್ತರಿಸಿ (ಸರಿಯಾದ ಉತ್ತರವನ್ನು ಆರಿಸಿ):
	ಉತ್ತರಿಸಿ:			ಸರಿಯಾದ ಉತ್ತರವನ್ನು ಆರಿಸಿ / ಸರಿಯಾದ ಉತ್ತರವನ್ನು ಆರಿಸಿ:
			ಉತ್ತರಿಸಿ / ಸರಿಯಾದ ಉತ್ತರವನ್ನು ಆರಿಸಿ:	ಸರಿಯಾದ ಉತ್ತರವನ್ನು ಆರಿಸಿ:
			ಉತ್ತರಿಸಿ:	
			ಉತ್ತರಿಸಿ:	
			ಉತ್ತರಿಸಿ / ಸರಿಯಾದ ಉತ್ತರವನ್ನು ಆರಿಸಿ:	ಸರಿಯಾದ ಉತ್ತರವನ್ನು ಆರಿಸಿ:
			ಉತ್ತರಿಸಿ:	
			ಉತ್ತರಿಸಿ:	
		ಉತ್ತರಿಸಿ:		ಉತ್ತರಿಸಿ:
				ಉತ್ತರಿಸಿ / ಸರಿಯಾದ ಉತ್ತರವನ್ನು ಆರಿಸಿ:
				ಉತ್ತರಿಸಿ:
				ಉತ್ತರಿಸಿ / ಸರಿಯಾದ ಉತ್ತರವನ್ನು ಆರಿಸಿ:

3. ڊاڪٽر جي ڌيان ۾ ڏيکاريل ڳالهه:

1. ڊاڪٽر جي ڌيان ۾ ڏيکاريل ڳالهه | ڊاڪٽر جي ڌيان ۾ ڏيکاريل ڳالهه، ڊاڪٽر جي ڌيان ۾ ڏيکاريل ڳالهه، ڊاڪٽر جي ڌيان ۾ ڏيکاريل ڳالهه.
2. ڊاڪٽر جي ڌيان ۾ ڏيکاريل ڳالهه | ڊاڪٽر جي ڌيان ۾ ڏيکاريل ڳالهه، ڊاڪٽر جي ڌيان ۾ ڏيکاريل ڳالهه، ڊاڪٽر جي ڌيان ۾ ڏيکاريل ڳالهه.
3. ڊاڪٽر جي ڌيان ۾ ڏيکاريل ڳالهه | ڊاڪٽر جي ڌيان ۾ ڏيکاريل ڳالهه، ڊاڪٽر جي ڌيان ۾ ڏيکاريل ڳالهه، ڊاڪٽر جي ڌيان ۾ ڏيکاريل ڳالهه.



රජයේ සේවයේ පිරිසිදු කිරීමේ කොමිෂන්

අංක. 10/2023

ප්‍රකාශනය.

..... : දින ප්‍රකාශනය

නියෝජිතයන්ගේ සේවයේ පිරිසිදු කිරීමේ කොමිෂන්

දින 17 (දැනට පවතින කොමිෂන් කොටස 66-0)

නියෝජිතයන්ගේ

නියෝජිතයන්ගේ

නියෝජිතයන්ගේ

නියෝජිතයන්ගේ

නියෝජිතයන්ගේ

1. සියලුම නියෝජිතයන්ගේ සේවයේ පිරිසිදු කිරීමේ කොමිෂන් කොටස 66-0.
2. සියලුම නියෝජිතයන්ගේ සේවයේ පිරිසිදු කිරීමේ කොමිෂන් කොටස 66-0.
3. දින 12 ක් තුළින් නියෝජිතයන්ගේ සේවයේ පිරිසිදු කිරීමේ කොමිෂන් කොටස 66-0.
4. දින 12 ක් තුළින් නියෝජිතයන්ගේ සේවයේ පිරිසිදු කිරීමේ කොමිෂන් කොටස 66-0.

5. 7 ڏينھن جي اندر ٺهڻ نه ٿو سگھي ته ٽريٽي ۾ ڪو به حصو ڪونه ٿو ڪم ڪري.
6. 7 ڏينھن جي اندر ٺهڻ نه ٿو سگھي ته ٽريٽي ۾ ڪو به حصو ڪونه ٿو ڪم ڪري.
7. ڏينھن جي اندر ٺهڻ نه ٿو سگھي ته ٽريٽي ۾ ڪو به حصو ڪونه ٿو ڪم ڪري (ٽريٽي ٺهڻ کان پوءِ).

01. ڏينھن جي اندر ٺهڻ نه ٿو سگھي ته ٽريٽي ۾ ڪو به حصو ڪونه ٿو ڪم ڪري.

ٽريٽي ٺهڻ نه ٿو سگھي ته ٽريٽي ۾ ڪو به حصو ڪونه ٿو ڪم ڪري:			
		ٽريٽي ٺهڻ نه ٿو سگھي ته ٽريٽي ۾ ڪو به حصو ڪونه ٿو ڪم ڪري:	
ٽريٽي ٺهڻ نه ٿو سگھي ته ٽريٽي ۾ ڪو به حصو ڪونه ٿو ڪم ڪري:	ٽريٽي ٺهڻ نه ٿو سگھي ته ٽريٽي ۾ ڪو به حصو ڪونه ٿو ڪم ڪري:		
ڏينھن جي اندر ٺهڻ نه ٿو سگھي ته ٽريٽي ۾ ڪو به حصو ڪونه ٿو ڪم ڪري.			

02. ڏينھن جي اندر ٺهڻ نه ٿو سگھي ته ٽريٽي ۾ ڪو به حصو ڪونه ٿو ڪم ڪري.

ٽريٽي ٺهڻ نه ٿو سگھي ته ٽريٽي ۾ ڪو به حصو ڪونه ٿو ڪم ڪري:			
		ٽريٽي ٺهڻ نه ٿو سگھي ته ٽريٽي ۾ ڪو به حصو ڪونه ٿو ڪم ڪري:	
ٽريٽي ٺهڻ نه ٿو سگھي ته ٽريٽي ۾ ڪو به حصو ڪونه ٿو ڪم ڪري:	ٽريٽي ٺهڻ نه ٿو سگھي ته ٽريٽي ۾ ڪو به حصو ڪونه ٿو ڪم ڪري:		
ڏينھن جي اندر ٺهڻ نه ٿو سگھي ته ٽريٽي ۾ ڪو به حصو ڪونه ٿو ڪم ڪري.			

03 ڏينھن جي اندر ٺهڻ نه ٿو سگھي ته ٽريٽي ۾ ڪو به حصو ڪونه ٿو ڪم ڪري.

.....

.....

.....

.....

04 ការសម្រេចក្នុងនាមរដ្ឋសភា

1. ការសម្រេចក្នុងនាមរដ្ឋសភា:

2. ក្រសួងសេដ្ឋកិច្ចសហប្រតិបត្តិការ:

3. ក្រសួង:

ក្រសួងកសិកម្ម

ក្រសួងសុខាភិបាល

ក្រសួងសេដ្ឋកិច្ច

ក្រសួងសេដ្ឋកិច្ចសហប្រតិបត្តិការ

ក្រសួងយុត្តិធម៌

ក្រសួងសេដ្ឋកិច្ចសហប្រតិបត្តិការ ក្រសួងសុខាភិបាល ក្រសួងសេដ្ឋកិច្ច

4. ក្រសួង:

5. ក្រសួងសេដ្ឋកិច្ចសហប្រតិបត្តិការ ក្រសួងសុខាភិបាល ក្រសួងសេដ្ឋកិច្ច

ក្រសួងសេដ្ឋកិច្ចសហប្រតិបត្តិការ

ក្រសួងសុខាភិបាល

ក្រសួងសេដ្ឋកិច្ច

ក្រសួងសេដ្ឋកិច្ចសហប្រតិបត្តិការ

ក្រសួងសេដ្ឋកិច្ចសហប្រតិបត្តិការ ក្រសួងសុខាភិបាល ក្រសួងសេដ្ឋកិច្ច

ក្រសួងសេដ្ឋកិច្ចសហប្រតិបត្តិការ

ក្រសួងសេដ្ឋកិច្ចសហប្រតិបត្តិការ ក្រសួងសុខាភិបាល ក្រសួងសេដ្ឋកិច្ច

ក្រសួងសេដ្ឋកិច្ចសហប្រតិបត្តិការ ក្រសួងសុខាភិបាល ក្រសួងសេដ្ឋកិច្ចសហប្រតិបត្តិការ

ក្រសួងសេដ្ឋកិច្ចសហប្រតិបត្តិការ

ក្រសួងសេដ្ឋកិច្ចសហប្រតិបត្តិការ ក្រសួងសុខាភិបាល ក្រសួងសេដ្ឋកិច្ចសហប្រតិបត្តិការ

		55 : 55 : 55 :	55 : 55 : 55 :
		55 : 55 :	55 : 55 :
		55 : 55 :	55 : 55 :
		55 : 55 :	55 : 55 :

(55 : 55 : 55 :)

55 : 55 : 55 : 55 : 55 :

08 55 : 55 : 55 :

		55 : 55 : 55 :	55 : 55 : 55 :
		55 : 55 : 55 :	55 : 55 : 55 :
		55 : 55 : 55 :	55 : 55 : 55 :
		55 : 55 : 55 :	55 : 55 : 55 :
		55 : 55 : 55 :	55 : 55 : 55 :
		55 : 55 : 55 :	55 : 55 : 55 :
		55 : 55 : 55 :	55 : 55 : 55 :
		55 : 55 : 55 :	55 : 55 : 55 :

09 55 : 55 : 55 :

		55 : 55 : 55 :	55 : 55 : 55 :
		55 : 55 : 55 :	55 : 55 : 55 :
		55 : 55 : 55 :	55 : 55 : 55 :
		55 : 55 : 55 :	55 : 55 : 55 :
		55 : 55 : 55 :	55 : 55 : 55 :
		55 : 55 : 55 :	55 : 55 : 55 :
		55 : 55 : 55 :	55 : 55 : 55 :
		55 : 55 : 55 :	55 : 55 : 55 :

(Գործի Գլխավոր Հարցադրում)

Գործի Վերաբերյալ

Գործի վերաբերյալ հարցադրումները հետևյալն են:

1. Երբ:

2. Երբ:

3. Ինչպիսիք են հարցադրումները:

4. Երբ:

Գործի Կարևորագույն Հարցեր:

1. Կոնստիտուցիոնալ իրավունքների խախտման դեպքում արդարադատության կողմից արված քայլեր:
2. Կոնստիտուցիոնալ իրավունքների խախտման դեպքում արդարադատության կողմից արված քայլեր:
3. Կոնստիտուցիոնալ իրավունքների խախտման դեպքում արդարադատության կողմից արված քայլեր: +
4. Կոնստիտուցիոնալ իրավունքների խախտման դեպքում արդարադատության կողմից արված քայլեր:



අධිකරණ අධිකරණ පදනමේ සේවයේ

ආර. රැස්වීම

පිටුව 1/1

..... : පිටුව 1/1

අධිකරණ පදනමේ සේවයේ

පිටුව 18 (කැමරා වැනි සේවයේ සේවයේ 660 (ප))

..... : පිටුව 1/1

..... : පිටුව 1/1

.....

..... : පිටුව 1/1

.....

1. පිටුව 1/1 පිටුව 1/1 පිටුව 1/1
2. පිටුව 1/1 පිටුව 1/1 පිටුව 1/1
3. පිටුව 1/1 පිටුව 1/1 පිටුව 1/1
4. පිටුව 1/1 පිටුව 1/1 පිටුව 1/1
5. පිටුව 1/1 පිටුව 1/1 පිටුව 1/1

.....

.....

.....

02 المسائل المتعلقة بالسلطة القضائية :

7. التصنيف :

مسألة من مسائل

السلطة القضائية

المسائل المتعلقة بالسلطة القضائية

المسائل المتعلقة

(تصنيف المسائل المتعلقة بالسلطة القضائية)

..... (ر) مسألة من مسائل :

..... (ر) مسألة من مسائل :

..... (ر) مسألة من مسائل :

.....

.....

.....

المسائل المتعلقة

المسائل المتعلقة

..... (ر) مسألة من مسائل :

..... (ر) مسألة من مسائل :

..... (ر) مسألة من مسائل :

.....

.....

.....

(07 07 2024)

07 07 2024

07 07 2024

07 07 2024

08 07 2024				
				07 07 2024
	07 07 2024		07 07 2024	07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024
		07 07 2024		07 07 2024

ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ:

ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ:

ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ:

ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ:

09 ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ:

	ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ / ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ	
	ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ:	ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ:
	ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ:	
	ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ / ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ	
	ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ:	ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ:
	ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ:	
ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ:		ᠳᠠᠨᠠᠨᠠᠭ ᠤᠨᠠᠨᠠᠭ ᠨᠠᠭᠤᠯᠤᠰᠤ:

(10)

10. ກົດໝາຍ ກ່ຽວກັບ ການຮັບຜິດຊອບ ທາງກົດໝາຍ ທີ່ກ່ຽວຂ້ອງ ກັບ ການຄ້າ

10 ກົດໝາຍ ກ່ຽວກັບ ການຮັບຜິດຊອບ ທາງກົດໝາຍ ທີ່ກ່ຽວຂ້ອງ ກັບ ການຄ້າ				
			ຈຳນວນ ສະບັບ (ສະບັບ ສະບັດ) :	
	ຈຳນວນ :		ຈຳນວນ ສະບັບ ສະບັດ :	ຈຳນວນ ສະບັບ ສະບັດ / ຈຳນວນ ສະບັບ ສະບັດ :
			ຈຳນວນ ສະບັບ ສະບັດ / ຈຳນວນ ສະບັບ ສະບັດ :	ຈຳນວນ ສະບັບ ສະບັດ :
			ຈຳນວນ ສະບັບ ສະບັດ :	
			ຈຳນວນ ສະບັບ ສະບັດ :	
			ຈຳນວນ ສະບັບ ສະບັດ / ຈຳນວນ ສະບັບ ສະບັດ :	ຈຳນວນ ສະບັບ ສະບັດ ທີ່ ຈຳນວນ ສະບັບ ສະບັດ :
			ຈຳນວນ ສະບັບ ສະບັດ :	
			ຈຳນວນ ສະບັບ ສະບັດ :	
			ຈຳນວນ ສະບັບ ສະບັດ ທີ່ ຈຳນວນ ສະບັບ ສະບັດ :	ຈຳນວນ ສະບັບ ສະບັດ ທີ່ ຈຳນວນ ສະບັບ ສະບັດ :
			ຈຳນວນ ສະບັບ ສະບັດ :	
			ຈຳນວນ ສະບັບ ສະບັດ :	
			ຈຳນວນ ສະບັບ ສະບັດ ທີ່ ຈຳນວນ ສະບັບ ສະບັດ :	ຈຳນວນ ສະບັບ ສະບັດ ທີ່ ຈຳນວນ ສະບັບ ສະບັດ :
			ຈຳນວນ ສະບັບ ສະບັດ :	
			ຈຳນວນ ສະບັບ ສະບັດ :	
		<input type="checkbox"/> ຈຳນວນ ສະບັບ ສະບັດ	<input type="checkbox"/> ຈຳນວນ ສະບັບ ສະບັດ	18 ຈຳນວນ ສະບັບ ສະບັດ ທີ່ ຈຳນວນ ສະບັບ ສະບັດ :
			ຈຳນວນ ສະບັບ ສະບັບ (ສະບັບ ສະບັດ) :	
	ຈຳນວນ :		ຈຳນວນ ສະບັບ ສະບັບ :	ຈຳນວນ ສະບັບ ສະບັບ / ຈຳນວນ ສະບັບ ສະບັບ :
			ຈຳນວນ ສະບັບ ສະບັບ / ຈຳນວນ ສະບັບ ສະບັບ :	ຈຳນວນ ສະບັບ ສະບັບ :
			ຈຳນວນ ສະບັບ ສະບັບ :	
			ຈຳນວນ ສະບັບ ສະບັບ :	
			ຈຳນວນ ສະບັບ ສະບັບ / ຈຳນວນ ສະບັບ ສະບັບ :	ຈຳນວນ ສະບັບ ສະບັບ ທີ່ ຈຳນວນ ສະບັບ ສະບັບ :
			ຈຳນວນ ສະບັບ ສະບັບ :	
			ຈຳນວນ ສະບັບ ສະບັບ :	

		ក្រសួង :	
	ចំនួនសំណុំរឿង :		ចំនួនសំណុំរឿង :

11 របៀបសម្រេច និងស្រាយសំណុំរឿង និងសំណុំរឿងដទៃទៀត :

			ចំនួនសំណុំរឿង (បញ្ជី) :
	ចំនួន :	ចំនួនសំណុំរឿង :	ចំនួនសំណុំរឿង / ចំនួនសំណុំរឿង :
		ចំនួនសំណុំរឿង / ចំនួនសំណុំរឿង :	ចំនួនសំណុំរឿង :
		ចំនួនសំណុំរឿង :	
		ចំនួន :	
		ចំនួនសំណុំរឿង / ចំនួនសំណុំរឿង :	ចំនួនសំណុំរឿង :
		ចំនួនសំណុំរឿង :	
		ចំនួន :	
		ចំនួនសំណុំរឿង :	ចំនួនសំណុំរឿង :
<input type="checkbox"/> ក្នុងចំណោមចំនួនសំណុំរឿងសរុប		<input type="checkbox"/> ក្នុងចំណោមសំណុំរឿងសំណុំរឿង	ចំនួនសំណុំរឿង :
<input type="checkbox"/> ក្នុងចំណោមចំនួនសំណុំរឿងសំណុំរឿងដទៃទៀត		<input type="checkbox"/> ក្នុងចំណោមសំណុំរឿងសំណុំរឿងដទៃទៀត	
ចំនួនសំណុំរឿងសំណុំរឿងសំណុំរឿងសំណុំរឿងសំណុំរឿងសំណុំរឿងសំណុំរឿងសំណុំរឿងសំណុំរឿងសំណុំរឿង			

(100 100 100)

100

100 100 100 100 100 100 100 100 100 100

100

100

100 100 100 100 100 100 100 100 100 100

100

100 100 100 100 100 100 100 100 100 100

1. 100 100 100 100 100 100 100 100 100 100
2. 100 100 100 100 100 100 100 100 100 100
3. 100 100 100 100 100 100 100 100 100 100
4. 100 100 100 100 100 100 100 100 100 100
5. 100 100 100 100 100 100 100 100 100 100
6. 100 100 100 100 100 100 100 100 100 100



ދިވެހިރާއްޖޭގެ ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން

ގަވާއިދު، 2016

ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން

..... ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން

ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން

ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން (660 ވަނަ)

ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން

ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން

ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން

ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން

ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން

1. ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން.
2. ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން.
3. ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން 12 ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން.
4. ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން.
5. ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން.
6. ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން 25.00 ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން.
7. ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން ޖުޖީޝިޔާލް ޤައުމީ ކޯޓުގެ ޖަލްޞާޔާތުގެ ބަޔާން.

01. داریسۆ داریسۆ و داریسۆ داریسۆ:

		قورسۆ سۆسۆ: (داریسۆ سۆسۆ):	
داریسۆ:	داریسۆ سۆسۆ:	داریسۆ سۆسۆ / داریسۆ سۆسۆ:	
		قورسۆ داریسۆ: (داریسۆ سۆسۆ)	
		داریسۆ داریسۆ: (داریسۆ سۆسۆ)	
	داریسۆ داریسۆ:	قورسۆ سۆسۆ:	
		داریسۆ داریسۆ و داریسۆ داریسۆ سۆسۆ داریسۆ داریسۆ:	
		داریسۆ داریسۆ داریسۆ داریسۆ داریسۆ داریسۆ:	

02 داریسۆ داریسۆ:

.....

.....

.....

.....

.....

03 داریسۆ داریسۆ سۆسۆ داریسۆ داریسۆ داریسۆ:

1. داریسۆ داریسۆ:

داریسۆ داریسۆ

داریسۆ داریسۆ

داریسۆ داریسۆ

داریسۆ داریسۆ

(داریسۆ داریسۆ داریسۆ داریسۆ داریسۆ داریسۆ داریسۆ)

(ر). داریسۆ داریسۆ سۆسۆ: (داریسۆ سۆسۆ داریسۆ داریسۆ داریسۆ)

08 ڪوٽيشن ۽ ڪوٽيشن جي آڇ ۽ ڪوٽيشن:

	ڪا ڪوٽيشن / ڪوٽيشن جي آڇ ۽ ڪوٽيشن :	ڪوٽيشن جي آڇ ۽ ڪوٽيشن :
	ڪوٽيشن جي آڇ ۽ ڪوٽيشن :	
	ڪوٽيشن جي آڇ ۽ ڪوٽيشن :	
	ڪا ڪوٽيشن / ڪوٽيشن جي آڇ ۽ ڪوٽيشن :	ڪوٽيشن جي آڇ ۽ ڪوٽيشن :
	ڪوٽيشن جي آڇ ۽ ڪوٽيشن :	
	ڪوٽيشن جي آڇ ۽ ڪوٽيشن :	
	ڪوٽيشن جي آڇ ۽ ڪوٽيشن :	ڪوٽيشن جي آڇ ۽ ڪوٽيشن :

(ڌڙي ڇوڪر ڇوڪري)

ڌڙي ڇوڪر ڇوڪري جي ڌڙي ڇوڪر ڇوڪري

09 ڌڙي ڇوڪر ڇوڪري ڌڙي ڇوڪر ڇوڪري :

			ڌڙي ڇوڪر ڇوڪري (ڌڙي ڇوڪر ڇوڪري) :
ڌڙي ڇوڪر ڇوڪري :	ڌڙي ڇوڪر ڇوڪري :		ڌڙي ڇوڪر ڇوڪري / ڌڙي ڇوڪر ڇوڪري :
		ڌڙي ڇوڪر ڇوڪري / ڌڙي ڇوڪر ڇوڪري :	ڌڙي ڇوڪر ڇوڪري :
		ڌڙي ڇوڪر ڇوڪري :	
		ڌڙي ڇوڪر ڇوڪري :	
		ڌڙي ڇوڪر ڇوڪري / ڌڙي ڇوڪر ڇوڪري :	ڌڙي ڇوڪر ڇوڪري :
		ڌڙي ڇوڪر ڇوڪري :	
		ڌڙي ڇوڪر ڇوڪري :	
	ڌڙي ڇوڪر ڇوڪري :		ڌڙي ڇوڪر ڇوڪري :
			ڌڙي ڇوڪر ڇوڪري ڌڙي ڇوڪر ڇوڪري ڌڙي ڇوڪر ڇوڪري

10 ڌڙي ڇوڪر ڇوڪري ڌڙي ڇوڪر ڇوڪري :

			ڌڙي ڇوڪر ڇوڪري (ڌڙي ڇوڪر ڇوڪري) :
ڌڙي ڇوڪر ڇوڪري :	ڌڙي ڇوڪر ڇوڪري :		ڌڙي ڇوڪر ڇوڪري / ڌڙي ڇوڪر ڇوڪري :
		ڌڙي ڇوڪر ڇوڪري / ڌڙي ڇوڪر ڇوڪري :	ڌڙي ڇوڪر ڇوڪري :
		ڌڙي ڇوڪر ڇوڪري :	
		ڌڙي ڇوڪر ڇوڪري :	
		ڌڙي ڇوڪر ڇوڪري / ڌڙي ڇوڪر ڇوڪري :	ڌڙي ڇوڪر ڇوڪري :
		ڌڙي ڇوڪر ڇوڪري :	
		ڌڙي ڇوڪر ڇوڪري :	
	ڌڙي ڇوڪر ڇوڪري :		ڌڙي ڇوڪر ڇوڪري :
			ڌڙي ڇوڪر ڇوڪري ڌڙي ڇوڪر ڇوڪري ڌڙي ڇوڪر ڇوڪري

(1) (2) (3) (4) (5) (6) (7) (8) (9) (10)

11

12

13

14

15

16

17

- 18
- 19
- 20



ދިވެހިރާއްޖޭގެ ޖުޖުކަން ދާއިރާގެ ޖުޖުކަން ޖަލްސާ

ހުކުމާއި ފަންނު

ދާއިރާގެ ޖުޖުކަން

..... ޖުޖުކަން ޖަލްސާ :

ސަރުކާރުގެ ޖުޖުކަން / ޖުޖުކަން ޖަލްސާގެ ޖުޖުކަން ޖަލްސާ

ޖުޖުކަން 20 (މަޢުލޫމާތު ޖުޖުކަން ޖަލްސާ 660 ބ)

[Empty box for name]

މަޢުލޫމާތު ޖުޖުކަން :

..... ޖުޖުކަން ޖަލްސާ :

ހުކުމާއި

..... ޖުޖުކަން ޖަލްސާ :

ހުކުމާއި ފަންނު :

1. ސަރުކާރުގެ ޖުޖުކަން ޖަލްސާގެ ޖުޖުކަން ޖަލްސާ.
2. ޖުޖުކަން ޖަލްސާގެ ޖުޖުކަން ޖަލްސާގެ ޖުޖުކަން ޖަލްސާ.
3. ޖުޖުކަން ޖަލްސާގެ ޖުޖުކަން ޖަލްސާގެ ޖުޖުކަން ޖަލްސާ.
4. ޖުޖުކަން ޖަލްސާގެ ޖުޖުކަން ޖަލްސާގެ ޖުޖުކަން ޖަލްސާ.
5. ޖުޖުކަން ޖަލްސާގެ ޖުޖުކަން ޖަލްސާގެ ޖުޖުކަން ޖަލްސާ.
6. ޖުޖުކަން ޖަލްސާގެ ޖުޖުކަން ޖަލްސާގެ ޖުޖުކަން ޖަލްސާ (ޖުޖުކަން ޖަލްސާގެ ޖުޖުކަން ޖަލްސާ).
7. ޖުޖުކަން ޖަލްސާގެ ޖުޖުކަން ޖަލްސާގެ ޖުޖުކަން ޖަލްސާ.
8. ޖުޖުކަން ޖަލްސާގެ ޖުޖުކަން ޖަލްސާގެ ޖުޖުކަން ޖަލްސާ 12 ޖުޖުކަން ޖަލްސާ | ޖުޖުކަން ޖަލްސާ.
9. ޖުޖުކަން ޖަލްސާގެ ޖުޖުކަން ޖަލްސާގެ ޖުޖުކަން ޖަލްސާ.

01 දැනට පවතින සියලුම විෂය:

			දිනපතා සේවා (සියලුම විෂය):
දිනපතා සේවා:	දිනපතා සේවා:		අධිකරණයේ සේවා / විශේෂ සේවා:
		සියලුම සේවා / විශේෂ සේවා:	විශේෂ සේවා:
		විශේෂ සේවා:	
		දිනපතා සේවා:	
		සියලුම සේවා / විශේෂ සේවා:	විශේෂ සේවා:
		විශේෂ සේවා:	
		දිනපතා සේවා:	
	විශේෂ සේවා:		විශේෂ සේවා:
			විශේෂ සේවා / විශේෂ සේවා:

02 දැනට පවතින සියලුම විෂය:

			දිනපතා සේවා (සියලුම විෂය):
දිනපතා සේවා:	දිනපතා සේවා:		අධිකරණයේ සේවා / විශේෂ සේවා:
		සියලුම සේවා / විශේෂ සේවා:	විශේෂ සේවා:
		විශේෂ සේවා:	
		දිනපතා සේවා:	
		සියලුම සේවා / විශේෂ සේවා:	විශේෂ සේවා:
		විශේෂ සේවා:	
		දිනපතා සේවා:	
	විශේෂ සේවා:		විශේෂ සේවා:
			විශේෂ සේවා / විශේෂ සේවා:

06 ھۆججەت مۇنداقچە تەتقىقات ھۆججەت:

.....
.....
.....

07 ھۆججەت مۇنداقچە تەتقىقات ھۆججەت:

.....
.....
.....

08 ھۆججەت مۇنداقچە تەتقىقات ھۆججەت:

.....
.....
.....

09 ھۆججەت مۇنداقچە تەتقىقات ھۆججەت:

1. ھۆججەت:

- ھۆججەت
- ھۆججەت
- ھۆججەت
- ھۆججەت
- ھۆججەت

2. පදිංචි කිරීම :

සේවයේ නියුතුවීමේ දිනය :

සේවයේ නියුතුවීමේ දිනය :

දින :

වර්ෂය :

3. වෘත්තීය ජීවිතයේ වැදගත් කරුණු සහ අනෙකුත් විස්තර :

සේවයේ නියුතුවීමේ දිනය

සේවයේ නියුතුවීමේ දිනය

වෘත්තීය ජීවිතයේ වැදගත් කරුණු

..... වෘත්තීය ජීවිතයේ වැදගත් කරුණු :

..... වෘත්තීය ජීවිතයේ වැදගත් කරුණු :

..... වෘත්තීය ජීවිතයේ වැදගත් කරුණු :

10 අනෙකුත් :

.....
.....
.....
.....
.....
.....



ދިވެހިރާއްޖޭގެ ޖުޖުކަން ޖަހާ ޖުޖުކަން ޖަހާ ޖުޖުކަން

އި.އ.އ. ޖުޖުކަން

ޖުޖުކަން ޖަހާ ޖުޖުކަން

..... ޖުޖުކަން ޖަހާ ޖުޖުކަން :

އި.އ.އ. ޖުޖުކަން ޖަހާ ޖުޖުކަން ޖަހާ ޖުޖުކަން ޖަހާ ޖުޖުކަން

ޖުޖުކަން 21 (ޖުޖުކަން ޖަހާ ޖުޖުކަން ޖަހާ ޖުޖުކަން 660 ވ)

[Empty rectangular box for signature or stamp]

ޖުޖުކަން ޖަހާ ޖުޖުކަން

ޖުޖުކަން ޖަހާ ޖުޖުކަން

ޖުޖުކަން

ޖުޖުކަން ޖަހާ ޖުޖުކަން



ދިވެހިރާއްޖޭގެ ޖުޖުކަން ކަންކަން ދާއިރާގެ ޖުޖުކަން ކަންކަން

ގާވިއަފް ސެކްޝަން

މާލެ

..... : ޖުޖުކަން ކަންކަން

ދިވެހިރާއްޖޭގެ ޖުޖުކަން ކަންކަން ދާއިރާގެ ޖުޖުކަން ކަންކަން

ޖުޖުކަން ކަންކަން 22 (މާލެ ސެކްޝަންގެ ޖުޖުކަން ކަންކަން 660، 780 (ހ))

މާލެ ސެކްޝަން

..... ޖުޖުކަން ކަންކަން ސެކްޝަން

މާލެ

..... ޖުޖުކަން ކަންކަން ސެކްޝަން

ދިވެހިރާއްޖޭގެ ޖުޖުކަން ކަންކަން

1. ޖުޖުކަން ކަންކަން ސެކްޝަންގެ ޖުޖުކަން ކަންކަން.
2. ޖުޖުކަން ކަންކަން ސެކްޝަންގެ ޖުޖުކަން ކަންކަން 12 ޖުޖުކަން ކަންކަން ސެކްޝަންގެ ޖުޖުކަން ކަންކަން.
3. ޖުޖުކަން ކަންކަން ސެކްޝަންގެ ޖުޖުކަން ކަންކަން ސެކްޝަންގެ ޖުޖުކަން ކަންކަން.
4. ޖުޖުކަން ކަންކަން ސެކްޝަންގެ ޖުޖުކަން ކަންކަން ސެކްޝަންގެ ޖުޖުކަން ކަންކަން ސެކްޝަންގެ ޖުޖުކަން ކަންކަން.
5. ޖުޖުކަން ކަންކަން ސެކްޝަންގެ ޖުޖުކަން ކަންކަން 25/- (ސެކްޝަންގެ ޖުޖުކަން ކަންކަން) ސެކްޝަންގެ ޖުޖުކަން ކަންކަން.
6. ޖުޖުކަން ކަންކަން ސެކްޝަންގެ ޖުޖުކަން ކަންކަން ސެކްޝަންގެ ޖުޖުކަން ކަންކަން ސެކްޝަންގެ ޖުޖުކަން ކަންކަން.

01 دڤيسٽريٽ ڊوڪيومينٽ :

.....

.....

.....

.....

.....

.....

.....

02 ٻيو ريسٽريڪٽو ڊوڪيومينٽ :

.....

.....

.....

.....

.....

.....

.....

03 ٽيون ريسٽريڪٽو ڊوڪيومينٽ :

.....

.....

.....

.....

.....

.....

.....

(٢٠٢٠)

دائرة القضاء في جمهورية موريتانيا الإسلامية

04 دائرة القضاء في جمهورية موريتانيا الإسلامية			
			تاريخ صدور القرار (التاريخ) :
رقم الملف :	رقم الملف :	رقم الملف :	الجهة التي صدر القرار عنها / الجهة التي صدر القرار فيها :
		الجهة التي صدر القرار عنها / الجهة التي صدر القرار فيها :	تاريخ صدور القرار :
		الجهة التي صدر القرار عنها / الجهة التي صدر القرار فيها :	
		الجهة التي صدر القرار عنها / الجهة التي صدر القرار فيها :	
		الجهة التي صدر القرار عنها / الجهة التي صدر القرار فيها :	تاريخ صدور القرار :
		الجهة التي صدر القرار عنها / الجهة التي صدر القرار فيها :	
		الجهة التي صدر القرار عنها / الجهة التي صدر القرار فيها :	
		الجهة التي صدر القرار عنها / الجهة التي صدر القرار فيها :	تاريخ صدور القرار :
دائرة القضاء في جمهورية موريتانيا الإسلامية			

05 دائرة القضاء في جمهورية موريتانيا الإسلامية			
			تاريخ صدور القرار (التاريخ) :
رقم الملف :	رقم الملف :	رقم الملف :	الجهة التي صدر القرار عنها / الجهة التي صدر القرار فيها :
		الجهة التي صدر القرار عنها / الجهة التي صدر القرار فيها :	تاريخ صدور القرار :
		الجهة التي صدر القرار عنها / الجهة التي صدر القرار فيها :	
		الجهة التي صدر القرار عنها / الجهة التي صدر القرار فيها :	
		الجهة التي صدر القرار عنها / الجهة التي صدر القرار فيها :	تاريخ صدور القرار :
		الجهة التي صدر القرار عنها / الجهة التي صدر القرار فيها :	
		الجهة التي صدر القرار عنها / الجهة التي صدر القرار فيها :	
		الجهة التي صدر القرار عنها / الجهة التي صدر القرار فيها :	تاريخ صدور القرار :
دائرة القضاء في جمهورية موريتانيا الإسلامية			

(په دې رڼا کې د ځانګړو پروګرام لاندې)

په دې پروګرام کې

د ځانګړې پروګرام د وړاندوړتیا لاندې د وړاندوړتیا لاندې د وړاندوړتیا لاندې د وړاندوړتیا لاندې.

ځانګړې:

سره:

د ځانګړو پروګرام لاندې د وړاندوړتیا لاندې د وړاندوړتیا لاندې د وړاندوړتیا لاندې.

ځانګړې:

په دې پروګرام کې

1. د ځانګړو پروګرام لاندې د وړاندوړتیا لاندې د وړاندوړتیا لاندې د وړاندوړتیا لاندې.

2. د ځانګړو پروګرام لاندې د وړاندوړتیا لاندې د وړاندوړتیا لاندې د وړاندوړتیا لاندې.

د ځانګړو پروګرام لاندې د وړاندوړتیا لاندې د وړاندوړتیا لاندې د وړاندوړتیا لاندې.

3. د ځانګړو پروګرام لاندې د وړاندوړتیا لاندې د وړاندوړتیا لاندې د وړاندوړتیا لاندې.

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ



ދިވެހިރާއްޖޭގެ ޖުޖުމްހޫރިއްޔާ ގުޅިގެން ސަރުކާރުގެ ޖުޖުމްހޫރިއްޔާ ގުޅިގެން

ހުކުމާ ދެކޮޅު

ދިވެހިރާއްޖެ.

..... ވަނަ ސަރުކާރު : ވަނަ ސަރުކާރު

ދިވެހިރާއްޖޭގެ ޖުޖުމްހޫރިއްޔާ ގުޅިގެން ސަރުކާރުގެ ޖުޖުމްހޫރިއްޔާ ގުޅިގެން

ވަނަ 23 (މަޢުލޫމާތު ދެނެގަތުމުގެ ޖުޖުމްހޫރިއްޔާ ގުޅިގެން 40.0 (ސ))

މަޢުލޫމާތު ދެނެގަތުމުގެ ޖުޖުމްހޫރިއްޔާ ގުޅިގެން

..... ދިވެހިރާއްޖޭގެ ޖުޖުމްހޫރިއްޔާ ގުޅިގެން ސަރުކާރުގެ ޖުޖުމްހޫރިއްޔާ ގުޅިގެން

ހުކުމާ

..... ދިވެހިރާއްޖޭގެ ޖުޖުމްހޫރިއްޔާ ގުޅިގެން ސަރުކާރުގެ ޖުޖުމްހޫރިއްޔާ ގުޅިގެން

01 ڪوٽوال ڊسٽرڪٽ ڪورٽ ۾ ڊيپوٽيشن ۽ ٽرانسفر ۽ ٻين ڳالهين تي ڊيپوٽيشن

ٽرانسفر ۽ ڊيپوٽيشن ۽ ٻين ڳالهين تي ڊيپوٽيشن

ٽرانسفر ۽ ڊيپوٽيشن ۽ ٻين ڳالهين تي ڊيپوٽيشن

02 ڊيپوٽيشن ۽ ٽرانسفر ۽ ٻين ڳالهين تي ڊيپوٽيشن ۽ ٽرانسفر ۽ ٻين ڳالهين تي ڊيپوٽيشن

.....
.....
.....

03 ڊيپوٽيشن ۽ ٽرانسفر ۽ ٻين ڳالهين تي ڊيپوٽيشن

..... 9
.....
.....
..... 10
.....
.....

04 ڪوٽوال ڊسٽرڪٽ ڪورٽ ۾ ڊيپوٽيشن ۽ ٽرانسفر ۽ ٻين ڳالهين تي ڊيپوٽيشن

.....
.....
.....
.....
.....

(ክርክር ዳይሬክቶሬት)

ክርክር ዳይሬክቶሬት

ክርክር ዳይሬክቶሬት

ሰነድ

05 ክርክር ዳይሬክቶሬት ሰነድ ለመሙላት የሚያስፈልጉትን መረጃዎች በዚህ ፎርም ይሙሉ።

			ክርክር ዳይሬክቶሬት (የሰነድ) :
የሰነድ ቁጥር :	የሰነድ ቀን :	የሰነድ ስም :	የሰነድ ዓይነት / የሰነድ ዓይነት :
		የሰነድ ቁጥር / የሰነድ ቀን :	የሰነድ ዓይነት :
		የሰነድ ስም :	
		የሰነድ ቁጥር :	
		የሰነድ ቁጥር / የሰነድ ቀን :	የሰነድ ዓይነት :
		የሰነድ ስም :	
		የሰነድ ቁጥር :	
	የሰነድ ዓይነት :		የሰነድ ዓይነት :
			የሰነድ ቁጥር / የሰነድ ቀን :
			የሰነድ ዓይነት :
			የሰነድ ዓይነት :

ክርክር ዳይሬክቶሬት ሰነድ :

የሰነድ ቁጥር / የሰነድ ቀን : _____ የሰነድ ስም : _____

ክርክር ዳይሬክቶሬት ሰነድ ለመሙላት የሚያስፈልጉትን መረጃዎች በዚህ ፎርም ይሙሉ።

06 කොටුවේ සේවාවන් සහ සේවාවන්:

		ප්‍රධාන සේවාව / වැදගත් සේවාව :	ක්‍රමයට නොපැමිණි :
		සේවාවේ කාලය :	
		ක්‍රමය :	
		ප්‍රධාන සේවාව / වැදගත් සේවාව :	ක්‍රමයට නොපැමිණි :
		සේවාවේ කාලය :	
		ක්‍රමය :	
		සේවාවේ කාලය :	ක්‍රමයට නොපැමිණි :

(ක්‍රමයට නොපැමිණි සේවාව)

ක්‍රමයට නොපැමිණි සේවාවන් සහ සේවාවන්

07 කොටුවේ සේවාවන් සහ සේවාවන්:

		ව්‍යවස්ථාපිත සේවාව (ක්‍රමයට නොපැමිණි) :	
	ක්‍රමය :	ව්‍යවස්ථාපිත සේවාව :	වැදගත් සේවාව / වැදගත් සේවාව :
		ප්‍රධාන සේවාව / වැදගත් සේවාව :	ක්‍රමයට නොපැමිණි :
		සේවාවේ කාලය :	
		ක්‍රමය :	
		ප්‍රධාන සේවාව / වැදගත් සේවාව :	ක්‍රමයට නොපැමිණි :
		සේවාවේ කාලය :	
		ක්‍රමය :	
		සේවාවේ කාලය :	ක්‍රමයට නොපැමිණි :
		වැදගත් සේවාවන් සහ සේවාවන් සහ සේවාවන් ක්‍රමයට නොපැමිණි :	

(قانونی راجسٹریشن) ۱۰۰

مقدمہ

درخواست کی تاریخ پر درج کردہ تمام حالات اور حقائق کو مدنظر رکھ کر

یہ

قانون

کے مطابق یہ

مقررہ

قانونی راجسٹریشن کا حکم

۱. درخواستی نے درخواست کی ہے کہ اسے رجسٹریشن فراہم کی جائے تاکہ

اس کے حقوق محفوظ رکھنے اور اسے محفوظ بنانے کے لئے

اس کے لئے رجسٹریشن کی درخواستیں: aa-himandhoo-courts.gov.mv | اس کے لئے: aa-himandhoo@judiciary.gov.mv



අධිකරණ අංශයේ පිළිගැනීමේ ලේඛන

අංක: 2019/00000

පිටුව: 01/01

.....: 2019/00000

විවේචනාත්මක වාර්තාවක්

24 (අ) (2019) අධිකරණ විධායක ජනරාල් (51-01)

දිනය: 2019/00000

.....: 2019/00000

අනුකූල

.....: 2019/00000

අවසාන

1. මෙහි දැක්වෙන සියලුම කොටස් අත්සන් කළ යුතුය.
2. මෙහි දැක්වෙන සියලුම කොටස් අත්සන් කළ යුතුය.
3. මෙහි දැක්වෙන සියලුම කොටස් අත්සන් කළ යුතුය.
4. මෙහි දැක්වෙන සියලුම කොටස් අත්සන් කළ යුතුය.
5. මෙහි දැක්වෙන සියලුම කොටස් අත්සන් කළ යුතුය.

03 دوائر القضاء وادارة المحاكم: تدابير تحسينية

.....

04 دوائر القضاء وادارة المحاكم: التحديات

.....
.....
.....
.....

_____ : مصدر:

_____ : مصدر:

_____ : مصدر:

_____ : مصدر:

المراجع

1. دائرة القضاء وادارة المحاكم | تقرير سنوي (2023).
2. دائرة القضاء وادارة المحاكم | تقرير سنوي (2022).
3. دائرة القضاء وادارة المحاكم | تقرير سنوي (2021).



ދިވެހިރާއްޖޭގެ ޖުޖުމްހޫރިއްޔާ ގުޅިގެން ސަރުކާރުގެ ޖުޖުމްހޫރިއްޔާ

ހަރުދާތަކާ ގުޅިގެން

ދިވެހިރާއްޖޭގެ ޖުޖުމްހޫރިއްޔާ

..... ޖުޖުމްހޫރިއްޔާ ގުޅިގެން :

ޖުޖުމްހޫރިއްޔާ ގުޅިގެން ސަރުކާރުގެ ޖުޖުމްހޫރިއްޔާ

25 ޖުޖުމްހޫރިއްޔާ (މަޖިލިސް ހަރުދާތަކާ ގުޅިގެން ސަރުކާރުގެ ޖުޖުމްހޫރިއްޔާ 51-0 (ސ))

މަޖިލިސް ހަރުދާތަކާ ގުޅިގެން :

..... ޖުޖުމްހޫރިއްޔާ ގުޅިގެން :

މަޖިލިސް

..... ޖުޖުމްހޫރިއްޔާ ގުޅިގެން :

	تۆمبۈرەك سۈنم (۱۹۹۳ سۆڭۈم) :
--	---------------------------------------

01 دۆۋەت مەھكىمىسى دۆۋەت :

			تۆمبۈرەك سۈنم (۱۹۹۳ سۆڭۈم) :
	تۆمبۈرەك :		ئەلەم ئەم سۈنم / تۆمبۈرەك سۈنم :
		ئەم سۈنم / تۆمبۈرەك سۈنم :	تۆمبۈرەك ئەم سۈنم :
		تۆمبۈرەك سۈنم :	
		تۆمبۈرەك :	
		ئەم سۈنم / تۆمبۈرەك سۈنم :	تۆمبۈرەك ئەم سۈنم :
		تۆمبۈرەك سۈنم :	
		تۆمبۈرەك :	
		تۆمبۈرەك ئەم سۈنم :	تۆمبۈرەك سۈنم :
			تۆمبۈرەك سۈنم / تۆمبۈرەك سۈنم ئەم سۈنم :

: 777	: 777	: 777	: 777
		: 777	: 777
		: 777	: 777
		: 777	: 777
		: 777	: 777
		: 777	: 777
		: 777	: 777
		: 777	: 777
		: 777	: 777
		: 777	: 777
		: 777	: 777
		: 777	: 777
		: 777	: 777
		: 777	: 777

02 777

03 777 (777)

.....

.....

.....

.....

.....

.....

04 777

..... 1

දරිද්දාලයේ ඇති ප්‍රධාන නිලධාරීන්ගේ නම සහ සේවයේ සිටින ස්ථානය :

1

2

ප්‍රධාන නිලධාරීන්ගේ නම :

නම :

සේවය :

සේවයේ සිටින ස්ථානය :

නම :

ප්‍රධාන නිලධාරීන්ගේ නම :

නම :

සේවය :

සේවයේ සිටින ස්ථානය :

නම / සේවයේ සිටින ස්ථානය :

01 හැරිමුණු බ්‍රසේනියාහි බ්‍රහ්මචාරිණියන්ගේ අත්සන

□ ත්‍රිකුණාමලයේ පැවැත්වූ සාකච්ඡාවකදී, ජාතික මට්ටමේ සාකච්ඡා කිරීමේදී, සාමාන්‍යයෙන් මෙහිදී සාකච්ඡා කළ යුතු කරුණු මෙහි දැක්වෙන පරිදි වේ.

□ ත්‍රිකුණාමලයේ පැවැත්වූ සාකච්ඡාවකදී, ජාතික මට්ටමේ සාකච්ඡා කිරීමේදී, සාමාන්‍යයෙන් මෙහිදී සාකච්ඡා කළ යුතු කරුණු මෙහි දැක්වෙන පරිදි වේ.

□ ත්‍රිකුණාමලයේ පැවැත්වූ සාකච්ඡාවකදී, ජාතික මට්ටමේ සාකච්ඡා කිරීමේදී, සාමාන්‍යයෙන් මෙහිදී සාකච්ඡා කළ යුතු කරුණු මෙහි දැක්වෙන පරිදි වේ.

□ ත්‍රිකුණාමලයේ පැවැත්වූ සාකච්ඡාවකදී, ජාතික මට්ටමේ සාකච්ඡා කිරීමේදී, සාමාන්‍යයෙන් මෙහිදී සාකච්ඡා කළ යුතු කරුණු මෙහි දැක්වෙන පරිදි වේ.

සඳහා

02 හැරිමුණු බ්‍රසේනියාහි බ්‍රහ්මචාරිණියන්ගේ අත්සන

.....
.....
.....

03 හැරිමුණු බ්‍රසේනියාහි බ්‍රහ්මචාරිණියන්ගේ අත්සන

.....
.....
.....
.....
.....
.....
.....

සඳහා:

සඳහා:

බ්‍රහ්මචාරිණියන්ගේ අත්සන

බ්‍රහ්මචාරිණියන්ගේ අත්සන

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ



ދިވެހިރާއްޖޭގެ ޖުޖުމްހޫރީ ކޮރޯޓް ސަރުކާރުގެ ނަމުގައި

ހުކުމް ދެއްވާ ފަރާތް

އިތުރު ފަންނުގައި.

..... ފަންނުގެ ނަންބަރު : 303

މިއަދުގެ ބަންދުކުރުމުގެ ނިންމުމުގެ ބަޔާން ދެއްވާ ފަރާތް ސަރުކާރުގެ ނަމުގައި

ފަންނު 27 (ވަނަ ބައިގެ ޖުޖުމްހޫރީ ކޮރޯޓްގެ ސަލާސަތުގެ ދަށުން)

[Empty rectangular box for signature or stamp]

މިއަދުގެ ބަންދުކުރުމުގެ ނިންމުމުގެ ބަޔާން :

މިއަދުގެ ބަންދުކުރުމުގެ ނިންމުމުގެ ބަޔާން :

.....

މިއަދުގެ ބަންދުކުރުމުގެ ނިންމުމުގެ ބަޔާން

މިއަދުގެ ބަންދުކުރުމުގެ ނިންމުމުގެ ބަޔާން :

.....

01 ڄاڻو ٿو ته ڪهڙي ڳالهه ڪرڻي ٿي ته ٻين کي به ڏانهن ڏسڻو ٿو :

- ٻين جي ڳالهه ڪرڻي ٿي ته ٻين کي به ڏانهن ڏسڻو ٿو 14 ڏينهن جي اندر ٻين کي به ڏانهن ڏسڻو ٿو.
- ٻين جي ڳالهه ڪرڻي ٿي ته ٻين کي به ڏانهن ڏسڻو ٿو ٻين جي ڳالهه ڪرڻي ٿي ته ٻين کي به ڏانهن ڏسڻو ٿو.
- ٻين جي ڳالهه ڪرڻي ٿي ته ٻين کي به ڏانهن ڏسڻو ٿو 409 ڏينهن جي اندر ٻين کي به ڏانهن ڏسڻو ٿو (ا) ۽ ٻين کي به ڏانهن ڏسڻو ٿو.

02 ٻين جي ڳالهه ڪرڻي ٿي ته ٻين کي به ڏانهن ڏسڻو ٿو :

- ٻين جي ڳالهه ڪرڻي ٿي ته ٻين کي به ڏانهن ڏسڻو ٿو
- ٻين جي ڳالهه ڪرڻي ٿي ته ٻين کي به ڏانهن ڏسڻو ٿو

..... 03 ٻين جي ڳالهه ڪرڻي ٿي ته ٻين کي به ڏانهن ڏسڻو ٿو :

04 ڪهڙي ڳالهه ڪرڻي ٿي ته ٻين کي به ڏانهن ڏسڻو ٿو :

.....

.....

.....

.....

.....

.....

05 ڪهڙي ڳالهه ڪرڻي ٿي ته ٻين کي به ڏانهن ڏسڻو ٿو :

- 1.
- 2.
- 3.

(*قۇرۇق قۇرۇق سەھ*)

قۇرۇق قۇرۇق سەھ قۇرۇق قۇرۇق سەھ

06 قۇرۇق قۇرۇق سەھ قۇرۇق قۇرۇق سەھ :

			<i>قۇرۇق قۇرۇق سەھ (قۇرۇق قۇرۇق سەھ) :</i>
<i>قۇرۇق قۇرۇق سەھ :</i>	<i>قۇرۇق قۇرۇق سەھ :</i>	<i>قۇرۇق قۇرۇق سەھ :</i>	<i>قۇرۇق قۇرۇق سەھ / قۇرۇق قۇرۇق سەھ :</i>
		<i>قۇرۇق قۇرۇق سەھ / قۇرۇق قۇرۇق سەھ :</i>	<i>قۇرۇق قۇرۇق سەھ :</i>
		<i>قۇرۇق قۇرۇق سەھ :</i>	
		<i>قۇرۇق قۇرۇق سەھ :</i>	
		<i>قۇرۇق قۇرۇق سەھ / قۇرۇق قۇرۇق سەھ :</i>	<i>قۇرۇق قۇرۇق سەھ :</i>
		<i>قۇرۇق قۇرۇق سەھ :</i>	
		<i>قۇرۇق قۇرۇق سەھ :</i>	
	<i>قۇرۇق قۇرۇق سەھ :</i>		<i>قۇرۇق قۇرۇق سەھ :</i>

07 قۇرۇق قۇرۇق سەھ قۇرۇق قۇرۇق سەھ :

			تۆھبە سۈرئەت (ئۆزۈم سۆزۈم) :
	تۆھبە : :	تۆھبە سۈرئەت : :	تۆھبە سۈرئەت / تۆھبە سۈرئەت : :
		تۆھبە سۈرئەت / تۆھبە سۈرئەت : :	تۆھبە سۈرئەت : :
		تۆھبە سۈرئەت : :	
		تۆھبە : :	
		تۆھبە سۈرئەت / تۆھبە سۈرئەت : :	تۆھبە سۈرئەت : :
		تۆھبە سۈرئەت : :	
		تۆھبە : :	
		تۆھبە سۈرئەت : :	تۆھبە سۈرئەت : :

(تۆھبە سۈرئەت)

تۆھبە :

تۆھبە سۈرئەت سۈرئەت سۈرئەت سۈرئەت سۈرئەت سۈرئەت

تۆھبە :

تۆھبە :

تۆھبە سۈرئەت سۈرئەت سۈرئەت :

تۆھبە :

تۆھبە سۈرئەت سۈرئەت سۈرئەت سۈرئەت سۈرئەت :

1. تۆھبە سۈرئەت سۈرئەت سۈرئەت سۈرئەت سۈرئەت سۈرئەت سۈرئەت سۈرئەت

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

تۆھبە سۈرئەت سۈرئەت سۈرئەت سۈرئەت سۈرئەت

تۆھبە سۈرئەت : aa-himandhoo@judiciary.gov.mv | تۆھبە سۈرئەت : aa-himandhoo@judiciary.gov.mv



ދިވެހިރާއްޖޭގެ ޖުޖިއަރީ ސަރުކާރުގެ ޖަލްސާ ސަރުކާރުގެ ޖަލްސާ

ހަރަކާތްތަކުގެ ޖަލްސާ

ޖަލްސާ ސަރުކާރުގެ ޖަލްސާ

..... ޖަލްސާ ސަރުކާރުގެ ޖަލްސާ

ދިވެހިރާއްޖޭގެ ޖުޖިއަރީ ސަރުކާރުގެ ޖަލްސާ ސަރުކާރުގެ ޖަލްސާ

ޖަލްސާ 28 (ޖަލްސާ ޖަލްސާ ސަރުކާރުގެ ޖަލްސާ 132)

Empty rectangular box for signature or stamp

ޖަލްސާ ސަރުކާރުގެ ޖަލްސާ

..... ޖަލްސާ ސަރުކާރުގެ ޖަލްސާ

ހަރަކާތްތަކުގެ ޖަލްސާ

..... ޖަލްސާ ސަރުކާރުގެ ޖަލްސާ

	<p>سرس:</p> <p>ايرچ ساچ سرسره:</p> <p>۴۴ سرس:</p> <p>س:</p> <p>قوسرى فو اير ايرچ كرسج سرسره:</p> <p>سرسره ايرچ:</p>
.20	<p>سوسر ايرچ كرسج كرسج ايرچ كرسج ايرچ كرسج</p> <p>۴۴ سرس:</p> <p>س:</p> <p>قوسرى فو اير ايرچ كرسج سرسره:</p> <p>سرسره ايرچ:</p>
.21	<p>سوسر ايرچ كرسج كرسج ايرچ كرسج ايرچ كرسج</p> <p>۴۴ سرس:</p> <p>س:</p> <p>قوسرى فو اير ايرچ كرسج سرسره:</p> <p>سرسره ايرچ:</p> <p>سوسر ايرچ:</p> <p>قوسرى فو:</p> <p>سرسره ايرچ:</p> <p>قوسر سرسره:</p> <p>سوسر ايرچ كرسج ايرچ كرسج ايرچ كرسج سرسره:</p> <p>سوسر ايرچ كرسج ايرچ كرسج ايرچ كرسج ايرچ كرسج:</p>

سوسر ايرچ	
<p>ايرچ كرسج ايرچ سرسره كرسج كرسج ايرچ ايرچ كرسج ايرچ</p> <p>ايرچ كرسج ايرچ سرسره كرسج</p>	<p>ايرچ كرسج ايرچ سرسره كرسج كرسج ايرچ ايرچ كرسج ايرچ</p> <p>ايرچ كرسج ايرچ سرسره كرسج</p>
<p>سوسر:</p> <p>.....</p> <p>سوسر:</p>	<p>سرس:</p> <p>سوسره ايرچ:</p>

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ



دَارُ الدِّيْنِ دَارُ الدِّينِ دَارُ الدِّينِ دَارُ الدِّينِ دَارُ الدِّينِ

دَارُ الدِّينِ

دَارُ الدِّينِ

..... : دَارُ الدِّينِ

دَارُ الدِّينِ دَارُ الدِّينِ دَارُ الدِّينِ

29 (دَارُ الدِّينِ دَارُ الدِّينِ دَارُ الدِّينِ دَارُ الدِّينِ دَارُ الدِّينِ)

دَارُ الدِّينِ دَارُ الدِّينِ

دَارُ الدِّينِ دَارُ الدِّينِ

دَارُ الدِّينِ

دَارُ الدِّينِ دَارُ الدِّينِ

...

...

(...)

(...)

(...)

...
...



ދިވެހިރާއްޖޭގެ ޖުޖުކަން ދާއިރާގެ ޖުޖުކަން ޖަލީފާ

ގަވާއިދު ޖަލީފާ

ޖުޖުކަން ޖަލީފާ

..... ޖުޖުކަން ޖަލީފާ

(ޖުޖުކަން ޖަލީފާ ޖަލީފާ ޖަލީފާ...)

ޖުޖުކަން ޖަލީފާ 30 (ޖުޖުކަން ޖަލީފާ ޖަލީފާ ޖަލީފާ ޖަލީފާ ޖަލީފާ ޖަލީފާ ޖަލީފާ ޖަލީފާ)

ޖުޖުކަން ޖަލީފާ

..... ޖުޖުކަން ޖަލީފާ ޖަލީފާ

ޖުޖުކަން

..... ޖުޖުކަން ޖަލީފާ ޖަލީފާ

		: 01 01 01 01 01 01 01 01 01 01	
: 01 01		: 01 01 01 01 01 01 01 01	: 01 01 01 01 01 01 01 01 01 01
		: 01 01 01 01 01 01 01 01	: 01 01 01 01 01 01 01 01
		: 01 01 01 01 01 01 01 01	
		: 01 01 01 01 01 01 01 01	
		: 01 01 01 01 01 01 01 01	: 01 01 01 01 01 01 01 01
		: 01 01 01 01 01 01 01 01	
		: 01 01 01 01 01 01 01 01	
		: 01 01 01 01 01 01 01 01	: 01 01 01 01 01 01 01 01
		: 01 01 01 01 01 01 01 01 01 01	

		: 02 02 02 02 02 02 02 02 02 02	
: 02 02		: 02 02 02 02 02 02 02 02	: 02 02 02 02 02 02 02 02 02 02
		: 02 02 02 02 02 02 02 02	: 02 02 02 02 02 02 02 02
		: 02 02 02 02 02 02 02 02	
		: 02 02 02 02 02 02 02 02	
		: 02 02 02 02 02 02 02 02	: 02 02 02 02 02 02 02 02
		: 02 02 02 02 02 02 02 02	
		: 02 02 02 02 02 02 02 02	
		: 02 02 02 02 02 02 02 02	: 02 02 02 02 02 02 02 02
		: 02 02 02 02 02 02 02 02 02 02	

පිටුව

.....

.....

.....

.....

.....

(නියෝජිතයාගේ නම)

(නියෝජිතයාගේ ලිපිනය)

(නියෝජිතයාගේ ලිපිනය)

රජයේ සේවයේ සිටින බැවින් නොසලකා බැලිය යුතුය!

නියෝජිතයාගේ නම සඳහා වන පිටුවකි.

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ



අධිකරණ පදනමේ පිළිගැනීමේ පත්‍රය

අංක. 01/2024

දිනය: 2024

..... : පිටපත් කිරීමේදී

අධිකරණ පදනමේ පිළිගැනීමේ පත්‍රය

අංක 31 (අධිකරණ පදනමේ පිළිගැනීමේ පත්‍රය - 184)

අධිකරණ පදනමේ පිළිගැනීමේ පත්‍රය:

අධිකරණ පදනමේ පිළිගැනීමේ පත්‍රය

අධිකරණ පදනමේ පිළිගැනීමේ පත්‍රය:

අධිකරණ පදනමේ පිළිගැනීමේ පත්‍රය

1. අධිකරණ පදනමේ පිළිගැනීමේ පත්‍රය අනුකූලව පිරවීමට අවශ්‍ය කර ඇති සියලුම කොටස් පිරවීමට අවශ්‍ය වේ.

01 לפי דבריו של השופט בהחלטתו

1. **רשימת פרטים של כל הפרטים לפי הדבריו של השופט בהחלטתו/ ההחלטות שכתב:**
.....
2. **פרטים נוספים של הדבריו של השופט בהחלטתו, פרטים נוספים שהם חלק מהדבריו של השופט:**
.....

02 לפי דבריו של השופט בהחלטתו

שם:

תאריך של הפרטים:

03 לפי שכתב השופט בהחלטתו

1. **שכתב השופט בהחלטתו:**
.....
 2. **החלטתו של השופט בהחלטתו של השופט בהחלטתו, אחת מהחלטות:**
.....
- דבריו של השופט בהחלטתו של השופט בהחלטתו
- החלטתו של השופט בהחלטתו של השופט בהחלטתו
3. **לפי דבריו של השופט:**

(דבריו של השופט בהחלטתו של השופט בהחלטתו של השופט בהחלטתו של השופט בהחלטתו)

החלטתו של השופט בהחלטתו של השופט בהחלטתו של השופט בהחלטתו של השופט בהחלטתו).

.....

.....

.....

.....

4. Լիցիտացիայի արձեղանի արժեքի և սահմանի հաստատումը:

(Տարածված և արժեքի արձեղանի հաստատումը):

.....
.....
.....
.....

5. Լիցիտացիայի արձեղանի հաստատումը:

.....
.....
.....
.....

04 Լիցիտացիայի արձեղանի արժեքի և սահմանի հաստատումը

Լիցիտացիայի արձեղանի հաստատումը

Լիցիտացիայի արձեղանի հաստատումը

..... Երևան:

..... Երևան:

..... Գրասենյակի հասցե:

..... Գրասենյակի հասցե:

Գրասենյակի հասցե

Գրասենյակի հասցե

..... Կապի հասցե:

..... Կապի հասցե:

..... Գրասենյակի հասցե:

..... Գրասենյակի հասցե:

..... Կապի հասցե:

..... Կապի հասցե:

..... Գրասենյակի հասցե:

..... Գրասենյակի հասցե:

د. ډاکټر هېماند هو / د ښارونو او کورنيو چارو د لړۍ سره

د. ډاکټر هېماند هو / د ښارونو او کورنيو چارو د لړۍ سره

..... د ښارونو چارو د لړۍ سره:

..... د ښارونو چارو د لړۍ سره:

..... د ښارونو چارو د لړۍ سره:

..... د ښارونو چارو د لړۍ سره:

..... د ښارونو چارو د لړۍ سره:

..... د ښارونو چارو د لړۍ سره:

..... د ښارونو چارو د لړۍ سره:

..... د ښارونو چارو د لړۍ سره:

..... د ښارونو چارو د لړۍ سره:

..... د ښارونو چارو د لړۍ سره:

..... د ښارونو چارو د لړۍ سره:

..... د ښارونو چارو د لړۍ سره:

..... د ښارونو چارو د لړۍ سره:

..... د ښارونو چارو د لړۍ سره:

.....

.....

د ښارونو چارو د لړۍ سره

د ښارونو چارو د لړۍ سره د ښارونو چارو د لړۍ سره د ښارونو چارو د لړۍ سره

.....

.....

.....

.....

.....

.....

.....

.....



REPUBLIC OF TIMOR-LESTE
MINISTRY OF JUSTICE

Dili, Timor-Leste

2024

Case No.

INVESTIGATION REPORT

32 (a), (b), (c), (d), (e), (f), (g), (h), (i), (j), (k), (l), (m), (n), (o), (p), (q), (r), (s), (t), (u), (v), (w), (x), (y), (z), (aa), (ab), (ac), (ad), (ae), (af), (ag), (ah), (ai), (aj), (ak), (al), (am), (an), (ao), (ap), (aq), (ar), (as), (at), (au), (av), (aw), (ax), (ay), (az), (ba), (bb), (bc), (bd), (be), (bf), (bg), (bh), (bi), (bj), (bk), (bl), (bm), (bn), (bo), (bp), (bq), (br), (bs), (bt), (bu), (bv), (bw), (bx), (by), (bz), (ca), (cb), (cc), (cd), (ce), (cf), (cg), (ch), (ci), (cj), (ck), (cl), (cm), (cn), (co), (cp), (cq), (cr), (cs), (ct), (cu), (cv), (cw), (cx), (cy), (cz), (da), (db), (dc), (dd), (de), (df), (dg), (dh), (di), (dj), (dk), (dl), (dm), (dn), (do), (dp), (dq), (dr), (ds), (dt), (du), (dv), (dw), (dx), (dy), (dz), (ea), (eb), (ec), (ed), (ee), (ef), (eg), (eh), (ei), (ej), (ek), (el), (em), (en), (eo), (ep), (eq), (er), (es), (et), (eu), (ev), (ew), (ex), (ey), (ez), (fa), (fb), (fc), (fd), (fe), (ff), (fg), (fh), (fi), (fj), (fk), (fl), (fm), (fn), (fo), (fp), (fq), (fr), (fs), (ft), (fu), (fv), (fw), (fx), (fy), (fz), (ga), (gb), (gc), (gd), (ge), (gf), (gg), (gh), (gi), (gj), (gk), (gl), (gm), (gn), (go), (gp), (gq), (gr), (gs), (gt), (gu), (gv), (gw), (gx), (gy), (gz), (ha), (hb), (hc), (hd), (he), (hf), (hg), (hh), (hi), (hj), (hk), (hl), (hm), (hn), (ho), (hp), (hq), (hr), (hs), (ht), (hu), (hv), (hw), (hx), (hy), (hz), (ia), (ib), (ic), (id), (ie), (if), (ig), (ih), (ii), (ij), (ik), (il), (im), (in), (io), (ip), (iq), (ir), (is), (it), (iu), (iv), (iw), (ix), (iy), (iz), (ja), (jb), (jc), (jd), (je), (jf), (jg), (jh), (ji), (jj), (jk), (jl), (jm), (jn), (jo), (jp), (jq), (jr), (js), (jt), (ju), (jv), (jw), (jx), (jy), (jz), (ka), (kb), (kc), (kd), (ke), (kf), (kg), (kh), (ki), (kj), (kk), (kl), (km), (kn), (ko), (kp), (kq), (kr), (ks), (kt), (ku), (kv), (kw), (kx), (ky), (kz), (la), (lb), (lc), (ld), (le), (lf), (lg), (lh), (li), (lj), (lk), (ll), (lm), (ln), (lo), (lp), (lq), (lr), (ls), (lt), (lu), (lv), (lw), (lx), (ly), (lz), (ma), (mb), (mc), (md), (me), (mf), (mg), (mh), (mi), (mj), (mk), (ml), (mm), (mn), (mo), (mp), (mq), (mr), (ms), (mt), (mu), (mv), (mw), (mx), (my), (mz), (na), (nb), (nc), (nd), (ne), (nf), (ng), (nh), (ni), (nj), (nk), (nl), (nm), (nn), (no), (np), (nq), (nr), (ns), (nt), (nu), (nv), (nw), (nx), (ny), (nz), (oa), (ob), (oc), (od), (oe), (of), (og), (oh), (oi), (oj), (ok), (ol), (om), (on), (oo), (op), (oq), (or), (os), (ot), (ou), (ov), (ow), (ox), (oy), (oz), (pa), (pb), (pc), (pd), (pe), (pf), (pg), (ph), (pi), (pj), (pk), (pl), (pm), (pn), (po), (pp), (pq), (pr), (ps), (pt), (pu), (pv), (pw), (px), (py), (pz), (qa), (qb), (qc), (qd), (qe), (qf), (qg), (qh), (qi), (qj), (qk), (ql), (qm), (qn), (qo), (qp), (qq), (qr), (qs), (qt), (qu), (qv), (qw), (qx), (qy), (qz), (ra), (rb), (rc), (rd), (re), (rf), (rg), (rh), (ri), (rj), (rk), (rl), (rm), (rn), (ro), (rp), (rq), (rr), (rs), (rt), (ru), (rv), (rw), (rx), (ry), (rz), (sa), (sb), (sc), (sd), (se), (sf), (sg), (sh), (si), (sj), (sk), (sl), (sm), (sn), (so), (sp), (sq), (sr), (ss), (st), (su), (sv), (sw), (sx), (sy), (sz), (ta), (tb), (tc), (td), (te), (tf), (tg), (th), (ti), (tj), (tk), (tl), (tm), (tn), (to), (tp), (tq), (tr), (ts), (tt), (tu), (tv), (tw), (tx), (ty), (tz), (ua), (ub), (uc), (ud), (ue), (uf), (ug), (uh), (ui), (uj), (uk), (ul), (um), (un), (uo), (up), (uq), (ur), (us), (ut), (uu), (uv), (uw), (ux), (uy), (uz), (va), (vb), (vc), (vd), (ve), (vf), (vg), (vh), (vi), (vj), (vk), (vl), (vm), (vn), (vo), (vp), (vq), (vr), (vs), (vt), (vu), (vv), (vw), (vx), (vy), (vz), (wa), (wb), (wc), (wd), (we), (wf), (wg), (wh), (wi), (wj), (wk), (wl), (wm), (wn), (wo), (wp), (wq), (wr), (ws), (wt), (wu), (wv), (ww), (wx), (wy), (wz), (xa), (xb), (xc), (xd), (xe), (xf), (xg), (xh), (xi), (xj), (xk), (xl), (xm), (xn), (xo), (xp), (xq), (xr), (xs), (xt), (xu), (xv), (xw), (xx), (xy), (xz), (ya), (yb), (yc), (yd), (ye), (yf), (yg), (yh), (yi), (yj), (yk), (yl), (ym), (yn), (yo), (yp), (yq), (yr), (ys), (yt), (yu), (yv), (yw), (yx), (yy), (yz), (za), (zb), (zc), (zd), (ze), (zf), (zg), (zh), (zi), (zj), (zk), (zl), (zm), (zn), (zo), (zp), (zq), (zr), (zs), (zt), (zu), (zv), (zw), (zx), (zy), (zz)

[Empty box for signature]

Investigator

.....

.....

.....

1. ځوابونه:

1. ځوابونه څرګندوي چې د ښارونو د پراخېدو لامل څه دي؟
2. ځوابونه څرګندوي چې د ښارونو د پراخېدو لامل څه دي؟
3. ځوابونه څرګندوي چې د ښارونو د پراخېدو لامل څه دي؟
4. ځوابونه څرګندوي چې د ښارونو د پراخېدو لامل څه دي؟
5. ځوابونه څرګندوي چې د ښارونو د پراخېدو لامل څه دي؟
6. ځوابونه څرګندوي چې د ښارونو د پراخېدو لامل څه دي؟

01 ځوابونه:			
ځوابونه (ځوابونه):			
ځوابونه:	ځوابونه:	ځوابونه:	ځوابونه:
ځوابونه:	ځوابونه:	ځوابونه:	ځوابونه:
ځوابونه:	ځوابونه:	ځوابونه:	ځوابونه:
ځوابونه:	ځوابونه:	ځوابونه:	ځوابونه:
ځوابونه:	ځوابونه:	ځوابونه:	ځوابونه:
ځوابونه:	ځوابونه:	ځوابونه:	ځوابونه:
ځوابونه:	ځوابونه:	ځوابونه:	ځوابونه:
ځوابونه:	ځوابونه:	ځوابونه:	ځوابونه:

		02 02 02 02 02 02 02 02 02 02	
		02 02 02 02 02 02 02 02 02 02	
	02 02 02 02 02 02 02 02 02 02		02 02 02 02 02 02 02 02 02 02
	02 02 02 02 02 02 02 02 02 02		02 02 02 02 02 02 02 02 02 02
	02 02 02 02 02 02 02 02 02 02		02 02 02 02 02 02 02 02 02 02
	02 02 02 02 02 02 02 02 02 02		02 02 02 02 02 02 02 02 02 02
	02 02 02 02 02 02 02 02 02 02		02 02 02 02 02 02 02 02 02 02
	02 02 02 02 02 02 02 02 02 02		02 02 02 02 02 02 02 02 02 02
	02 02 02 02 02 02 02 02 02 02		02 02 02 02 02 02 02 02 02 02
	02 02 02 02 02 02 02 02 02 02		02 02 02 02 02 02 02 02 02 02
	02 02 02 02 02 02 02 02 02 02		02 02 02 02 02 02 02 02 02 02

03 03 03 03 03 03 03 03 03 03

.....

04 04 04 04 04 04 04 04 04 04

(04 04 04 04 04 04 04 04 04 04)

- 11
- 12
- 13

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ



අධිකරණ පදනමේ ප්‍රධාන අධිකරණයේ විනිසුණකරු

ව.ව. රාජකාරි,

ප්‍රධාන අධිකරණය.

..... : දින සටහන

නිවැරදි ලිපිනයක් සහිතව අධිකරණයට භාර දීමේ අත්පිටි

දින 33 (දින 33 ඔස්සේ විනිසුණකරු විනිසුණකරු 1860 (අ))

විනිසුණකරු

..... : විනිසුණකරු

අත්පිටි

..... : විනිසුණකරු

අත්පිටි

1. දින 33 ඔස්සේ විනිසුණකරු විනිසුණකරු 1860 (අ) විනිසුණකරු

☐ 01 01 01

☐ 01 01 01

..... 02 02 02 02 02 02

..... 03 03 03 03 03 03

04 04 04 04 04 04 04 04 04

.....
.....
.....
.....

05 05 05 05 05 05 05 05 05

- 1.
- 2.
- 3.

06 06 06 06 06 06 06 06 06

..... 06 06 06 06 06 06 06 06 06

..... 06 06 06 06 06 06 06 06 06



අභ්‍යන්තර අධිකරණ රාජ්‍යයේ දැනට සිටින සියලුම අධිකරණ

වාර්ෂික වාර්තාවක්

ප්‍රකාශනයක්.

.....: දින සටහන

නවීන තොරතුරු තැබීමේ ක්‍රියාමාර්ගයේ ප්‍රවර්ධනය

දින 34 (දැනට වැඩිදියුණු කිරීමේ ක්‍රියාමාර්ගයේ 8180 (ර))

දින සටහන

.....: දින සටහන

අනුමත

.....: දින සටහන

අනුමත

1. දින සටහන අනුමත කිරීමේ ක්‍රියාමාර්ගයේ ප්‍රවර්ධනය.
2. දින සටහන අනුමත කිරීමේ ක්‍රියාමාර්ගයේ ප්‍රවර්ධනය, වාර්ෂික වාර්තාවක් සහ 12 ක්‍රියාමාර්ගයේ ප්‍රවර්ධනය.
3. දින සටහන අනුමත කිරීමේ ක්‍රියාමාර්ගයේ ප්‍රවර්ධනය සහ දින සටහන අනුමත කිරීමේ ක්‍රියාමාර්ගයේ ප්‍රවර්ධනය.
4. දින සටහන අනුමත කිරීමේ ක්‍රියාමාර්ගයේ ප්‍රවර්ධනය සහ දින සටහන අනුමත කිරීමේ ක්‍රියාමාර්ගයේ ප්‍රවර්ධනය.

				ចំនួនសំណុំរឿង (ករណី) :
	ចំនួន :	ចំនួនសំណុំរឿង :		សំណុំរឿង / ចំនួនសំណុំរឿង :
		ឈ្មោះសំណុំរឿង / ចំនួនសំណុំរឿង :	ករណីសំណុំរឿង :	
		សំណុំរឿង :		
		ចំនួន :		
		ឈ្មោះសំណុំរឿង / ចំនួនសំណុំរឿង :	ករណីសំណុំរឿង :	
		សំណុំរឿង :		
		ចំនួន :		
		សំណុំរឿងសំណុំរឿង :	ចំនួនសំណុំរឿង :	
ចំនួនសំណុំរឿងសំណុំរឿងសំណុំរឿងសំណុំរឿងសំណុំរឿង				

				ចំនួនសំណុំរឿង (ករណី) :
	ចំនួន :	ចំនួនសំណុំរឿង :		សំណុំរឿង / ចំនួនសំណុំរឿង :
		ឈ្មោះសំណុំរឿង / ចំនួនសំណុំរឿង :	ករណីសំណុំរឿង :	
		សំណុំរឿង :		
		ចំនួន :		
		ឈ្មោះសំណុំរឿង / ចំនួនសំណុំរឿង :	ករណីសំណុំរឿង :	
		សំណុំរឿង :		
		ចំនួន :		
		សំណុំរឿងសំណុំរឿង :	ចំនួនសំណុំរឿង :	
ចំនួនសំណុំរឿងសំណុំរឿងសំណុំរឿងសំណុំរឿងសំណុំរឿង				

.....
.....
.....

04 04 04

04 04

04 04

04 04 04

.....
.....
.....

05 05 05

05 05

05 05

06 06 06

06 06

06 06

07 ڇو ته قاضي جي ذميواري آهي ته عدالت جي ڪارڪردگي بچائي ڏيڻ لاءِ ڪا به تڪڙو بندوبست ڪري؟

ڪو نه آهي.

آهي.

08 اڳوڻو وقت، جڏهن ته عدالت جي ڪارڪردگي بچائي ڏيڻ لاءِ ڪا به تڪڙو بندوبست ڪري؟

ڪو نه آهي (تڪڙو وقت نه آهي ته عدالت جي ڪارڪردگي بچائي ڏيڻ لاءِ ڪا به تڪڙو بندوبست ڪري).

آهي.

09 ڪو به تڪڙو بندوبست ڪري ته عدالت جي ڪارڪردگي بچائي ڏيڻ لاءِ ڪا به تڪڙو بندوبست ڪري؟

.....

.....

.....

.....

.....

ڊ. قاضي جي ذميواري آهي ته عدالت جي ڪارڪردگي بچائي ڏيڻ لاءِ ڪا به تڪڙو بندوبست ڪري؟

جواب:

جواب:

ڊاڪٽر ع. ه. هاشمي

جواب:

ڊاڪٽر ع. ه. هاشمي

1. ڊاڪٽر ع. ه. هاشمي جي ذميواري آهي ته عدالت جي ڪارڪردگي بچائي ڏيڻ لاءِ ڪا به تڪڙو بندوبست ڪري؟



دَارُ الدَّيْوَانِ لِدَوْلَةِ بَرُونَيْ دَارُ السَّلْمِ

مِنْ بَرُونَيْ دَارُ السَّلْمِ

بِرُوَيْتِ بَرُونَيْ دَارُ السَّلْمِ

..... قَدْرُ سَدْرَةِ الْمَرْثَى :

اِسْمُ الْمُرْتَدِّ الْمُسْلِمِ الْمُنْتَقِلِ إِلَى دِيَارٍ أُخْرَى

قَدْرُ 35 (كَرْتِيْمِ مَرْجِعِ مَرْدُوْدِي تَقْوِيْمِيَّةً 191٠ (-))

دَارُ الدَّيْوَانِ لِدَوْلَةِ بَرُونَيْ دَارُ السَّلْمِ :

..... كَرْتِيْمِ مَرْجِعِ مَرْدُوْدِي تَقْوِيْمِيَّةً 191٠ (-) :

مَرْتَبًا

..... كَرْتِيْمِ مَرْجِعِ مَرْدُوْدِي تَقْوِيْمِيَّةً 191٠ (-) :

اِسْمُ الْمُرْتَدِّ الْمُسْلِمِ :

1. دِ قَدْرُ تَقْوِيْمِيَّةً مَرْدُوْدِي تَقْوِيْمِيَّةً 191٠ (-) :

2. دِ قَدْرُ تَقْوِيْمِيَّةً مَرْدُوْدِي تَقْوِيْمِيَّةً 191٠ (-) : 12 كَرْتِيْمِ مَرْجِعِ مَرْدُوْدِي تَقْوِيْمِيَّةً 191٠ (-) .

3. دِ قَدْرُ تَقْوِيْمِيَّةً مَرْدُوْدِي تَقْوِيْمِيَّةً 191٠ (-) : 12 كَرْتِيْمِ مَرْجِعِ مَرْدُوْدِي تَقْوِيْمِيَّةً 191٠ (-) .

4. دِ قَدْرُ تَقْوِيْمِيَّةً مَرْدُوْدِي تَقْوِيْمِيَّةً 191٠ (-) : 12 كَرْتِيْمِ مَرْجِعِ مَرْدُوْدِي تَقْوِيْمِيَّةً 191٠ (-) .

01 01 **01**

					01 01 01
01	01	01	01	01	01
		01	01	01	01
		01	01	01	01
		01	01	01	01
		01	01	01	01
		01	01	01	01
		01	01	01	01
		01	01	01	01
		01	01	01	01

02 02 **02**

					02 02 02
02	02	02	02	02	02
		02	02	02	02
		02	02	02	02
		02	02	02	02
		02	02	02	02
		02	02	02	02
		02	02	02	02
		02	02	02	02
		02	02	02	02

.....
.....
.....

04 قضايا القضاة في المحكمة :

قضايا القضاة في المحكمة

قضايا القضاة في المحكمة

قضايا القضاة في المحكمة :
.....

..... :
.....

05 في قضايا القضاة في المحكمة :

قضايا القضاة في المحكمة

قضايا القضاة في المحكمة

06 في قضايا القضاة في المحكمة :

قضايا القضاة في المحكمة

قضايا القضاة في المحكمة

07 في قضايا القضاة في المحكمة :

قضايا القضاة في المحكمة

قضايا القضاة في المحكمة

08 ሰነድ የሚያስፈልግ የሆኑ ጉዳዮች ላይ ለማስፈረም ማድረግ ይቻላል።

□ ማስፈረም (ማስፈረም ለማድረግ ማስፈረም)

□ ማስፈረም

09 የሰነድ ማስፈረም ለማድረግ ማድረግ ይቻላል።

.....
.....
.....
.....
.....
.....
.....

የሰነድ ማስፈረም ለማድረግ ማድረግ ይቻላል።

ሰነድ :

_____ ሰነድ :

_____ ሰነድ ለማስፈረም ማድረግ ይቻላል :

_____ ሰነድ :

የሰነድ ማስፈረም ለማድረግ ማድረግ ይቻላል።

1. የሰነድ ማስፈረም ለማድረግ ማድረግ ይቻላል።

01 01 ڊيٽا ڊيٽا ڊيٽا

			ڊيٽا ڊيٽا (ڊيٽا ڊيٽا) :
ڊيٽا :	ڊيٽا ڊيٽا :	ڊيٽا ڊيٽا / ڊيٽا ڊيٽا :	
		ڊيٽا ڊيٽا / ڊيٽا ڊيٽا :	ڊيٽا ڊيٽا :
		ڊيٽا ڊيٽا :	
		ڊيٽا :	
		ڊيٽا ڊيٽا / ڊيٽا ڊيٽا :	ڊيٽا ڊيٽا :
		ڊيٽا ڊيٽا :	
		ڊيٽا :	
		ڊيٽا ڊيٽا :	ڊيٽا ڊيٽا :
			ڊيٽا ڊيٽا ڊيٽا ڊيٽا ڊيٽا ڊيٽا ڊيٽا

02 02 ڊيٽا ڊيٽا ڊيٽا

			ڊيٽا ڊيٽا (ڊيٽا ڊيٽا) :
ڊيٽا :	ڊيٽا ڊيٽا :	ڊيٽا ڊيٽا / ڊيٽا ڊيٽا :	
		ڊيٽا ڊيٽا / ڊيٽا ڊيٽا :	ڊيٽا ڊيٽا :
		ڊيٽا ڊيٽا :	
		ڊيٽا :	
		ڊيٽا ڊيٽا / ڊيٽا ڊيٽا :	ڊيٽا ڊيٽا :
		ڊيٽا ڊيٽا :	
		ڊيٽا :	
		ڊيٽا ڊيٽا :	ڊيٽا ڊيٽا :
			ڊيٽا ڊيٽا ڊيٽا ڊيٽا ڊيٽا ڊيٽا ڊيٽا

03. **03** **سراير بندا و سراج بانامير اتر و ترم**

تراونين ترم

تراونين ترم

04. **04** **سراير بندا و سراج بانامير اتر و ترم**

و:

سراير ترم:

سراير ترم و ترم:

05. **05** **سراير بندا و سراج بانامير اتر و ترم**

سراير بندا و سراج بانامير اتر و ترم **سراير بندا و سراج بانامير اتر و ترم** **سراير بندا و سراج بانامير اتر و ترم** **سراير بندا و سراج بانامير اتر و ترم** **سراير بندا و سراج بانامير اتر و ترم**

سراير ترم و ترم:

سراير بندا و سراج بانامير اتر و ترم **سراير بندا و سراج بانامير اتر و ترم** **سراير بندا و سراج بانامير اتر و ترم** **سراير بندا و سراج بانامير اتر و ترم** **سراير بندا و سراج بانامير اتر و ترم**

سراير ترم:

سراير ترم و ترم: **سراير ترم و ترم** **سراير ترم و ترم**

سراير ترم و ترم:

سراير بندا و سراج بانامير اتر و ترم **سراير بندا و سراج بانامير اتر و ترم** **سراير بندا و سراج بانامير اتر و ترم** **سراير بندا و سراج بانامير اتر و ترم** **سراير بندا و سراج بانامير اتر و ترم**

අපේ මනුෂ්‍ය හිමිකම් සහ අයිතිවාසිකම් පිළිබඳව කතා කරමු.

අපේ මනුෂ්‍ය හිමිකම් සහ අයිතිවාසිකම් කුමක් වේ? කුමක් නොවේ?

.....
.....

අපේ මනුෂ්‍ය හිමිකම් සහ අයිතිවාසිකම් කුමක් වේ?

.....
.....
.....

ඉතිරි

අපේ මනුෂ්‍ය හිමිකම් සහ අයිතිවාසිකම් කුමක් වේ? කුමක් නොවේ?

පිටු:

පිටු:

අපේ මනුෂ්‍ය හිමිකම් සහ අයිතිවාසිකම් කුමක් වේ?

ඉතිරි

අපේ මනුෂ්‍ය හිමිකම් සහ අයිතිවාසිකම් කුමක් වේ?

1. අපේ මනුෂ්‍ය හිමිකම් සහ අයිතිවාසිකම් කුමක් වේ? කුමක් නොවේ?
2. අපේ මනුෂ්‍ය හිමිකම් සහ අයිතිවාසිකම් කුමක් වේ? කුමක් නොවේ?
3. අපේ මනුෂ්‍ය හිමිකම් සහ අයිතිවාසිකම් කුමක් වේ? කුමක් නොවේ?



ދިވެހިރާއްޖޭގެ ޖުޖުކަންކުރުމުގެ މިނިސްޓްރީގެ ޖެނެރަލް ސެކްރެޓަރީޓް

މިނިސްޓްރީގެ ޖެނެރަލް ސެކްރެޓަރީޓް

ދިވެހިރާއްޖޭގެ ޖުޖުކަންކުރުމުގެ މިނިސްޓްރީ

..... ޖުޖުކަންކުރުމުގެ މިނިސްޓްރީ:

ސަލާމަތުގެ ޖުޖުކަންކުރުމުގެ މިނިސްޓްރީގެ ޖެނެރަލް ސެކްރެޓަރީޓް

37 ޖުޖުކަންކުރުމުގެ މިނިސްޓްރީގެ ޖެނެރަލް ސެކްރެޓަރީޓް (2470)

[Empty rectangular box for stamp or signature]

ޖުޖުކަންކުރުމުގެ މިނިސްޓްރީގެ ޖެނެރަލް ސެކްރެޓަރީޓް

ދިވެހިރާއްޖޭގެ ޖުޖުކަންކުރުމުގެ މިނިސްޓްރީ

މިނިސްޓްރީ

ދިވެހިރާއްޖޭގެ ޖުޖުކަންކުރުމުގެ މިނިސްޓްރީ

ދިވެހިރާއްޖޭގެ ޖުޖުކަންކުރުމުގެ މިނިސްޓްރީ

1. ޖުޖުކަންކުރުމުގެ މިނިސްޓްރީގެ ޖެނެރަލް ސެކްރެޓަރީޓް (ޖެނެރަލް ސެކްރެޓަރީޓް) ގެ ޖެނެރަލް ސެކްރެޓަރީޓް.
2. ޖުޖުކަންކުރުމުގެ މިނިސްޓްރީގެ ޖެނެރަލް ސެކްރެޓަރީޓް ގެ ޖެނެރަލް ސެކްރެޓަރީޓް.

01 ދަތުރު ފަތުރުގެ ފަރާތްތަކުގެ ސަރަޙައްދު:

02 ދަތުރު ފަތުރުގެ ފަރާތްތަކުގެ ސަރަޙައްދު ދަނީ ބަޔާންކޮށްފައެވެ:

03 ފަތުރު ފަތުރުގެ ފަރާތްތަކުގެ ސަރަޙައްދު ދަނީ ބަޔާންކޮށްފައެވެ:

.....
.....
.....

04 ފަތުރު ފަތުރުގެ ފަރާތްތަކުގެ ސަރަޙައްދު ދަނީ ބަޔާންކޮށްފައެވެ:

ފަތުރު ފަތުރުގެ ފަރާތްތަކުގެ ސަރަޙައްދު (ނަންބަރު)	ފަތުރު ފަތުރުގެ ފަރާތްތަކުގެ ސަރަޙައްދު	ފަތުރު ފަތުރުގެ ފަރާތްތަކުގެ ސަރަޙައްދު
	ބަޔާންކޮށްފައެވެ	

05 ފަތުރު ފަތުރުގެ ފަރާތްތަކުގެ ސަރަޙައްދު ދަނީ ބަޔާންކޮށްފައެވެ:

.....
.....
.....

ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓް

މި ގޮތުން ބަޔާންކުރާ ގޮތުގައި ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓްގައި ބަޔާންކުރާ ގޮތުގައި.

ސަފުޔާ:

ސަފުޔާ:

މި ގޮތުން ބަޔާންކުރާ ގޮތުގައި:

ސަފުޔާ:

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ



ايماندھو ڊيڄيٽري رڊسٽر ڊيپارٽمنٽ

دائري، رڊسٽر

ڊيپارٽمنٽ

..... : ڳوٺ سڙوڪو

ڳوٺ سڙوڪو

ڳوٺ 38 (ڊائري رڊسٽر ڊيپارٽمنٽ ڊيپارٽمنٽ 257.0 (م))

[Empty rectangular box for registration details]

ڊائري رڊسٽر

ڊيپارٽمنٽ

ڊائري

ڊيپارٽمنٽ



ආණ්ඩුක්‍රමලේඛන කොමසාරිස්වරයාගේ දුරකථන කාර්යාලය

1111, රාජ්‍ය පාර,

මහලු පාර, මාකෝ.

.....: දුරකථන අංකය

දුරකථන කාර්යාලය

39 වන (විද්‍යා මධ්‍යම විද්‍යාලයේ දුරකථන අංකය 2660)

දුරකථන අංකය

.....: දුරකථන අංකය

ආණ්ඩු

.....: දුරකථන අංකය

විමර්ශන:

1. දුරකථන අංකය ආවරණය කර ඇති බවට තීරණය කිරීම.
2. දුරකථන අංකය ආවරණය කර ඇති බවට තීරණය කිරීම, සහ දුරකථන අංකය 12 ක් දක්වා වැඩි කිරීම.
3. දුරකථන අංකය ආවරණය කර ඇති බවට තීරණය කිරීම, සහ දුරකථන අංකය 12 ක් දක්වා වැඩි කිරීම.
4. දුරකථන අංකය ආවරණය කර ඇති බවට තීරණය කිරීම, සහ දුරකථන අංකය 12 ක් දක්වා වැඩි කිරීම.

			: ()		
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:

			: ()		
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:
	:	:			:

.....
.....

04 උපදෙස් සහ ප්‍රශ්න විචාරය

.....
.....

05 උපදෙස් සහ ප්‍රශ්න විචාරය

.....
.....
.....
.....

විචාරය

ඔබගේ ප්‍රශ්න සඳහා පිළිතුරු සපයීමට අපට ඉඩ ඇත.

නම:

.....

නම:

.....

විචාරය සඳහා:

.....

නම:

විචාරය සඳහා ප්‍රශ්න විචාරය

1. ඔබගේ ප්‍රශ්න සඳහා පිළිතුරු සපයීමට අපට ඉඩ ඇත.
2. ඔබගේ ප්‍රශ්න සඳහා පිළිතුරු සපයීමට අපට ඉඩ ඇත.

03 دوره‌های تخصصی حقوق :

..... : سرپرست

..... : برای دوره‌های تخصصی

حقوق اساسی

حقوق کیفری

04 دوره‌های عمومی :

تایید صلاحیت برای دوره‌های تخصصی (نظریه و عمل) در رشته‌های حقوق اساسی، حقوق کیفری، حقوق مدنی، حقوق تجارت، حقوق بین‌الملل، حقوق ادبیات و فلسفه حقوق، حقوق تاریخ و روش تحقیق، حقوق آموزش و پرورش، حقوق دولتی و حقوق قضایی)
در صورتی که در هیچ یک از دوره‌های تخصصی فوق‌الذکر شرکت نکرده باشد، باید در دوره‌های عمومی فوق‌الذکر شرکت نماید.
(تغییرات دوره‌ها)

05 تعداد ساعات در هر دوره :

.....
.....
.....

تأیید صلاحیت برای دوره‌های تخصصی

06 تعداد ساعات در هر دوره تخصصی :

.....
.....
.....

07 ທຳປະຕິບັດໜ້າທີ່ຂອງນັກກວດກາຄຸນນະພາບພະນັກງານລັດຖະບານ:

				ນັກກວດກາຄຸນນະພາບ (ທ່ານ ສິງທິພອນ) :
	ຈຳນວນ :		ຈຳນວນ ທີ່ສຳເລັດ :	ເອກະຊົນ / ກຸ່ມ / ອື່ນໆ :
			ສະຖານທີ່ / ທ່ານ ທີ່ກວດກາ :	ຈຳນວນ ທີ່ສຳເລັດ :
			ຊື່ ທ່ານ ທີ່ກວດກາ :	
			ຊື່ ທ່ານ ທີ່ກວດກາ :	
			ສະຖານທີ່ / ທ່ານ ທີ່ກວດກາ :	ຈຳນວນ ທີ່ສຳເລັດ :
			ຊື່ ທ່ານ ທີ່ກວດກາ :	
			ຊື່ ທ່ານ ທີ່ກວດກາ :	
		ຈຳນວນ ທີ່ສຳເລັດ :		
			ສະຖານທີ່ / ທ່ານ ທີ່ກວດກາ :	

08 ໜ້າທີ່ຂອງນັກກວດກາຄຸນນະພາບ:

□ ນັກກວດກາຄຸນນະພາບ ຕ້ອງສ້າງຄວາມກະຕືລື�ອນໃຫ້ມີປະສິດທິພາບສູງຂອງພະນັກງານລັດຖະບານ.

1. ຈຳນວນ ທີ່ສຳເລັດ ທີ່ກວດກາ :
 2. ກຸ່ມ ທີ່ສຳເລັດ ທີ່ກວດກາ ທີ່ສຳເລັດ :
 3. ຈຳນວນ ທີ່ສຳເລັດ ທີ່ກວດກາ ທີ່ກວດກາ ທີ່ສຳເລັດ ທີ່ກວດກາ ?
- ຊື່ ທ່ານ ທີ່ກວດກາ : _____
- ວັນທີ : _____
- ຊື່ ທ່ານ ທີ່ກວດກາ ທີ່ສຳເລັດ : _____
- ສະຖານທີ່ / ທ່ານ ທີ່ກວດກາ ທີ່ສຳເລັດ : _____

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ



ދިވެހިރާއްޖޭގެ ޖުޖުމްހޫރިއްޔާ ގުޅިގެން ސަރުކާރުގެ ޖުޖުމްހޫރިއްޔާ

ގާނޫނީ ސަރުކާރުގެ ޖުޖުމްހޫރިއްޔާ

ދިވެހިރާއްޖޭގެ ޖުޖުމްހޫރިއްޔާ

..... ފޮޓޯ ޖެޓްކުރުމަށް :

ފޮޓޯ ޖެޓްކުރުމަށް ވާނެ ގޮތް ދައްކާ ގޮތް ސަރުކާރުގެ ޖުޖުމްހޫރިއްޔާ

ފޮޓޯ 41 (ގާނޫނީ ސަރުކާރުގެ ޖުޖުމްހޫރިއްޔާ 280-ގ)



ފޮޓޯ ޖެޓްކުރުމަށް

ފޮޓޯ ޖެޓްކުރުމަށް

ފޮޓޯ

ފޮޓޯ ޖެޓްކުރުމަށް

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ



අභ්‍යන්තර අධිකරණ පදනමේ විනිසුරු මණ්ඩලය

1111, රාජකාරි,

ප්‍රදේශීය නගරය.

..... : අයදුම් පත්‍රය

විනිසුරු මණ්ඩලයේ සේවයේ යොමුවීමේ කොන්දේසි

අයදුම් 42 (රාජකාරි විනිසුරු මණ්ඩලයේ සේවයේ යොමුවීමේ කොන්දේසි 2810 - (ර))

විනිසුරු මණ්ඩලය

ප්‍රදේශීය නගරය, කොමන්ඩෝ

අයිර

ප්‍රදේශීය නගරය, කොමන්ඩෝ

විනිසුරු

1. අයදුම් පත්‍රයේ මිලදී ගැනීමේ මුදල 25.00 (වසරයේ මුදල) ප්‍රදානය කළ යුතුය.
2. අයදුම්කරු විනිසුරු මණ්ඩලයේ සේවයේ යොමුවීමේ කොන්දේසි ක්‍රියාත්මක කිරීමේදී සහභාගී විය යුතුය.
3. අයදුම්කරු විනිසුරු මණ්ඩලයේ සේවයේ යොමුවීමේ කොන්දේසි ක්‍රියාත්මක කළ යුතුය.
4. අයදුම්කරු විනිසුරු මණ්ඩලයේ සේවයේ යොමුවීමේ කොන්දේසි ක්‍රියාත්මක කළ යුතුය. 12 ක්‍රමයක් සහිතව, අයදුම්කරු විනිසුරු මණ්ඩලයේ සේවයේ යොමුවීමේ කොන්දේසි ක්‍රියාත්මක කළ යුතුය.

سٺو:

.....

اٺو: ٺاڻ سٺو مهري:

.....

ٽيٽي سٺو مهري سٺو مهري؛

.....

سٺو مهري سٺو مهري:

.....

دسو مهري سٺو مهري سٺو مهري سٺو مهري سٺو مهري سٺو مهري سٺو مهري:

.....

سٺو:

.....

اٺو: ٺاڻ سٺو مهري:

.....

ٽيٽي سٺو مهري سٺو مهري؛

.....

سٺو مهري سٺو مهري:

.....

دسو مهري سٺو مهري سٺو مهري سٺو مهري سٺو مهري سٺو مهري سٺو مهري:

.....

06 سٺو مهري سٺو مهري سٺو مهري سٺو مهري سٺو مهري سٺو مهري سٺو مهري سٺو مهري

سٺو مهري؛

..... 1. دسو مهري سٺو مهري سٺو مهري:

..... 2. سٺو مهري:

..... 3. سٺو مهري سٺو مهري:

..... 4. دسو مهري سٺو مهري سٺو مهري:

..... 5. دسو مهري سٺو مهري سٺو مهري:

07 ክምፍፍላዎችን ለማስወገድ የሚያስፈልገውን ጊዜ ለማሳዘን ያለውን ጥረት

ማሳዘን የሚችል ጊዜ ለማሳዘን ጥረት ያለውን ጥራት ያሳያል።

..... ጊዜ ለማሳዘን ጥረት ያለውን ጥራት ያሳያል።

የሚከተሉትን ጊዜዎች ያሳያል፡

..... ጊዜ፡

..... ጊዜ ያለውን ጥራት ያሳያል።

የሚከተሉትን ጊዜዎች ያሳያል፡

ማሳዘን የሚችል ጊዜ ለማሳዘን ጥረት ያለውን ጥራት ያሳያል።

የሚከተሉት ጊዜዎች ለማሳዘን ጥረት ያለውን ጥራት ያሳያል።

ለማሳዘን ጥረት ያለውን ጥራት ያሳያል።

08 የሚከተሉትን ጊዜዎች ለማሳዘን ጥረት ያለውን ጥራት ያሳያል።

ጊዜ ለማሳዘን ጥረት ያለውን ጥራት ያሳያል።

ጊዜ ለማሳዘን ጥረት ያለውን ጥራት ያሳያል።

..... (ሌሎች ጊዜዎችን ያሳያል)።

09 ክምፍፍላዎችን ለማስወገድ የሚያስፈልገውን ጊዜ ለማሳዘን ያለውን ጥረት

(ይህንን ጊዜ ለማሳዘን ጥረት ያለውን ጥራት ያሳያል።)

372 መንግሥት ደንብ በመሠረት ለማሳዘን ጥረት ያለውን ጥራት ያሳያል።

.....
.....
.....

10 ក្រសួងយុត្តិធម៌ និង ការពារជាតិ (អគ្គនាយកដ្ឋានយុត្តិធម៌ និង ការពារជាតិ)

1. ក្រសួងយុត្តិធម៌ និង ការពារជាតិ យល់ឃើញ ថា ការដោះស្រាយ ជម្លោះ តាមរយៈ តុលាការ គឺជា របៀប យល់ឃើញ ត្រឹមត្រូវ បំផុត ដើម្បី រក្សា ទុក ឱ្យ មាន លទ្ធភាព យល់ឃើញ ត្រឹមត្រូវ បំផុត ប្រសិន បើ គ្មាន ការ ដោះស្រាយ ជម្លោះ តាមរយៈ តុលាការ ទេ

☐ ក្រសួង យុត្តិធម៌ និង ការពារជាតិ យល់ឃើញ ថា

☐ ក្រសួង យុត្តិធម៌ និង ការពារជាតិ យល់ឃើញ ថា

..... ក្រសួង យុត្តិធម៌ និង ការពារជាតិ យល់ឃើញ ថា

..... ក្រសួង យុត្តិធម៌ និង ការពារជាតិ យល់ឃើញ ថា

..... ស្រាប់ ទៅ ហើយ

..... ទី ថ្ងៃ ខែ ឆ្នាំ ដើម្បី បញ្ជាក់ ថា

..... យល់ឃើញ ថា ក្រសួង យុត្តិធម៌ និង ការពារជាតិ យល់ឃើញ ថា

..... ក្រសួង យុត្តិធម៌ និង ការពារជាតិ យល់ឃើញ ថា

2. ក្រសួងយុត្តិធម៌ និង ការពារជាតិ យល់ឃើញ ថា តុលាការ គឺជា របៀប យល់ឃើញ ត្រឹមត្រូវ បំផុត ដើម្បី រក្សា ទុក ឱ្យ មាន លទ្ធភាព យល់ឃើញ ត្រឹមត្រូវ បំផុត ប្រសិន បើ គ្មាន ការ ដោះស្រាយ ជម្លោះ តាមរយៈ តុលាការ ទេ

.....
.....
.....

3. អង្គការ យុត្តិធម៌ និង ការពារជាតិ យល់ឃើញ ថា

(ក្រសួងយុត្តិធម៌ និង ការពារជាតិ យល់ឃើញ ថា តុលាការ គឺជា របៀប យល់ឃើញ ត្រឹមត្រូវ បំផុត ដើម្បី រក្សា ទុក ឱ្យ មាន លទ្ធភាព យល់ឃើញ ត្រឹមត្រូវ បំផុត ប្រសិន បើ គ្មាន ការ ដោះស្រាយ ជម្លោះ តាមរយៈ តុលាការ ទេ)

ក្រសួង យុត្តិធម៌ និង ការពារជាតិ យល់ឃើញ ថា តុលាការ គឺជា របៀប យល់ឃើញ ត្រឹមត្រូវ បំផុត ដើម្បី រក្សា ទុក ឱ្យ មាន លទ្ធភាព យល់ឃើញ ត្រឹមត្រូវ បំផុត ប្រសិន បើ គ្មាន ការ ដោះស្រាយ ជម្លោះ តាមរយៈ តុលាការ ទេ

.....
.....
.....
.....
.....

د قوډي پر مهال د دودونو په څېر د دودونو لاندې د دودونو پر مهال د دودونو لاندې.

سټور:

سټور:

د دودونو پر مهال د دودونو لاندې.

سټور:

د دودونو پر مهال د دودونو لاندې:

1. د دودونو پر مهال د دودونو لاندې د دودونو لاندې د دودونو لاندې د دودونو لاندې.
2. د دودونو پر مهال د دودونو لاندې د دودونو لاندې د دودونو لاندې د دودونو لاندې.
3. د دودونو پر مهال د دودونو لاندې د دودونو لاندې د دودونو لاندې د دودونو لاندې.

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ



അബ്രഹാം അമിന്ദൂ അമിന്ദൂ കോടതി

നമ്പർ: 2023

മുദ്രാസംഖ്യ: 2023

.....: 2023

അമിന്ദൂ കോടതി

43 (280 (2023))

പ്രമേയം:

1. 2023 മുൻപ് അമിന്ദൂ കോടതിയിൽ നൽകിയ കേസുകൾ.
2. 2023 മുൻപ് അമിന്ദൂ കോടതിയിൽ നൽകിയ കേസുകൾ, 12 മാർച്ച് 2023 മുൻപ് അമിന്ദൂ കോടതിയിൽ നൽകിയ കേസുകൾ.
3. 2023 മുൻപ് അമിന്ദൂ കോടതിയിൽ നൽകിയ കേസുകൾ, 2023 മുൻപ് അമിന്ദൂ കോടതിയിൽ നൽകിയ കേസുകൾ.

<p>دښتور څه سوږه سره سره</p>	<p>څه سوږه سره سره</p>
<p>مښتور څه سوږه سره سره</p>	
<p>مښتور څه سوږه سره سره</p>	<p>مښتور څه سوږه سره سره</p>
<p>مښتور څه سوږه سره سره</p>	<p>مښتور څه سوږه سره سره</p>
<p>مښتور څه سوږه سره سره</p>	<p>مښتور څه سوږه سره سره</p>
<p>مښتور څه سوږه سره سره</p>	<p>مښتور څه سوږه سره سره</p>
<p>مښتور څه سوږه سره سره</p>	
<p>مښتور څه سوږه سره سره</p>	

ދިވެހި ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި

އިތުރު މަޢުލޫމާތު ހޯއްދެވުމަށް ދަންނަވަމެވެ.

އިތުރު މަޢުލޫމާތު ހޯއްދެވުމަށް ދަންނަވަމެވެ!

އިތުރު މަޢުލޫމާތު ހޯއްދެވުމަށް ދަންނަވަމެވެ!

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ



ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓް ގައި ވަނިވި ފަރާތްތަކުގެ ނަންބަރު ބަދަލުކުރުމުގެ ފޮޓޯ ލިޔުމުގެ ފޯމު

އަދަދު: 44

ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓް ގައި ވަނިވި ފަރާތްތަކުގެ ނަންބަރު ބަދަލުކުރުމުގެ ފޮޓޯ ލިޔުމުގެ ފޯމު

.....: ފޮޓޯ ލިޔުމުގެ ފޯމު

ފޯމު 44 (ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓް ގައި ވަނިވި ފަރާތްތަކުގެ ނަންބަރު ބަދަލުކުރުމުގެ ފޮޓޯ ލިޔުމުގެ ފޯމު)

ފޯމު 44 (ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓް ގައި ވަނިވި ފަރާތްތަކުގެ ނަންބަރު ބަދަލުކުރުމުގެ ފޮޓޯ ލިޔުމުގެ ފޯމު - 306)

ފޯމު 44 ގައި ބަޔާންކުރި ފަރާތްތަކުގެ ނަންބަރު ބަދަލުކުރުމުގެ ފޮޓޯ ލިޔުމުގެ ފޯމު:

ފޯމު 44 ގައި ބަޔާންކުރި ފަރާތްތަކުގެ ނަންބަރު ބަދަލުކުރުމުގެ ފޮޓޯ ލިޔުމުގެ ފޯމު:

ފޯމު 44

ފޯމު 44 ގައި ބަޔާންކުރި ފަރާތްތަކުގެ ނަންބަރު ބަދަލުކުރުމުގެ ފޮޓޯ ލިޔުމުގެ ފޯމު:

			01-01-01-01-01 : (01-01-01-01-01)
	01-01-01-01-01 : 01-01-01-01-01	01-01-01-01-01 : 01-01-01-01-01	01-01-01-01-01 : 01-01-01-01-01
		01-01-01-01-01 : 01-01-01-01-01	01-01-01-01-01 : 01-01-01-01-01
		01-01-01-01-01 : 01-01-01-01-01	
		01-01-01-01-01 : 01-01-01-01-01	
		01-01-01-01-01 : 01-01-01-01-01	01-01-01-01-01 : 01-01-01-01-01
		01-01-01-01-01 : 01-01-01-01-01	
		01-01-01-01-01 : 01-01-01-01-01	
		01-01-01-01-01 : 01-01-01-01-01	01-01-01-01-01 : 01-01-01-01-01
			01-01-01-01-01 : 01-01-01-01-01

			02-02-02-02-02 : (02-02-02-02-02)
	02-02-02-02-02 : 02-02-02-02-02	02-02-02-02-02 : 02-02-02-02-02	02-02-02-02-02 : 02-02-02-02-02
		02-02-02-02-02 : 02-02-02-02-02	02-02-02-02-02 : 02-02-02-02-02
		02-02-02-02-02 : 02-02-02-02-02	
		02-02-02-02-02 : 02-02-02-02-02	
		02-02-02-02-02 : 02-02-02-02-02	02-02-02-02-02 : 02-02-02-02-02
		02-02-02-02-02 : 02-02-02-02-02	
		02-02-02-02-02 : 02-02-02-02-02	
		02-02-02-02-02 : 02-02-02-02-02	02-02-02-02-02 : 02-02-02-02-02
			02-02-02-02-02 : 02-02-02-02-02

01 Գործի մաս Գործարար

		Գործարարի անուն (Գործարարի անուն) :	
	Գործարարի անուն :	Գործարարի անուն :	Գործարարի անուն / Գործարարի անուն :
		Կամ անուն / Գործարարի անուն :	
		Գործարարի անուն :	Գործարարի անուն :
		Գործարարի անուն :	
		Կամ անուն / Գործարարի անուն :	
		Գործարարի անուն :	Գործարարի անուն և անուն :
		Գործարարի անուն :	
		Գործարարի անուն և անուն :	Գործարարի անուն և անուն :
		Գործարարի անուն և անուն :	
	<input type="checkbox"/> Գործարարի անուն և անուն	<input type="checkbox"/> Գործարարի անուն և անուն	Գործարարի անուն և անուն :
			Գործարարի անուն և անուն և անուն և անուն և անուն և անուն և անուն :

02 Գործի մաս Գործարար

		Գործարարի անուն (Գործարարի անուն) :	
	Գործարարի անուն :	Գործարարի անուն :	Գործարարի անուն / Գործարարի անուն :
		Կամ անուն / Գործարարի անուն :	
		Գործարարի անուն :	Գործարարի անուն և անուն :
		Գործարարի անուն :	
		Կամ անուն / Գործարարի անուն :	
		Գործարարի անուն :	Գործարարի անուն և անուն :
		Գործարարի անուն :	
		Գործարարի անուն և անուն :	Գործարարի անուն և անուն :
		Գործարարի անուն և անուն :	
	<input type="checkbox"/> Գործարարի անուն և անուն	<input type="checkbox"/> Գործարարի անուն և անուն	Գործարարի անուն և անուն :
			Գործարարի անուն և անուն և անուն և անուն և անուն և անուն և անուն :

05 ޖުމްހޫރީ ނަންބަރު ދަށުގެ ޖުމްހޫރީ ނަންބަރު ޖަހާ ފަރާތްތަކުގެ ފަންނުގެ ބަޔާން

..... : ނަންބަރު

..... : ޖުމްހޫރީ ނަންބަރު | ޖުމްހޫރީ ނަންބަރު

..... : ޖުމްހޫރީ ނަންބަރު

..... : ޖުމްހޫރީ ނަންބަރު

..... : ޖުމްހޫރީ ނަންބަރު | ޖުމްހޫރީ ނަންބަރު

06 ޖުމްހޫރީ ނަންބަރު ދަށުގެ ޖުމްހޫރީ ނަންބަރު ޖަހާ ފަރާތްތަކުގެ ފަންނުގެ ބަޔާން

..... : 6. ޖުމްހޫރީ ނަންބަރު

..... : 7. ޖުމްހޫރީ ނަންބަރު ޖަހާ ފަރާތްތަކުގެ ފަންނުގެ ބަޔާން

..... : 8. ޖުމްހޫރީ ނަންބަރު

..... : 9. ޖުމްހޫރީ ނަންބަރު

..... : 10. ޖުމްހޫރީ ނަންބަރު

..... : 11. ޖުމްހޫރީ ނަންބަރު

07 ޖުމްހޫރީ ނަންބަރު ދަށުގެ ޖުމްހޫރީ ނަންބަރު ޖަހާ ފަރާތްތަކުގެ ފަންނުގެ ބަޔާން

.....
.....
.....

08 دَوْرَاتِ الرَّجَالِ وَالنِّسَاءِ فِي تَحْقِيقِ الْجُنُوحِ :

- 1.
- 2.
- 3.

09 كَيْفِيَّةُ تَحْقِيقِ الْمَجْرِمِينَ فِي تَحْقِيقِ الْمَذْهَبِ :

مَبْدَئُ الرَّجَالِ وَالنِّسَاءِ فِي تَحْقِيقِ الْمَجْرِمِينَ فِي تَحْقِيقِ الْمَذْهَبِ

كَيْفِيَّةُ تَحْقِيقِ الْمَجْرِمِينَ فِي تَحْقِيقِ الْمَذْهَبِ :

تَحْقِيقِ الْمَجْرِمِينَ فِي تَحْقِيقِ الْمَذْهَبِ فِي تَحْقِيقِ الْمَجْرِمِينَ فِي تَحْقِيقِ الْمَذْهَبِ :
سُئِلَ :

أَجَابَ :

كَيْفِيَّةُ تَحْقِيقِ الْمَجْرِمِينَ فِي تَحْقِيقِ الْمَذْهَبِ فِي تَحْقِيقِ الْمَجْرِمِينَ فِي تَحْقِيقِ الْمَذْهَبِ :

مَبْدَئُ الرَّجَالِ وَالنِّسَاءِ فِي تَحْقِيقِ الْمَجْرِمِينَ فِي تَحْقِيقِ الْمَذْهَبِ

كَيْفِيَّةُ تَحْقِيقِ الْمَجْرِمِينَ فِي تَحْقِيقِ الْمَذْهَبِ فِي تَحْقِيقِ الْمَجْرِمِينَ فِي تَحْقِيقِ الْمَذْهَبِ

كَيْفِيَّةُ تَحْقِيقِ الْمَجْرِمِينَ فِي تَحْقِيقِ الْمَذْهَبِ فِي تَحْقِيقِ الْمَجْرِمِينَ فِي تَحْقِيقِ الْمَذْهَبِ

10 الْمَجْرِمُونَ فِي تَحْقِيقِ الْمَجْرِمِينَ فِي تَحْقِيقِ الْمَذْهَبِ :

مَبْدَئُ الرَّجَالِ وَالنِّسَاءِ فِي تَحْقِيقِ الْمَجْرِمِينَ فِي تَحْقِيقِ الْمَذْهَبِ

كَيْفِيَّةُ تَحْقِيقِ الْمَجْرِمِينَ فِي تَحْقِيقِ الْمَذْهَبِ فِي تَحْقِيقِ الْمَجْرِمِينَ فِي تَحْقِيقِ الْمَذْهَبِ

أَجَابَ : (كَيْفِيَّةُ تَحْقِيقِ الْمَجْرِمِينَ فِي تَحْقِيقِ الْمَذْهَبِ)

11 תְּרִבּוּת לַמֵּטְרָה וְהִתְרַשְׁטוּת הַמֵּטְרָה הַמִּזְרֵה עָלֵי כְּתֻבֵּי הַמֵּטְרָה הַמִּזְרֵה :

.....
.....
.....

12 הִתְרַשְׁטוּת הַמֵּטְרָה בְּלִי פִּירְסוֹנְהָ עָלֵי כְּתֻבֵּי הַמֵּטְרָה הַמִּזְרֵה הַמִּזְרֵה :

(הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה)
הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה)

.....
.....
.....

13 תְּרִבּוּת הַמֵּטְרָה הַמִּזְרֵה (הַמִּזְרֵה הַמִּזְרֵה) :

1. תְּרִבּוּת הַמֵּטְרָה הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה :

תְּרִבּוּת הַמֵּטְרָה הַמִּזְרֵה

תְּרִבּוּת הַמֵּטְרָה הַמִּזְרֵה

תְּרִבּוּת הַמֵּטְרָה הַמִּזְרֵה :

תְּרִבּוּת הַמֵּטְרָה הַמִּזְרֵה :

תְּרִבּוּת :

הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה :

תְּרִבּוּת הַמֵּטְרָה הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה :

תְּרִבּוּת הַמֵּטְרָה הַמִּזְרֵה הַמִּזְרֵה הַמִּזְרֵה :

..... :

.....

.....

..... :

..... :

..... :

..... :

..... :

..... :

.....

1.
.....
.....

2.
.....

3.
.....

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ



අභ්‍යන්තර අධිකරණ පදනමේ විභාග පිටුව

1. රා. රජයේ,

ප්‍රවෘත්තිය.

..... : විභාග පිටුව

විභාග පිටුවේ විධිවිධාන

විභාග පිටුව (46 ක්) (රජයේ අභ්‍යන්තර අධිකරණ පදනමේ)

විභාග පිටුවේ විධිවිධාන

1. විභාග පිටුවේ විධිවිධාන

2. විභාග පිටුවේ විධිවිධාන

3. විභාග පිටුවේ විධිවිධාන

4. විභාග පිටුවේ විධිවිධාන

5. විභාග පිටුවේ විධිවිධාන

6. විභාග පිටුවේ විධිවිධාන

7. විභාග පිටුවේ විධිවිධාන

8. විභාග පිටුවේ විධිවිධාන

9. විභාග පිටුවේ විධිවිධාන

10. විභාග පිටුවේ විධිවිධාන

11. විභාග පිටුවේ විධිවිධාන

12. විභාග පිටුවේ විධිවිධාන

13. විභාග පිටුවේ විධිවිධාන

14. විභාග පිටුවේ විධිවිධාන

15. විභාග පිටුවේ විධිවිධාන

16. විභාග පිටුවේ විධිවිධාන

17. විභාග පිටුවේ විධිවිධාන

18. විභාග පිටුවේ විධිවිධාන

19. විභාග පිටුවේ විධිවිධාන

20. විභාග පිටුවේ විධිවිධාන

21. විභාග පිටුවේ විධිවිධාන

22. විභාග පිටුවේ විධිවිධාන

23. විභාග පිටුවේ විධිවිධාන

24. විභාග පිටුවේ විධිවිධාන

25. විභාග පිටුවේ විධිවිධාන

26. විභාග පිටුවේ විධිවිධාන

27. විභාග පිටුවේ විධිවිධාන

28. විභාග පිටුවේ විධිවිධාන

29. විභාග පිටුවේ විධිවිධාන

30. විභාග පිටුවේ විධිවිධාන

31. විභාග පිටුවේ විධිවිධාන

32. විභාග පිටුවේ විධිවිධාන

33. විභාග පිටුවේ විධිවිධාන

34. විභාග පිටුවේ විධිවිධාන

35. විභාග පිටුවේ විධිවිධාන

36. විභාග පිටුවේ විධිවිධාන

37. විභාග පිටුවේ විධිවිධාන

38. විභාග පිටුවේ විධිවිධාන

39. විභාග පිටුවේ විධිවිධාන

40. විභාග පිටුවේ විධිවිධාන

41. විභාග පිටුවේ විධිවිධාන

42. විභාග පිටුවේ විධිවිධාන

43. විභාග පිටුවේ විධිවිධාන

44. විභාග පිටුවේ විධිවිධාන

45. විභාග පිටුවේ විධිවිධාන

46. විභාග පිටුවේ විධිවිධාන

ՏՐՈՒՄ

ՊՏ

Կրճճ Երևանի քաղաքի քաղաքացիական իրավունքների պաշտպանության կոմիտեի կողմից կատարվող հարցազրույցի արձանագրություն:
Տեղեկություններ հարցազրույցի մասին կարելի է ստանալ հետևյալ հեռախոսային համարով:

Վարչապետի քաղաքացիական իրավունքների պաշտպանության կոմիտեի կողմից կատարվող հարցազրույցի արձանագրություն

Հիմնադրվել է 2017 թվականի մարտի 28-ին ՀՀ Վարչապետի կողմից կատարվող հարցազրույցի արձանագրությունը:
Հարցազրույցի նպատակն է հավաքել և քննարկել քաղաքացիների կողմից քաղաքացիական իրավունքների պաշտպանության կոմիտեի կողմից կատարվող հարցազրույցի արձանագրության մասին արձանագրությունը:

Նշված հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրությունը կատարվել է:

<p>Նշված հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրությունը կատարվել է:</p>	<p>Նշված հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրությունը կատարվել է:</p>
--	--

Հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրությունը կատարվել է:

Հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրությունը կատարվել է:

Հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրությունը կատարվել է:

Հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրությունը կատարվել է:

<p>Հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրությունը կատարվել է:</p>	<p>Հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրությունը կատարվել է:</p>
--	--

Հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրությունը կատարվել է:

Հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրությունը կատարվել է:

Հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրությունը կատարվել է:

Հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրությունը կատարվել է:

Հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրության մասին հարցազրույցի արձանագրությունը կատարվել է:

රෝමයේ ප්‍රධාන නගරය

ආදායම් මට්ටම

ආදායම් මට්ටම මෙහි දැක්වූ පරිදි වුවද, ආදායම් මට්ටම වෙනස් වුවහොත්, ආදායම් මට්ටම වෙනස් කිරීමට අවස්ථාවක් ඇති බවට සඳහන් කරන්න.

ආදායම් මට්ටම වෙනස් කිරීමට අවස්ථාවක් ඇති බවට සඳහන් කරන්න.

ආදායම් මට්ටම වෙනස් කිරීමට අවස්ථාවක් ඇති බවට සඳහන් කරන්න.

ආදායම් මට්ටම වෙනස් කිරීමට අවස්ථාවක් ඇති බවට සඳහන් කරන්න.

ආදායම් මට්ටම වෙනස් කිරීමට අවස්ථාවක් ඇති බවට සඳහන් කරන්න.

වෙනත් විස්තර

වෙනත් විස්තර

වෙනත් විස්තර

වෙනත් විස්තර

වෙනත් විස්තර

වෙනත් විස්තර

වෙනත් විස්තර

වෙනත් විස්තර

වෙනත් විස්තර

වෙනත් විස්තර

1. Գործը արդարևո՞ւմ է արդարացի և արդարադատ: Եթե ոչ, ապա ի՞նչ է պատճառը:

2. Գործը արդարևո՞ւմ է արդարացի և արդարադատ: Եթե ոչ, ապա ի՞նչ է պատճառը:

3. Գործը արդարևո՞ւմ է արդարացի և արդարադատ: Եթե ոչ, ապա ի՞նչ է պատճառը:

Արժեքներ և անհամաձայնություններ

4. Գործը արդարևո՞ւմ է արդարացի և արդարադատ: Եթե ոչ, ապա ի՞նչ է պատճառը:

5. Գործը արդարևո՞ւմ է արդարացի և արդարադատ: Եթե ոչ, ապա ի՞նչ է պատճառը:

Նշանակում:

	Գործը արդարևո՞ւմ է արդարացի և արդարադատ:	Գործը արդարևո՞ւմ է արդարացի և արդարադատ:
		Գործը արդարևո՞ւմ է արդարացի և արդարադատ:



அமைச்சர் அலுவலகம், ராஜ்ய சட்ட அமைச்சு

மா. ரா. அமைச்சர்,

சட்ட அமைச்சு.

..... : சட்ட அமைச்சர் :

அமைச்சர் அலுவலகம், ராஜ்ய சட்ட அமைச்சு

48 சட்ட

[Empty rectangular box]

சட்ட அமைச்சர் :

..... : சட்ட அமைச்சர் :

மா. ரா.

..... : சட்ட அமைச்சர் :

அமைச்சர் :

1. சட்ட அமைச்சர் அலுவலகம், ராஜ்ய சட்ட அமைச்சு : -/25 (சட்ட அமைச்சர் அலுவலகம்)
2. சட்ட அமைச்சர் அலுவலகம், ராஜ்ய சட்ட அமைச்சு, சட்ட அமைச்சர் அலுவலகம், ராஜ்ய சட்ட அமைச்சு.
3. சட்ட அமைச்சர் அலுவலகம், ராஜ்ய சட்ட அமைச்சு, சட்ட அமைச்சர் அலுவலகம், ராஜ்ய சட்ட அமைச்சு.
4. சட்ட அமைச்சர் அலுவலகம், ராஜ்ய சட்ட அமைச்சு, சட்ட அமைச்சர் அலுவலகம், ராஜ்ய சட்ட அமைச்சு, 12 சட்ட அமைச்சர் அலுவலகம், ராஜ்ய சட்ட அமைச்சு.
5. சட்ட அமைச்சர் அலுவலகம், ராஜ்ய சட்ட அமைச்சு, சட்ட அமைச்சர் அலுவலகம், ராஜ்ய சட்ட அமைச்சு, சட்ட அமைச்சர் அலுவலகம், ராஜ்ய சட்ட அமைச்சு.

			ډولنې ډولنې (ډولنې ډولنې) :
	ډولنې :	ډولنې ډولنې :	ډولنې ډولنې / ډولنې ډولنې ډولنې :
			ډولنې ډولنې / ډولنې ډولنې ډولنې :
			ډولنې ډولنې ډولنې :
			ډولنې ډولنې :
			ډولنې ډولنې / ډولنې ډولنې ډولنې :
			ډولنې ډولنې ډولنې :
			ډولنې ډولنې :
		ډولنې ډولنې ډولنې :	ډولنې ډولنې ډولنې :
<input type="checkbox"/> ډولنې ډولنې ډولنې	<input type="checkbox"/> ډولنې ډولنې ډولنې		ډولنې ډولنې ډولنې ډولنې :
			ډولنې ډولنې ډولنې ډولنې ډولنې ډولنې ډولنې ډولنې :

			ډولنې ډولنې (ډولنې ډولنې) :
	ډولنې :	ډولنې ډولنې :	ډولنې ډولنې / ډولنې ډولنې ډولنې :
			ډولنې ډولنې / ډولنې ډولنې ډولنې :
			ډولنې ډولنې ډولنې :
			ډولنې ډولنې :
			ډولنې ډولنې / ډولنې ډولنې ډولنې :
			ډولنې ډولنې ډولنې :
			ډولنې ډولنې :
		ډولنې ډولنې ډولنې :	ډولنې ډولنې ډولنې :
<input type="checkbox"/> ډولنې ډولنې ډولنې	<input type="checkbox"/> ډولنې ډولنې ډولنې		ډولنې ډولنې ډولنې ډولنې :

03 دایره سواری سواری :

.....
.....
.....
.....
.....

04 لائسنس سواری سواری :

.....
.....
.....
.....
.....

05 دایره سواری سواری سواری :

.....
.....
.....
.....
.....

1. **අනුමැතිය :**

දින 05 ක් ඉදිරිපත් කර ඇති අයදුම් පත්රයේ සඳහන් කර ඇති කරුණු සහ අදාළ තොරතුරු සලකා බැලීමේදී,

සාධක :

සාධක :

දින 05 ක් ඉදිරිපත් කර ඇති අයදුම් පත්රයේ සඳහන් කර ඇති කරුණු සහ අදාළ තොරතුරු සලකා බැලීමේදී,

සාධක :

2. විනිසුරු විනිසුරු සභාවේ විනිසුරු සභාවේ සාධක :

1. **විනිසුරු විනිසුරු සභාවේ විනිසුරු සභාවේ සාධක :** (ඉදිරිපත් කර ඇති අයදුම් පත්රයේ සඳහන් කර ඇති කරුණු සහ අදාළ තොරතුරු සලකා බැලීමේදී,)

විනිසුරු විනිසුරු සභාවේ විනිසුරු සභාවේ සාධක : විනිසුරු විනිසුරු සභාවේ විනිසුරු සභාවේ සාධක : විනිසුරු විනිසුරු සභාවේ විනිසුරු සභාවේ සාධක :

විනිසුරු විනිසුරු සභාවේ විනිසුරු සභාවේ සාධක :

2. **විනිසුරු විනිසුරු සභාවේ විනිසුරු සභාවේ සාධක :** විනිසුරු විනිසුරු සභාවේ විනිසුරු සභාවේ සාධක : විනිසුරු විනිසුරු සභාවේ විනිසුරු සභාවේ සාධක :

විනිසුරු විනිසුරු සභාවේ විනිසුරු සභාවේ සාධක : විනිසුරු විනිසුරු සභාවේ විනිසුරු සභාවේ සාධක : විනිසුරු විනිසුරු සභාවේ විනිසුරු සභාවේ සාධක :

3. **විනිසුරු විනිසුරු සභාවේ විනිසුරු සභාවේ සාධක :** විනිසුරු විනිසුරු සභාවේ විනිසුරු සභාවේ සාධක : විනිසුරු විනිසුරු සභාවේ විනිසුරු සභාවේ සාධක :